

# ડાયાબિટીસ

ડૉ. કેતન અવેરી  
ભણાશાળી ટ્રસ્ટ સંચાલિત  
જુવન શૈલી કિલનિક, સુરત.

# ડાયાબિટીસ

## અનુક્રમણિકા

ડાયાબિટીસ એટલે શું ? .....	.. ૩
તંદુરસ્ત માણસનાં લોહી - પેશાબમાં નોર્મલ શુગર ટેટલી હોય? .....	.. ૩
કેટલાથી વધુ શુગર હોય તો ડાયાબિટીસ કહેવાય? .....	૪
ડાયાબિટીસના પ્રકારો .....	૬
બળપણમાં ડાયાબિટીસ થવાનું કારણ શું? .....	૮
પુખ્તવયે ડાયાબિટીસ થવાનું કારણ શું? .....	૧૦
ડાયાબિટીસને ઓળખવો કઈ રીતે? .....	૧૩
ડાયાબિટીસને કાબૂમાં રાખવામાં ન આવે તો શું તકલીફ થાય? .....	૧૬
જલુકોગ્ની મોટી વધ્યાટને કારણે ઉદ્ભબતી બેલાનાવસ્થા .....	૨૨
ડાયાબિટીસની સારવાર .....	૨૫
ડાયાબિટીસનાં દર્દીઓએ ખોરાકમાં શું પરેજ રાખવી જોઈએ? .....	૨૫
ડાયાબિટીસનાં દર્દીઓને ખોરાક અંગે મુંજવતા પ્રશ્નો. ....	૩૩
ખાંડની અવેજીમાં વાપરવા માટે સેકરીન જેવા પદાર્થો .....	૩૮
ડાયાબિટીસમાં કસરતનું મહત્વ .....	૩૯
ડાયાબિટીસમાં વપરાતી દવા - ગોળીઓ .....	૪૧
ડાયાબિટીસનાં દર્દીઓ માટે આશીર્વાદરૂપ ઈન્સ્યુલિનના ઈન્જેક્શન .....	૪૬
સગર્ભાવસ્થા દરમ્યાન ડાયાબિટીસ .....	૪૩
ડાયાબિટીસ સાથેનું જીવન .....	૪૪
ડાયાબિટીસના દર્દીએ લોહી-પેશાબની કઈ તપાસ કરાવતા રહેવુ જોઈએ? .....	૪૪
ડાયાબિટીસના કાબૂની સાથોસાથ અન્ય શું કાળજી રાખવી? .....	૪૬
પુખ્ત વયે ડાયાબિટીસથી બચવુ હોય તો સ્વસ્થ જીવનશૈલી અપનાવો ..	૪૨

# ડાયાબિટીસ

## ડાયાબિટીસ એટલે શું ?

જેને આપણે મધુપ્રમેહની બીમારી તરીકે ઓળખીએ છીએ તે ડાયાબિટીસનું આખું નામ છે 'ડાયાબિટીસ મેલાઈટ્સ'. ડાયાબિટીસ એટલે વધુ પેશાબ અને મેલાઈટ્સ એટલે મીઠું (મધ જેવું) - મધ જેવો મીઠો પેશાબ એટલે મધુપ્રમેહ ઉફ્ફ ડાયાબિટીસ મેલાઈટ્સ. હવે પછી, સરળતા ખાતર માત્ર ડાયાબિટીસ તરીકે જ રોગનો ઉલ્લેખ કર્યો છે.

ડાયાબિટીસના દર્દીમાં, શરીરના ગ્લુકોગ્લનું નિયમન કરનાર અંતઃસ્વાપ ઇન્સ્યુલિનની અછત વર્તિય છે. ઇન્સ્યુલિનનું મુખ્ય કામ ગ્લુકોગ્લના આણુઓ લોહીમાંથી દર્દીના કોષોની અંદર પહોંચાડવાનું છે. ઇન્સ્યુલિનની અછતને લીધે ગ્લુકોગ્લના આણુઓ લોહીમાંથી દર્દીના કોષોની અંદર પહોંચી નથી શકતાં. પરિણામે, શરીરમાં પુષ્ટ પ્રમાણમાં ગ્લુકોગ હોવાં છતાં એનો ઉપયોગ શરીરના કોષો કરી નથી શકતા. શરીરની હાલત ગેરવ્યવસ્થા અને અરાજકતાથી ભરપૂર રાજ્ય જેવી થઈ જાય છે કે જેમાં પુષ્ટ અન્ન પાકતું હોવા છતાં લોકો ભૂખમરાથી મરે છે. શરીરમાં પુષ્ટ ગ્લુકોગ હોવા છતાં ડાયાબિટીસના દર્દીના કોષો ગ્લુકોગ્લના અભાવે ટળવળે છે. લોહીમાં ગ્લુકોગ્લનું પ્રમાણ (૧૮૦ મિ.ગ્રા./ડિ.લી.થી વધારે) વધી જવાથી લોહીમાંનો વધારાનો ગ્લુકોગ પેશાબ વાટે શરીરની બહાર નીકળવા માડે છે. શરીરને પોષણ આપનાર આ મહત્વનો ઘટક આ રીતે વેદ્ધાઈ જવાથી દર્દીની સ્થિતિ કફોરી થઈ જાય છે. એને ખૂબ ખૂબ લાગે છે, તરસ લાગે છે અને ખૂબ પેશાબ થાય છે; અને લાંબે ગાળે આંખ, હદય, કિડની, ચેતાતંતુ વગેરેને નુકસાન થવાથી અનેક કોમ્પ્લિકેશન ઊભા થાય છે.

## તંદુરસ્ત માણસનાં લોહી - પેશાબમાં નોર્મલ શુગર કેટલી હોય?

સૌ પ્રથમ તો 'શુગર' એટલે શું એ સમજ લઈએ. 'શુગર'નો અર્થ ગુજરાતીમાં 'સાકર' કે સંસ્કૃતમાં 'શર્કરા' થઈ શકે. સામાન્ય ચીતે જ્યારે લોહી કે પેશાબમાં રહેલે 'શુગર'ની વાત ચાલતી હોય ત્યારે એ ગ્લુકોગની વાત છે એમ માનતું. ગ્લુકોગ એ શરીરનાં કોષોને શક્તિ પૂરી પાડનારું એક અગત્યનું બળતણ છે. આપણા ખોરાકમાં શક્તિનાં મુખ્ય ગ્રાણ ઘટકો હોય છે - કાર્બોહાઇડ્રેટ; પ્રોટીન અને ચરબી. આ ગ્રાણમાંથી સૌથી વધુ હિસ્સો ધરાવનાર કાર્બોહાઇડ્રેટ જુદા-જુદા અનેક સ્વરૂપે ખોરાકમાં હોય છે. અનાજ, દાળ, બટેટાં, શક્કરિયાં, કંદ, ફળો, શાક વગેરેમાં કાર્બોહાઇડ્રેટનો હિસ્સો ઘણો મોટો હોય છે. જ્યારે જુદા-જુદા સ્વરૂપે કાર્બોહાઇડ્રેટને

ખોરાકમાં લેવામાં આવે ત્યારે ખોરાકનું પાચન થયા પછી છેવટે મોટાભાગનો હિસ્સો ગ્લુકોઝમાં રૂપાંતર પામે છે.

આખી રાત દરમ્યાન કંઈ ખાયું ન હોય તો બીજે દિવસે સવારે ભૂખ્યા પેટે દર ૧૦૦ મિ.લી. લોહીમાં આશરે ૭૫ થી ૧૧૫ મિ.ગ્રા. જેટલો ગ્લુકોઝ ટંડુરસ્ટ વ્યક્તિમાં જેવા મળે છે. ખોરાક લીધા પછી, એમાંથી પચીને છુટો પડેલ ગ્લુકોઝ, બે-ગ્રાણ કલાકના સમયમાં જ લોહીમાં ભળી જાય છે. દરરોજ ખોરાક લીધા પછી આશરે અડધા કલાકથી બે કલાક સુધીના સમય દરમ્યાન લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ખૂબ વધી જાય છે. સામાન્ય રોજિંદો ખોરાક લીધા પછી લે કલાક પછી ટંડુરસ્ટ વ્યક્તિના લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ હંમેશા ૧૪૦ મિ.ગ્રા./ડે.લી. કરતાં ઓછું જ હોય છે; અને આ લે કલાક દરમ્યાનના કોઇપણ સમયે ગ્લુકોઝનું પ્રમાણ ૧૮૦ મિ.ગ્રા./ડે.લી. કરતા ઓછું જ હોય છે. ટંડુરસ્ટ માણસના પેશાબમાં સામાન્ય રીતે બિલકુલ શુગર હોવી ન જોઈએ.

## કેટલાથી વધુ શુગર હોય તો ડાયાબિટીસ કહેવાય?

ડાયાબિટીસના મુખ્ય વિભાગોનું નિદાન કરવા માટે વિશ્વ આરોગ્ય સંરથા (WHO) એ કેટલાંક પ્રમાણ (CRITERIA) નક્કી કર્યા છે. વ્યક્તિના લોહીમાં રહેલ ગ્લુકોઝના પ્રમાણના આધારે આ નિદાન નક્કી થાય છે. લોહીમાં રહેલ ગ્લુકોઝ જુદી જુદી પદ્ધતિઓથી તપાસવામાં આવે છે, પણ સામાન્ય રીતે લેનોરેટરીમાં લોહીનો ખાજમા તરીકે ઓળખાતો ભાગ તપાસવામાં આવતો હોવાથી ખાજમા ગ્લુકોઝનું પ્રમાણ સાથેના કોષ્ટકમાં લીધું છે. જ્યારે ગ્લુકોમીટરથી ગ્લુકોઝ માપવામાં આવે ત્યારે એનું પ્રમાણ આ કોષ્ટકમાં દર્શાવેલ પ્રમાણ કરતાં ૧૫ થી ૨૦ મિ.ગ્રા. ઓછું હોય છે.

## ડાયાબિટીસના નિદાન માટે જરૂરી ગ્લુકોઝનું પ્રમાણ

લોહીમાં ગ્લુકોઝ (મિ.ગ્રા./ડે.લી.)	તંડુરસ્ટ	ડાયાબિટીસ મેલાઇટસ	અપરટું ગ્લુકોઝનિયમન	સગલવિશ્વામાં ડાયાબિટીસ
ભૂખ્યા પેટે(ખોરાક લીધા પછી ૮ થી ૧૪ કલાકે)	૧૧૦ થી ઓછું	૧૨૬ થી ૧૫૦	૧૧૦ થી ૧૨૬	૧૦૫ થી ૧૫૦
ગ્લુકોઝ પીધા પછી અડધા/એક કે દોહર કલાકે	૧૮૦ થી ઓછું	૨૦૦ થી ૧૫૦	૨૦૦ કે તેથી વધુ	૧૮૦ થી ૧૫૦
ગ્લુકોઝ પીધા પછી બે કલાકે	૧૪૦ થી ઓછું	૨૦૦ થી ૧૫૦	૧૪૦ થી ૨૦૦	૧૬૫ થી ૧૫૦
ગ્લુકોઝ પીધા પછી ત્રણ કલાકે	૧૪૦ થી ઓછું			૧૪૫ થી ૧૫૦

## ડાયાબિટીસનું નિદાન કરવા માટેના મુદ્દાઓ:

★ જો બે અલગ અલગ દિવસે, આઈથી ચૌદ કલાક ભૂખ્યા રહ્યા પછી, લોહીમાં ગલુકોજનું પ્રમાણ ૧૨૬ મિ.ગ્રા./ડ.લી. કરતાં વધુ હોય તો એ વ્યક્તિને ડાયાબિટીસ છે એવું કહી શકાય.

★ જો ઓછામાં ઓછી બે વખત, દિવસના કોઈપણ સમયે લોહીમાં ગલુકોજનું પ્રમાણ ૨૦૦ મિ.ગ્રા./ડ.લી. કરતાં વધુ માલૂમ પડે તો એ વ્યક્તિને પણ ડાયાબિટીસ છે એવું કહી શકાય.

★ જ્યારે ગલુકોજનું પ્રમાણ ૧૪૦ થી ૨૦૦ મિ.ગ્રા./ડ.લી.ની વચ્ચે હોય ત્યારે દર્દીનાં લક્ષણોને આધારે અને જરૂર પડ્યે ગલુકોજ પીવડાવીને કરેલ ટેસ્ટને આધારે ડાયાબિટીસ છે કે નહી તે નક્કી કરવું પડે છે.

★ સામાન્ય રીતે લોહીમાં ૧૮૦ મિ.ગ્રા./ડ.લી. કરતાં વધુ ગલુકોજ હોય ત્યારે જ એ પેશાબમાં દેખાય છે. એટલે કોઈ વ્યક્તિના પેશાબમાં ગલુકોજ (શુગર) આવતી હોય તો એને (અમુક અપવાદો બાદ કરતાં) ડાયાબિટીસ હોવાની શક્યતા પૂરેપૂરી રહે છે. પેશાબમાં ગલુકોજ છે કે નહી એ નક્કી કરવું ખૂબ આસાન હોવાથી ઘણી જગ્યાએ ડાયાબિટીસના નિદાનને ચકાસવા માટે પેશાબનો ટેસ્ટ જ કરવામાં આવે છે. આ રીતે કરેલ ટેસ્ટ, લોહીના ટેસ્ટ કરતાં ઓછી ચોક્સાઈવાળી પણ ખૂબ સરળ અને સરસો પડે છે. ઓછી સુવિધાવાળી જગ્યાઓએ (દા.ત. ગામડાઓમાં) આ રીત ઘણી ઉપયોગી થાય છે.

ગલુકોજ પીધા પછી (૧) બે કલાકની અંદરનું અને (૨) બરાબર બે કલાકે લીધેલ સેમ્પલ - આ બંને ૨૦૦થી વધુ ગલુકોજ બતાવે તો તાત્કાલિક ડાયાબિટીસનું નિદાન પાકું થઈ જાય છે. ગલુકોજ પીવડાવ્યા પછી લોહીનો ટેસ્ટ કરાવવો હોય તો એ ટેસ્ટના ઓછામાં ઓછા ગ્રામ દિવસ પહેલાં દર્દીનો ખોરાક તદ્દન સામાન્ય (દિવસના ઓછામાં ઓછા ૧૫૦ ગ્રામ ગલુકોજ ધરાવતો) હોવો જોઈએ. ૨૫૦ થી ૩૦૦ મિ.લી. પાણીમાં ૭૫ ગ્રામ (સગર્ભાવસ્થામાં ૧૦૦ ગ્રામ) ગલુકોજ નાંખીને ટેસ્ટ કરવો જોઈએ.

**જો ઓછામાં ઓછી બે વખત દિવસના કોઈપણ સમયે લોહીમાં ગલુકોજનું પ્રમાણ ૨૦૦ મિ.ગ્રા./ડ.લી. કરતાં વધુ માલૂમ પડે તો એ વ્યક્તિને ડાયાબિટીસ છે.**

## ડાયાબિટીસનો ઇતિહાસ અને આવતી કાલ

પ્રાચીન (ઈ.સ. પૂર્વ ૧૫૦૦) ચીની અને અરેબિક સાહિત્યમાં આ રોગનો ઉલ્લેખ છે. સુશુત (ઈ.સ. પૂર્વ ૪૦૦) અને ચરક (ઈ.સ. ૬)ના ગ્રંથોમાં પણ મધુપ્રમેહનો ઉલ્લેખ આવે છે. આમ, આ રોગ ખૂબ જુનો છે. આજે ભારતમાં ૩૦ થી ૬૪ વર્ષના પુરુષો પૈકી ગામડામાં આશરે ૩.૭ ટકા અને શહેરમાં ૧૧.૮ ટકા જેટલા પુરુષો અને ૭.૭ ટકા અને ૬.૬ ટકા જેટલી સ્ત્રીઓ ડાયાબિટીસથી પીડાય છે. આજે ભારતમાં આશરે બે કરોડ જેટલા લોકો ડાયાબિટીસથી પીડાય છે. ઈ.સ. ૨૦૨૫માં વિશ્વમાં આશરે ૩૦ કરોડ ડાયાબિટીસના દર્દીઓ હશે જેમાંથી આશરે ૬ કરોડ દર્દી એકલા ભારતમાં હશે. ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં ભારત પહેલા નંબરે હશે. આ આંકડાઓ જોતાં, દરેક ભારતીય વંશજે ડાયાબિટીસ કરી શકે એવા પરિબળોથી દૂર રહેવાનો આજથી પ્રયત્ન કરવો ખૂબ જરૂરી છે.

## ડાયાબિટીસના પ્રકારો

ડાયાબિટીસ મેલાઈટસ (મધુપ્રમેહ) ના અનેક પ્રકારો આજ સુધીમાં શોધવામાં આવ્યા છે અને તેનું છેલ્લામાં છેલ્લું વર્ગીકરણ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ આપ્યું છે. આ વર્ગીકરણ મુજબ (૧) ડાયાબિટીસ મેલાઈટસ (૨) ગ્લુકોઝ - નિયમનમાં ખામી અને (૩) સગર્ભાવરસ્થામાં ડાયાબિટીસ - એમ ગ્રણ મુખ્ય વિભાગો છે. દરેક વિભાગના દર્દીના લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ કેટલું હોવું જોઈએ એની વિગત સાથેના કોષ્ટકમાં (જૂઓ પાના નં - ૪) છે.

પહેલો અને સૌથી મોટો વિભાગ ડાયાબિટીસ મેલાઈટસ - બીજા ચાર પેટા વિભાગોમાં વહેંચવામાં આવે છે.

૧. ઈન્સ્યુલિન - આધારિત ડાયાબિટીસ (ટાઈપ-૧)
૨. ઈન્સ્યુલિન - બિનઆધારિત ડાયાબિટીસ (ટાઈપ-૨)
૩. કુપોષણ સાથે સંકળાયેલ ડાયાબિટીસ અને
૪. અન્ય કારણોસર થતો ડાયાબિટીસ.

વિકસિત દેશોમાં મોટાભાગના ડાયાબિટીસના દર્દીઓ ટાઈપ-૧ અથવા ટાઈપ-૨ ડાયાબિટીસના જ હોય છે. આશરે ૨૦% દર્દીઓને ટાઈપ-૧ અને ૮૦% દર્દીઓને ટાઈપ-૨ ડાયાબિટીસ હોય છે. વિકસતા અને અલ્યુવિકસિત ગરીબ દેશોમાં આ બંને પ્રકારો ઉપરાંત એક ત્રીજો જ પ્રકાર શોધી કાઢવામાં આવ્યો છે, જે કુપોષણ સાથે સંકળાયેલ ડાયાબિટીસ તરીકે ઓળખાય છે. જો કે કુપોષણ અને ડાયાબિટીસને શો સબંધ છે તે હજુ સુધી ચોકકસપણે જાણી નથી શકાયું. આ કુપોષણ અંગે વધુ સંશોધન ચાલુ છે અને થોડાં વર્ષો પછી એ અંગે વધુ જાણકારી

મળી શકશે. અમેરિકન ડાયાબિટીસ એસોસિએશને સુચયેલાં છેલ્લા સુધારા પ્રમાણે કુપોષણ સાથે સંકળાયેલ ડાયાબિટીસને મુખ્ય પેટાવિભાગમાંથી કાઢી નાંખવો જોઈએ. હાલ તુરત આપણી ચર્ચા ટાઈપ-૧ અને ટાઈપ-૨ પ્રકારના ડાયાબિટીસ પૂરતી સીમિત રાખીશું.

**ટાઈપ-૧ ડાયાબિટીસ એ ઇન્સ્યુલિન આધારિત ડાયાબિટીસ કહેવાય છે.** કારણ કે આ દર્દીઓમાં ઈન્સ્યુલિનનું ઉત્પાદન એટલું બધું ઘટી ગયું હોય છે (અથવા ઉત્પાદન બંધ થઈ ગયું હોય છે) કે જેથી ઈન્સ્યુલિનના અભાવે દર્દીને ક્રિટોએસિડોસીસ (જુઓ પાના નં. ૨૩) જેવા ગંભીર (ક્યારેક જવલેણ) કોમ્પ્લિકેશન થઈ શકે છે અને બહારથી ઈન્સ્યુલિનનાં ઈન્જેક્શન આપવાં અનિવાર્ય બને છે. સામાન્ય રીતે બાળપણમાં જ આ પ્રકારના ડાયાબિટીસની શરૂઆત થઈ જાય છે. સરળતા ખાતર હવે પછી ટાઈપ-૧ ડાયાબિટીસનો ઉત્ખેખ બાળપણના ડાયાબિટીસ તરીકે કર્યો છે.

**ટાઈપ-૨ અથવા ઇન્સ્યુલિન બિનઅાધારિત ડાયાબિટીસના દર્દીઓમાં ઈન્સ્યુલિનની અછત સાપેક્ષ હોય છે અર્થાત્ દર્દીના શરીરમાં ઈન્સ્યુલિનનું ઉત્પાદન બરાબર જેવું જ થતું હોય, પણ શરીરમાં ઈન્સ્યુલિનની જરૂરિયાત વધી જાય. (મોટા ભાગના દર્દીઓનું વજન જરૂર કરતાં વધુ હોય છે). સામાન્ય રીતે પુખ્તવયે, ચાળીસ વર્ષ પછી, આ પ્રકારનો ડાયાબિટીસ થાય છે, જેને સરળતા ખાતર હવે આપણે પુખ્તવયના ડાયાબિટીસ તરીકે ઓળખીશું. આ પ્રકારના ડાયાબિટીસના દર્દીઓને બહારથી ઈન્સ્યુલિન ન મળે તો પણ ક્રિટોએસિડોસીસ જેવાં ગંભીર કોમ્પ્લિકેશન નથી થતાં. ઘણીવાર કસરત અને ખોરાકના પરિવર્તનથી જ આ પ્રકારનો ડાયાબિટીસ કાબૂમાં આવી જાય છે. ક્યારેક દવા લેવી પડે છે અને અમુક દર્દીઓમાં ઈન્સ્યુલિનનાં ઈન્જેક્શનનો આપવાં પડે છે.**

આ સિવાય અન્ય કારણોસર થતા ડાયાબિટીસ (સેકન્ડરી ડાયાબિટીસ) માં કોઈક રોગ કે ઓપરેશનથી સ્વાદુપિંડ (પેન્ફ્રીઆસ) માં નુકસાન થવાથી ઈન્સ્યુલિનનું ઉત્પાદન ઘટી જાય છે અને દર્દીને બહારથી ઈન્સ્યુલિનનાં ઈન્જેક્શન આપવાં પડે છે. સગર્ભાવસ્થા દરમ્યાન જો સગર્ભ માતાના લોહીમાં વધુ પડતો જલુકોઝ હોય તો એની આડાસર ગર્ભ પર પડે છે. ડાયાબિટીસને લગતાં કોમ્પ્લિકેશન પણ સગર્ભાવસ્થાના ડાયાબિટીસમાં વધુ થાય છે અને યોગ્ય સારવાર કરવાથી આ આડાસરો અટકી પણ શકે છે. ઘણી સ્ત્રીઓને, માત્ર સગર્ભાવસ્થા દરમ્યાન જ ડાયાબિટીસ રહે અને સુવાપડ પછી બધું નોર્મલ થઈ જાય એવું પણ બને છે. આવી સ્ત્રીઓને ઘણાં વર્ષો પછી કાયમી ડાયાબિટીસ થઈ શકે.

## બાળપણમાં ડાયાબિટીસ થવાનું કારણ શું?

ડાયાબિટીસ થવાનું ચોક્કસ કારણ હજુ આજ દિન સુધી વૈજ્ઞાનિકો શોધી નથી શક્યા તેમ છતાં ડાયાબિટીસના કારણ સાથે સંકળાપેલ કેટલીક હકીકતો શોધી શક્ય છે. એક તથ્ય બધા વૈજ્ઞાનિકો સ્વીકારે છે કે બાળપણમાં થતો ડાયાબિટીસ ઉર્ફ ટાઈપ-૧ (ઇન્સ્યુલિન આધારિત) અને પુખ્તવયે થતો ડાયાબિટીસ ઉર્ફ ટાઈપ-૨ (ઇન્સ્યુલિન બિનાધારિત) ડાયાબિટીસ તદ્દન જુદા જુદા કારણોથી થાય છે જેની ચર્ચા જુદાં જુદાં વિભાગમાં કરી છે.

બાળપણમાં ટાઈપ-૧ (ઇન્સ્યુલિન આધારિત) ડાયાબિટીસ થવાના કારણો અંગે ખૂબ સંખ્યિકતમાં કહેવું હોય તો એમ કહી શક્ય કે ટાઈપ-૧ ડાયાબિટીસ થવાનું કારણ શરીરના રોગપ્રતિકારક તંત્રની ભૂલ છે જેને પરિણામે સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરતા કોષો (બીટા કોષ) પર શરીરના રોગપ્રતિકારક (ઇમ્યુન) તંત્રના સૈનિકો (શ્વેતકષો) ચડાઈ કરે છે અને ધીરે ધીરે બધાં જ બીટા કોષ નાશ પામે છે! પણ ના, વાત સાવ આવી સીધી ને સટ નથી. અમુક જ લોકોનું રોગપ્રતિકારક તંત્ર શા માટે આવી ભૂલ કરે છે? ડાયાબિટીસ ધરાવતાં મા-બાપનાં બાળકોમાં શા માટે વધુ પ્રમાણમાં ડાયાબિટીસ જોવા મળે છે? શું કોઈ વાતાવરણનું પરિબળ ડાયાબિટીસ કરવામાં ફણો આપી શકે? વગેરે અનેક પ્રશ્નો વર્ષાથી ધૂમરાય છે. આ પ્રશ્નોના ઉત્તર શોધવા માટે થયેલ શોધખોળો પ્રશ્નોના આંશિક ઉત્તર જ આપી શકે છે, તે છતાં દરેક અગત્યના પરિબળનો ઉલ્લેખ કરવો જરૂરી છે.

**(૧) વારસાગત :** બાળપણના ડાયાબિટીસનો રોગ કુટુંબમાં ચાલ્યો આવતો હોય છે. ડાયાબિટીસના દર્દીના નજીકના સગાઓ પેડી દર વીસ વ્યક્તિએ એક વ્યક્તિ ડાયાબિટીસના રોગવાળી મળી આવશે. જોડિયા બાળકોમાં એકને ડાયાબિટીસ થયો હોય તો બીજા બાળકને પણ ડાયાબિટીસ થવાની શક્યતા પચાસ ટકા જેટલી હોય છે. ડાયાબિટીસના દર્દીના જુદાં જુદાં સગાઓને ડાયાબિટીસ થવાની શક્યતા આ પ્રમાણો છે :- (૧) દર્દીનાં ભાઈ બહેનને કે માતા પિતાને પાંચ ટકા; (૨) ડાયાબિટીસ ધરાવતાર પિતાના સંતાનોને છ ટકા; (૩) માતા અને પિતા બંનેને ડાયાબિટીસ હોય તો સંતાનોને ત્રીસ ટકા; (૪) જે વ્યક્તિના ભાઈ / બહેન અને માતા / પિતાને ડાયાબિટીસ હોય તે વ્યક્તિને ડાયાબિટીસ થવાની શક્યતા ગ્રીસ ટકા જેટલી રહે છે.

**(૨) વ્યક્તિની જનિન-પ્રકૃતિ (HLA પ્રકાર) :** દરેક વ્યક્તિ બીજી વ્યક્તિઓથી કેટલીક ખાસ બાબતમાં જુદી પડતી હોય છે. વ્યક્તિના દરેક કોષોને પોતાની આગવી ઓળખ હોય છે. એક વ્યક્તિના બધા કોષોની ઓળખ અન્ય વ્યક્તિના બધા કોષો કરતાં જુદી હોય છે. વૈજ્ઞાનિકોએ આ કોષોની ઓળખનો

અભ્યાસ કરીને આને માટે જવાબદાર કેટલાંક ખાસ પ્રકારનાં પ્રોટીન શોધી કાઢ્યાં છે જે HLA તરીકે ઓળખાય છે. આ પ્રોટીનને આધારે જ શરીરનું રોગપ્રતિકારક તંત્ર શરીરના પોતીકા કોષો અને પારકા કોષો વચ્ચેનો બેદ ઓળખી શકે છે. આપણે આગળ જોઈ ગયા કે બાળપણમાં ડાયાબિટીસ કરવામાં રોગપ્રતિકારક તંત્રની પોતીકા કોષોને ઓળખી ન શકવાની ભૂલ જવાબદાર હોય છે. જે વ્યક્તિમાં અમુક ચોક્કસ પ્રકારના HLA પ્રોટીન હોય (દા.ત. HLA DQB1 - 0302/0201) તે વ્યક્તિમાં રોગ પ્રતિકારક તંત્રની આવી ભૂલ વધુ પ્રમાણમાં થતી હોય છે.

**(3) વાઈરસનો ચેપ :** એક સરખો વારસો કે એક સરખા HLA પ્રકાર હોવા છતાં કેમ એકને ડાયાબિટીસ થાય છે અને બીજાને નથી થતો? આ સવાલનો હલ શોધતાં શોધતાં વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે અમુક પ્રકારના વાઈરસનો ચેપ ફેલાયા પછી બાળપણનાં ડાયાબિટીસના દર્દીઓમાં અચાનક વધારો થાય છે. સ્વીડનના એક અભ્યાસ પ્રમાણે ગાલપણોળાના વાપર પછી અને શ્રીટનના એક અભ્યાસ પ્રમાણે કોક્કેડી વાઈરસનો ચેપ ફેલાયા પછી ડાયાબિટીસના ડિસ્સા વધે છે.

અત્યારના સિધ્યાંત મુજબ વાઈરસનો ચેપ લાગવાથી કાં તો સ્વાદુપિંડના બીટા કોષોમાં અથવા રોગપ્રતિકારક તંત્રના કોષોમાં અમુક ફેરફારો થાય છે જેને કારણે રોગપ્રતિકારક તંત્ર સીધા બીટા કોષો પર જ હુમલો કરી એનો નાશ કરે છે જેને પરિણામે, ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઘટ્યી જાય છે અને ડાયાબિટીસ થાય છે. આ સિવાય અન્ય કોઈ બાધ્ય પરિબળ (દવા, ખોરાક વગેરે) પણ ડાયાબિટીસની શરૂઆત કરવા માટે જવાબદાર હોઈ શકે છે અંગે સંશોધનો ચાલુ જ છે. આટલી બધી શોધ થવા છતાં અમુક વ્યક્તિને ડાયાબિટીસ થશે કે નહીં એ ચોક્કસપણે કહી શકતું નથી. આ અંગેની માત્ર આંકડાકીય સંભાવનાઓ જ જાણી શકાય છે.

**અત્યારના સિધ્યાંત મુજબ વારસામાં અમુક જનિન-પકૃતિ મેળવનાર બાળકને  
વાઈરસનો ચેપ લાગવાથી રોગપ્રતિકારક તંત્ર ભૂલથી  
વાઈરસને બદલે ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરનાર કોષો પર જ હુમલો કરી  
એનો નાશ કરે છે જેને પરિણામે,  
ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઘટ્યી જાય છે અને ડાયાબિટીસ થાય છે.**

## પુખ્તવયે (ટાઈપ-૨) ડાયાબિટીસ થવાનું કારણ શું?

બહુ સામાન્ય રીતે જોવા મળતો પુખ્તવયનો ડાયાબિટીસ (જે ટાઈપ-૨ ડાયાબિટીસ તરીકે ઓળખાય છે) શા કરણે થાય છે એ હજ સુધી ચોક્કસપણે જાણી શકાયું નથી. સંભવિત કારણોની ચર્ચા નીચે કરી છે.

**(૧) વારસાગત :** આ ડાયાબિટીસ એક જ કુટુંબના ઘણા સભ્યોમાં જોવા મળે છે પરંતુ એનો વારસો કોને મળશે અને કોને નહિ એ હજ સુધી ચોક્કસપણે જાણી શકાયું નથી. યુવાન વયે ટાઈપ-૨ ડાયાબિટીસ થાય તો એ MODY (Maturity Onset Diabetes of Young) તરીકે ઓળખાય છે. આ પ્રકારના ડાયાબિટીસ ચોક્કસપણે વંશપરંપરાગત જોવા મળે છે. ગ્રાણ પેઢીઓ સુધી આ




રોગ સીધો ઉત્તરી આવેલ જોવા મળે છે. બે સમાન જોડિયા બાળકમાં જો એકને ટાઈપ-૨ ડાયાબિટીસ થાય તો બીજાને સો ટકા એ થાય જ! ડાયાબિટીસના દર્દીના ભાઈબહેનોમાંથી ચાણીસ ટકાને અને બાળકોમાંથી તેત્રીસ ટકાને ડાયાબિટીસ થાય જ છે. માનવકોષમાં રહેલ કોમોરોસ્સ (રંગસૂત્ર) ની ૧૧મી જોડમાં ખામી હોય તો ડાયાબિટીસ થાય છે.

**(૨) ઉભર :** ટાઈપ-૨ ડાયાબિટીસ ચાણીસ વર્ષથી મોટો ઉભરના લોકોમાં વધુ પ્રમાણમાં જોવામાં આવે છે. ઉભર વધવાની સાથે મોટાભાગની વ્યક્તિઓમાં જલુકોઝનું નિયંત્રણ ઘટતું જાય છે. ઉભરના દર દાયકાએ ભૂજ્યા પેટે માપવામાં આવતા લોહીના જલુકોઝમાં ૧-૨ મિ.ગ્રા./ડિ.લી. જેટલો વધારો થાય છે અને જમ્યા પછીના લોહીમાં આ વધારો હજ મોટો હોય છે. ઉભરની સાથોસાથ

ઇન્સ્યુલિનની કામગીરીમાં અવરોધ (ચેમીસ્ટન્ટ) વધતો જાય છે. એટલે જેટલા ઇન્સ્યુલિનથી પહેલાં લોહીનો જલુકોઝ નિયંત્રણમાં રહેતો હતો એટલું ઇન્સ્યુલીન ઉભર વધતાં ઓછું પડે છે. આવું થવા પાછળ નીચે જણાવેલ ઘણાં પરિબળો કામ કરતા હોય છે:

(૧) ઉભરની સાથે શરીરમાં થતો ચરબીનો ભરાવો અને સ્નાયુઓનો ઘટાડો.



- (૨) ઉમરને કારણો શારીરિક શ્રમમાં થતો ઘટાડો.
- (૩) ઉમરની સાથે થતાં ખોરાકમાં અમુક પરિવર્તનો (શક્તિના વપરાશ કરતાં વધુ ખોરાક) ઈન્સ્યુલિન રેજીસ્ટર્સ માટે જવાબદાર બની શકે છે.
- (૪) છેલ્લે, કેટલીક દવાઓ - બ્લાડપ્રેશર માટે વપરાતી ડાઈયુરેટીક્સ, ઈસ્ટ્રોજન, સ્ટીરોઇડ્સ, એન્ટીડિપ્રેસન્ટ દવાઓ - વગેરે જ્લુકોજના નિયંત્રણમાં ખલેલ પહોંચાડી શકે છે. અને ઘણા વૃદ્ધો કોઈને કોઈ કારણે આ જાતની દવા લેતા હોય છે.

આમ, વધતી ઉમર ટાઈપ-૨ ડાયાબિટીસ કરવા માટે ઘણાં કારણો પૂરા પાડે છે.

**(૩) મેદસ્વીતા :** પુષ્ટવયની વ્યક્તિઓમાં વજન વધવાની સાથે ડાયાબિટીસ થવાની શક્યતાઓ પણ વધતી જાય છે. મેદસ્વીતાનું પ્રમાણ નક્કી કરવા માટે બોડી માસ ઈન્ટેક્શ તરીકે ઓળખાતો સ્કેલ માપ વપરાય છે. વ્યક્તિના વજન (કિલોગ્રામમાં) ને એની ઊંચાઈ (મીટરમાં) ના વર્ગથી ભાગવાથી બોડી માસ ઈન્ટેક્શની ગણતરી થઈ શકે છે. તંદુરસ્ત વ્યક્તિનો ઈન્ટેક્શ ૨૭ થી વધારે નથી હોતો. જે વ્યક્તિમાં બોડીમાસ ઇન્ટેક્શ ૪૦ કે તેથી વધારે હોય તે વ્યક્તિને ડાયાબિટીસ થવાની શક્યતા॥ નોમલ ઇન્ટેક્શવાળી વ્યક્તિ કરતાં અણ ગણી વધી જાય છે! પરંતુ આ મેદસ્વીતાનું ડાયાબિટીસ સાથેનું સગપણ માનવવંશ (RACE) સાથે બદલાય છે. પીમા ઈન્ડીયન નામના વંશના મેદસ્વી લોકોમાં જેટલા પ્રમાણમાં ડાયાબિટીસ છે તેની કરતાં સોમાં ભાગનો ડાયાબિટીસ અમેરિકન વ્હાઈટ્સ વંશમાં છે.

બીજા એક અભ્યાસ મુજબ માત્ર મેદસ્વીતા જ નહીં પણ શરીરમાં વધારાની ચરબીની જગ્યાને આધારે ડાયાબિટીસ થવાની શક્યતા બદલાય છે. પેટની આસપાસ વધુ પડી ચરબી ધરાવનાર વ્યક્તિના કોષો પર ઈન્સ્યુલીનની અસર ખૂબ ઓછી થાય છે. એટલે, જે વ્યક્તિના પેટની આસપાસ વધુ ચરબી જમા થઈ હોય એ વ્યક્તિમાં ડાયાબિટીસ થવાની શક્યતા વધુ રહે છે. (જ્યારે પગ, સાથળ કે પીઠના નીચેના ભાગે જમા થયેલ ચરબીથી ડાયાબિટીસ થવાની શક્યતા વધતી નથી.)

**(૪) બેઠાડ જીવન :** વ્યક્તિનું જીવન જેટલું બેઠાડું એટલી ડાયાબિટીસ થવાની શક્યતાઓ વધારે રહે છે. કસરતથી ઈન્સ્યુલિનની અસરકારકતામાં વધારો




થાય છે. એથેટ્રેસ (ડસરતબાળો) ના શરીરના કોષો ઈન્સ્યુલિનની બહુ ઓછી માત્રાથી ગ્લુકોઝ નિયમનનું કામ કરી લે છે. જ્યારે બેઠાડું જીવન જીવનાર વ્યક્તિઓને ગ્લુકોઝ નિયમન માટે વધુ માત્રામાં ઈન્સ્યુલિન જોઈએ છે. જેમ જેમ વ્યક્તિ ધનવાન થતો જાય છે તેમ તેમ એની ખાવા પીવા ઊઠવા બેસવાની આદતોમાં કંઈક એવા પરિવર્તનો આવે છે કે જેને કારણે ડાયાબિટીસ થવાની શક્યતા વધતી જાય છે. ગામડાઓમાં અને ગરીબ વિસ્તારોમાં રહેતા ભારતીયોમાંથી આશરે એક ટકા લોડો ડાયાબિટીસનો ભોગ બને છે. મુંબઈ, કલકત્તા જેવાં મોટાં શહેરોમાં વસતા ભારતીયોમાંથી બે ટકા લોડો ડાયાબિટીસનો શિકાર બને છે. જ્યારે પરદેશમાં વસતા ભારતીયોમાંથી ચાર ટકા લોડોને ડાયાબિટીસની બીમારી લાગુ પડે છે.

#### (૫) અન્ય પરિબળો :

અંતઃઝાવો (એન્નીનાલીન, સ્ટીરોઇડ, ગ્લુકાગોન, ગ્રોથ હોર્મોન વગરે) નું પ્રમાણ વધી જાય ત્યારે એમની ઈન્સ્યુલિન વિરોધી અસરોને લીધે ગ્લુકોઝ નિયમન ખોરવાઈ જાય છે અને ડાયાબિટીસની બીમારી દેખા દે છે.


એ જ રીતે કેટલીક દવાઓ (ડાઈયુરેટીક્સ, ગર્ભનિરોધક ગોળીઓ, સ્ટીરોઇડ્સ વગરે) શરીરમાં છુપાયેલ ડાયાબિટીસને છિતો કરવામાં ભાગ ભજવી શકે છે.



માનસિક તાણને કારણે પણ ડાયાબિટીસ થવાની

શક્યતા વધી જાય છે. માનસિક તાણને કારણે શરીરમાં ઈન્સ્યુલિન-વિરોધી અંતઃઝાવોનું પ્રમાણ વધી જાય છે અને ઈન્સ્યુલિનનું ઉત્પાદન ઘટી જાય છે જેને પરિણામે લાદીમાં શુગર વધવા લાગે છે.

ધણા દર્દીઓમાં ડાયાબિટીસ કરવા માટે એક કરતાં વધારે કારણો જવાબદાર હોય છે. ડાયાબિટીસની બંદૂકમાં ગોળી ભરવાનું કામ વારસાગત (જનીનિક) પરિબળો કરે છે. જ્યારે બંદૂક ફોડવાનું કામ રહેણી-કરણી (બાધ્ય પરિબળો) કરે છે. હજુ સુધી કોઈ એક ચોકક્સ કારણ બધા દર્દીઓને લાગુ નથી પડી શકતું અને મોટા ભાગનાં દર્દીઓમાં ડાયાબિટીસનું કારણ છેક સુધી અજ્ઞાત જ રહે છે.



## ડાયાબિટીસને ઓળખવો કઇ રીતે ?

ડાયાબિટીસને ઓળખવો સહેલો નથી. ધણાં લોકોને ડાયાબિટીસ થયા પછી ધણા વર્ષો બાદ જાણ થાય છે કે તેમને ડાયાબિટીસની બીમારી છે. ડાયાબિટીસનાં લક્ષણો અને કોમ્પ્લિકેશન્સ એના પ્રકાર પ્રમાણે બદલાય છે. ઈન્સ્યુલિન આધારિત (ટાઈપ-૧) ડાયાબિટીસ બાળપણમાં (દશ-પંદર વર્ષની વયે) દેખા દે છે અને જલદીથી ઓળખાઈ જાય છે. જ્યારે ઈન્સ્યુલિન બિનઅધારિત (ટાઈપ-૨) ડાયાબિટીસ પુખ્તવયે (ચાળીસેક વર્ષની વયે) થાય છે અને મોઢેથી ઓળખાય છે. આ બંને પ્રકારના ડાયાબિટીસના લક્ષણો સરળતા ખાતર જુદા જુદા વર્ઝન્યા છે પણ એમાં ધણા અપવાદ હોઈ શકે.

### બાળપણના ડાયાબિટીસનાં લક્ષણો:

મળે એ હેતુથી અહી એક દર્દીની વાત નામ બદલીને લખી છે: બાર વર્ષનો બંડિમ દિવસે દિવસે સૂક્કાતો જતો હતો. કાયમ રમતગમતમાં આગળ રહતો બંડિમ, છેલ્લાં બે મહિનાથી રમવાનું બહુ પસંદ નહોતો કરતો. થોડુંક દોડતાં થાક લાગી જતો હતો. સ્કૂલમાં પણ ભણવામાં ચિત્ત નહોતું લાગતું. વારંવાર ચાલુ કલાસે એકીપાણી માટે રજા લેવી પડતી હતી. પહેલાં કદી ચાલુ કલાસે વર્ગખંડ ન છોડનાર વિદ્યાર્થી અચાનક બગડી કેમ ગયો એ જ કોઈને નહોતું સમજાતું. કલાસમાં બીજા વિદ્યાર્થીઓથી પાછળ રહેવા લાગ્યો એટલે સાહેબે બંડિમની મમ્મીને બોલાવીને વાત કરી કે તમારો છોકરો ભણવામાં ધ્યાન નથી આપતો, વારંવાર એકીપાણી માટે રજા માગ્યા કરે છે... વગેરે.

આ સાંભળી મમ્મીની ચિંતામાં ઓર વધારો થયો. મમ્મી પણ જોતી હતી કે રાત્રે વારંવાર બંડિમ પેશાબ કરવા માટે ઉઠતો. મમ્મી રોજ ટોકતી કે વધુ પાણી ન પીવું. પણ બંડિમને તરસ એટલી લાગતી કે પાણી પીધા વગર રહી ન શકે. સૌથી વધુ નવાઈ તો એની મમ્મીને એ બાબતની લાગી કે બંડિમનો ખોરાક પહેલાં કરતાં વધ્યો હતો? રોજ કક્કીને ભૂખ લાગતી અને પેટ ભરીને બંડિમ ખાતો એ છતાં એનું વજન વધવાને બદલે ઘટતું જતું હતું.

જ્યારે એક દિવસ અચાનક બંડિમને ભારે તાવ આવ્યો અને સાથેસાથે બંડિમ બેહોશ થઈ ગયો ત્યારે મમ્મી ઢીલી થઈ ગઈ અને બંડિમને ડૉક્ટર પાસે લઈ ગઈ. ડૉક્ટરે બધી વાત સાંભળી. બંડિમનો પેશાબ અને લોહીનો રીપોર્ટ જોઈને એમની આંખો પહોળી થઈ ગઈ. બંડિમના લોહી અને પેશાબમાં એટલી બધી શુગર (ગલુકોઝ) હતી કે બંડિમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી ઈન્સ્યુલિનનાં

ઈન્જેક્શન આપવા પડ્યા. બંડિમને ઈન્સ્યુલિન આપ્યારિત ડાયાબિટીસ થયો હતો.

બંડિમની જેમ બીજા અનેક લોકોને આવો ડાયાબિટીસ થાય છે. જેનાં મુખ્ય લક્ષણો છે વધુ પડતો પેશાબ થયો, વધુ મૂખ અને તરસ લાગવી તથા થાક લાગવો. અમૃત લોકોમાં આ લક્ષણો ધીમે ધીમે વરસે વરસે વહતા કમમાં દેખાય છે. તો બીજા કેટલાક લોકોમાં બે-ચાર મહિનામાં બધાં જ લક્ષણો દેખા દે છે. આ બધાં લક્ષણો દેખાવાનું એક જ મુખ્ય કારણ હોય છે લોહીમાં ગલુકોઝનો ભરાવો. ઈન્સ્યુલિનના અભાવે લોહીમાં રહેલ ગલુકોઝ કોષમાં જઈ નથી શકતો. જેને લીધે કોષો ભૂખ્યા મરે છે, શરીર સૂકૃતું જાય છે. વધારાનો ગલુકોઝ કિઝની વાટે પેશાબમાં નીકળી જાય છે એને શરીર બહાર કાઢવા માટે શરીરનું પાણી પણ વધુ પ્રમાણમાં નીકળી જાય છે જેથી ખૂબ તરસ લાગે છે.

બાળપણના ડાયાબિટીસના દર્દીઓ ઘણી વાર ક્રોએસિડોસીસ તરીકે ઓળખાતા જીવલેણ કોમ્પ્લિકેશન સાથે જ પહેલ વહેલાં નિદાન પામે એવું પણ બંડિમની જેમ ઘણાં કિસ્સામાં બનતું હોય છે. આ કોમ્પ્લિકેશન અંગે વિગતે પાના નં - ૨૭ પર ચર્ચા કરી છે. કોઈક બીમારી કે ઓપરેશન પછી ડાયાબિટીસની તપાસ આ કોમ્પ્લિકેશનને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવે છે.

### પુષ્ટવર્યના ડાયાબિટીસનાં લક્ષણો: લક્ષણોની સાદી સમજણ મળે

એ હેતુથી અહીં એક દર્દીની વાત નામ બદલીને લખી છે: મુંબઈ નિવાસી મંગળાબેન ખાધેપીધે સુખી હતાં. બંગલો-ગાડી-નોકર-રોડીયા બધું હાજર. સવારે ઉઠીને નાસ્તા-જમવાની સૂચના આપીને નિરાંતે સોફામાં બેઠાં બેઠાં સહેલીઓ સાથે ફેનમાં ગપાટા માર્યા કરે. ક્રીટી પાર્ટી, રીસેપ્શન બથર્ડ પાર્ટી વગરેમાં સમય કરાં નીકળી જાય એ જ ખબર ન પડે. ગ્રીસેક વર્ષની ઉમરે એમનું વજન આશરે પચાસેક કિલો હતું તે અત્યારે પચાસ વર્ષની ઉમરે પંચોતેર કિલો સુધી પહોંચી ગયું હતું.

ગયા મહિને ગાડીમાં બેસવા જતાં પગમાં જરાડ પતરું ઘસાયું હતું અને થોડો ભાગ છોલાઈ ગયો હતો. મામૂલી વાગેલું એટલે ખાસ ધ્યાન ન આપ્યું. પણ એક અઠવાડિયે જ્યારે મટયું નહીં ત્યારે ફેમિલી ડૉક્ટર પાસેથી ઘા પર લગાડવાનો મલમ લઈ આવ્યા. મલમ લગાવવા છતાં જ્યારે રૂઝ ન આવી ત્યારે ડૉક્ટરે તેમને લોહી-પેશાબ ટેસ્ટ કરાવવાનું કહ્યું. ટેસ્ટનો રીપોર્ટ જોઈને ડૉક્ટરની શંકા પાડી થઈ - મંગળાબેનને ડાયાબિટીસ હતો!

ડૉક્ટરે મંગળાબેનને સમજાયું કે તમને ડાયાબિટીસની બીમારી કેટલાં વખતથી હશે એ કહેવું મુશ્કેલ છે. તમને વગાડયું એટલો પતરાનો આભાર માનો કે જેથી ડાયાબિટીસનું નિદાન જલ્દી શક્ય બન્યું, નહીં તો હજુ બે-ચાર વર્ષ આમને

આમ જતાં રહ્યા હોત અને આંખ કે ચેતાતંતુઓ પર ભારે નુકસાન થયા પછી જ કદાચ ડાયાબિટીસની જાણ થઈ શકી હોત.

મંગળાબેનની જેમ જ ઘણા પુખ્તવયના ડાયાબિટીસના દર્દીઓમાં ડાયાબિટીસનું નિદાન આકસ્મિક જ થતું હોય છે. કેટલાક દર્દીઓમાં રૂટીન લેબોરેટરી તપાસ વખતે જ અચાનક ડાયાબિટીસની જાણ થાય એવું બને છે તો અન્ય કેટલાક દર્દીઓમાં ડાયાબિટીસના લાક્ષણિક ચિહ્નો - વધુ પડતા તરસ, ભૂખ, થાક અને વધુ પેશાબ થવો તથા ઘા ન રૂઝાવો વગેરે ડાયાબિટીસના નિદાન તરફ આંગળી ચીધે છે. આની સામે અમુક દર્દીઓમાં જ્યારે ડાયાબિટીસના લાંબા ગાળાનાં કોમ્પ્લિકેશન થાય ત્યારે જ ડાયાબિટીસની જાણ થાય એવું બને છે. ન રૂઝાતો ઘા; ચામડી અને યોનિમાર્ગમાં વારંવાર થતાં ચેપ (ખાસ કરીને ફ્લેન ઇન્ફેક્શન); હાથ-પગના અમુક ભાગમાં વારંવાર કે કાયમી ખાલી ચડવી, ઝણઝણાટી કે બળતરા થવી; થાક લાગવો; આંખમાં અંધાપો આવવો કે આંખપ વળવી વગેરે કેટલાંક વારંવાર જોવા મળતાં કોમ્પ્લિકેશનના લક્ષણો છે. આ બધા લક્ષણોના ડાયાબિટીસ સિવાયનાં બીજાં અનેક કારણો હોઈ શકે. એટલે માત્ર લક્ષણોને આધારે જ વ્યક્તિને ડાયાબિટીસ છે કે નહીં તે કહી શકાતું નથી. યોગ્ય લેબોરેટરી તપાસ કરાવાથી જ ડાયાબિટીસનું ચોક્કસ નિદાન થઈ શકે છે.

### પુખ્તવયના ડાયાબિટીસના

### જુના દર્દીમાં દેખાતા લક્ષણો


- ★ ઘા ન રૂઝાવો
- ★ થાક લાગવો
- ★ વારંવાર પેશાબ થવો
- ★ પેશાબમાં ચેપ લાગવો
- ★ ચામડી, કાન અને યોનિમાર્ગમાં વારંવાર ચેપ  
(ખાસ કરીને ફ્લેન ઇન્ફેક્શન) લાગવો
- ★ ખાલી ચડવી, ઝણઝણાટી કે બળતરા થવી
- ★ આંખમાં અંધાપો આવવો કે આંખપ વળવી
- ★ ખાદ્યા પછી પેટમાં ભાર થઇ જવો.

## ડાયાબિટીસને કાબૂમાં રાખવામાં ન આવે તો શું તકલીફ થાય?

ઘણા લોકો ડાયાબિટીસના દર્દની ગંભીરતા સમજ શકતા નથી અને પરિણામે ડાયાબિટીસનું નિદાન થયું હોવા છતાં આહાર, વિહાર અને દવાઓ તરફ પૂરતું ધ્યાન નથી આપતા. ‘ડોક્ટરો તો ખોટા વેમ ઉભા કરી દે છે’; ‘મને કોઈ તકલીફ નથી થતી તો શા માટે આ બધી પરેજી-ક્સરત-દવાની જફા કરવી.’ એવા કોઈને કોઈ બહાના હેઠળ સારવાર ન કરવાની વૃત્તિ ઘણાં લોકોમાં જોવા મળે છે. આને પરિણામે ડાયાબિટીસનું દર્દ શરીરના અવયવોને ધીમે ધીમે કરીને ખૂબ મોટું નુકસાન પહોંચાડી દે છે. ડાયાબિટીસ અને હાઈબ્લડપ્રેશરની બીમારી જ એવી છે કે દર્દીને કોઈપણ પ્રકારની જાણ થવા દીધા વગર જ શરીરને અંદરથી ખતમ કરી નાખે છે. એટલે જ આ બીમારીઓ શરીરનાં છુપાં કાતિલો કહેવાય છે. ડાયાબિટીસને જો સારવારથી નિયંત્રણ હેઠળ ન લાવવામાં આવે તો લાંબે ગાળે આંખ, હદ્દય, કિડની, ચેતાતંતુઓ, રક્તવાહિનીઓ અને ચામડી પર આડઅસરો થાય છે. કયારેક આંખની રોશની ખોઈ દેવાની કે કયારેક કિડની ફેરફાર થવાની ભારે મોટી કિમત દર્દીએ પોતાની બેદરકારી માટે ચુકવવી પડે છે.

**ડાયાબિટીસથી આંખને થતું નુકસાન:** ડાયાબિટીસના ઘણા દર્દીઓમાં આંખોને નુકસાન થાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં આંખની અંદર આવેલ, બાચ પદાર્થનું પ્રતિબિંબ જીલનાર પડ્યો (નેત્રપટલ ઉંફ રેટીના) સૌથી વધુ નુકસાન પામે છે. આ નેત્રપટલને લોહી પહોંચાડતી રક્તવાહિનીઓ ડાયાબિટીસને લીધે નબળી પડે છે, લીક થાય છે અને એનો અમુક ભાગ જાડો થઈ જાય છે. કયાંક રક્તવાહિનીઓનો અમુક ભાગ કુલીને ઝુગ્ગા જેવો થઈ જાય છે. તો કયાંક નવી રક્તવાહિનીઓ ઝૂટી નીડળો છે. આ બધાનું આખરી પરિણામ એક જ આવે છે અંધાપો !

નેત્રપટલ એ કેમેરાનો રોલ કે ફિલ્મ જેવું કામ કરે છે. જેમ રોલ કે ફિલ્મનો ભાગ ચોખ્ખો ન હોય તો કદી સારો ફોટો ન પડી શકે, એમ જ નેત્રપટલ પર ઉપરોક્ત ખરાબી ઉભી થાય તો કદી નેત્રપટલ પર સ્પષ્ટ પ્રતિબિંબ ઉપસે નહીં. એટલે દર્દીની દર્શિમાં જાંખપ આવે, વસ્તુનો અમુક ભાગ ન દેખાય, કાળું-લાલ ઘાબું દેખાય વગેરે તકલીફો શરૂ થાય અને પુરતું ધ્યાન ન આપવામાં આવે તો દર્શિ સાવ જતી રહે.




नेट्रपटल उपरांत पણ આંખના અન્ય ભાગોને ડાયાબિટીસને કારણે નુકસાન થઈ શકે છે. આંખના લેન્સ (નેત્રમણી) પર મોતિયો આવવાની શરૂઆત ઘણી વહેલી થઈ શકે અને ક્યારેક તો બાળપણમાં કે યુવાનીમાં જ ડાયાબિટીસને લીધે મોતિયો આવી જાય એવું બને!! ક્યારેક ડાયાબિટીસને લીધે જામર થાય અને થયેલું જામર વધી જાય એવું બને છે. આંખની બહાર સફેદ ભાગ પર અને અંદરના પારદર્શક ભાગ (વીટ્રીયસ) માં પણ રક્તસ્નાવ થઈ શકે જેને કારણે જોવામાં તકલીફ ઉભી થાય. આમ, અનેકવિધ રીતે ડાયાબિટીસના દર્દીને આંખની તકલીફ થઈ શકે જે ક્યારેક સુધારી ન શકાય એવું ભારે નુકસાન પણ કરી શકે.

ડાયાબિટીસને કારણે નુકસાન પામેલ ભાગને રીપેર કરવાનું અત્યંત મુશ્કેલ છે. તાજેતરમાં લેસર ટેકનીકની મદદથી નેત્રપટલના નુકસાન પામેલા ભાગોને 'બાળી' નાખીને (ફોટોકોઅયુલેશન કરીને) એ ખરાબીને આગળ વધતી અટકાવવામાં સફળતા મળી છે. પરંતુ જે ભાગ નુકસાન પામી ચુક્યો છે એ સારો થવો મુશ્કેલ છે. લેસરનું ઓપરેશન માત્ર નવી તકલીફ થતી અટકાવવા માટે જ કરવામાં આવે છે એનાથી ચાલુ તકલીફમાં સુધારો થતો નથી. ક્યારેક, અમૃત વીટ્રીયસ હેમરેજ (રક્તસ્નાવ)ના દર્દીમાં ઓપરેશન કરીને આખો વીટ્રીયસનો ભાગ કાઢી નાખવો પડે છે અને એ પછી દસ્તિમાં થોડોક સુધારો જોવા મળે છે.


આંખોના આટલાં બધાં કોમ્પ્લિકેશનને ધ્યાનમાં રાખતાં એવું સુચવી શકાય કે ડાયાબિટીસના દરેક દર્દીએ નિયમિતપણે આંખોની તપાસ નિષ્ણાત ડૉક્ટરો પાસે કરાવતા રહેવું જોઈએ.

જેમને ચાળીસ વર્ષ પછી ડાયાબિટીસની બીમારી લાગુ પરી હોય એમણે ઓછામાં ઓછી દર બે વર્ષે એક વખત આંખોની તપાસ કરાવવી જોઈએ, જેથી કોમ્પ્લિકેશનની શરૂઆતમાં એને પારખી શકાય અને વધુ નુકસાન થતું અટકાવી શકાય.



## ડાયાબિટીસને કારણો કિડનીને થતું નુકસાન: ડાયાબિટીસને કારણો

કિડની તથા ઉત્સર્જતંત્રને સામાન્ય ચેપથી માંડીને કિડની ફેઇલ થવા સુધીનું ઘણી જતનું નુકસાન થઈ શકે છે. જો ડાયાબિટીસના દર્દીના લોહીમાં ગલુકોજનું નિયંત્રણ સારવારની અનિયમિતતાને લીધે બરાબર ન થતું હોય તો આ ગલુકોજ દર્દીના



પેશાબ વાટે બહાર નીકળે છે. દર્દીના પેશાબમાં ગલુકોજની હાજરીને કારણે પેશાબમાં ચેપ લાગવાની શક્યતાઓ વધી જાય છે અને વારંવાર ચેપ લાગવાને લીધે કિડની (મુત્રપિંડ), મુત્રવાહિની તથા મુત્રાશયને નુકસાન પહોંચ્યા કરે છે.

આ ઉપરાંત, કિડનીની રક્તવાહિનીઓને નુકસાન થવાથી તથા કિડનીની પેશીઓ પર અમુક પદાર્થો જામી જવાથી કિડનીની કામગીરી ધીમે ધીમે ખોરવાઈ જાય છે. શરૂઆતમાં પેશાબ વાટે ગલુકોજ ઉપરાંત પ્રોટીન નીકળવા લાગે છે. સામાન્ય રીતે પેશાબમાં પ્રોટીન હોતું નથી પણ કિડનીને નુકસાન થવાથી શરીરનું પ્રોટીન કિડની

વાટે નીકળવા લાગે છે. આ પછી જેમ જેમ નુકસાન વધું જાય એમ એમ એમ કિડનીની અન્ય કામગીરીઓ - ખાસ કરીને લોહી શુધ્ય કરવાની કામગીરી - ખોરવાય છે અને પરિણામે લોહીમાં આ અશુભિયાનો ભરાવો થવા લાગે છે. છેવટે એક તબક્કે બંને કિડની કામ કરતી બંધ થઈ જાય છે અને દર્દીને આખા શરીરે સોજા આવી જાય છે. જો આવી સ્થિતિમાં દર્દીની સારવાર તાત્કાલિક ન કરવામાં આવે તો દર્દી બચી શકતો નથી. કિડનીને કાયમી નુકસાન થઈ ગયા પછી ગમે એટલી સારવારથી પણ ફરી કિડનીને કામ કરતી કરવાનું લગભગ અશક્ય છે એટલે એવા દર્દીને કાં તો વારંવાર ડાયાલિસ કર્યા કરવું પડે અથવા કિડનીનું ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવું પડે. જે બંને ખૂબ ખર્ચાળ છે. એટલે કિડનીને નુકસાન ન થાય એ માટે ડાયાબિટીસનું નિદાન થાય ત્યારથી જ તકેદારી રાખવી જોઈએ અને વારંવાર પેશાબની તપાસ કરાવતા રહેવું જોઈએ જેથી ડાયાબિટીસ કાબૂમાં રહે. પેશાબમાં પ્રોટીન નીકળતું હોય તો એ કિડનીની ખરાખીની શરૂઆત સૂચયે છે એટલે એ સમયે ચેતી જઈ કિડનીને વધુ નુકસાન ન થાય એ માટેની દવાઓ (ડા.ત. એનાલેપ્રીલ વગેરે) ડૉક્ટરની સલાહથી લેવી જોઈએ અને ડાયાબિટીસ સંપૂર્ણ કાબૂ હેઠળ રહે એ માટે પ્રયત્નો કરવા જોઈએ.

## ડાયાબિટીસને કારણે ચેતાતંતુઓને થતું નુકસાન: શરીરના આંતરિક

સંદેશાવ્યવહારનું મુખ્ય કામ સંભાળતા ચેતાતંતુઓ ડાયાબિટીસને કારણે નુકસાન પામે છે. ડાયાબિટીસના દર્દીમાં ચેતાતંતુને આ રીતે નુકસાન થવાનું ચોક્કસ કારણ હજુ સુધી વિવાદસ્પદ છે. છેલ્લામાં છેલ્લા સિદ્ધાંત પ્રમાણે ડાયાબિટીસના દર્દીના ચેતાતંતુમાં વધારાની સાકર પર રાસાયણિક પ્રક્રિયાઓ થવાથી ચેતાતંતુ માટે ઝેરી રાસાયણ - સોર્બિટોલ પેદા થાય છે - જેની ઝેરી અસરને લીધે ચેતાતંતુ નુકસાન પામે છે. આલ્ડોલ રીડક્ટેસ નામનો ઉત્સેચક આ રાસાયણિક પ્રક્રિયા માટે જવાબદાર હોય છે. અત્યારે આ ઉત્સેચકને કામ કરતો અટકાવી દે એવી દવાઓ પાછળ સંશોધન થઈ રહ્યું છે, જેથી ચેતાતંતુને નુકસાન થતું અટકાવી શકાય.

જ્યારે ચેતાતંતુને નુકસાન પહોંચે ત્યારે જે પ્રકારના ચેતાતંતુ નુકસાન પામ્યા હોય એ પ્રકાર મુજબ, દર્દીમાં એનાં જુદાં જુદાં લક્ષણો જોવા મળે છે. શરીરના હાથ-પગમાંથી સંવેદના લઈ જનાર ચેતાઓને નુકસાન થાય ત્યારે દર્દીને જે તે ભાગમાં જાણાશાટી થવી, ખાલી ચડી જવી, હાથ-પગ જુઠા પડી જવા, રૂની ગાઢી ઉપર ચાલતા હોય એવો આભાસ થવો અને દુઃખાવો થવો વગેરે લક્ષણો જોવા મળે છે. હાથ કરતાં પગની ચેતાને અસર થવાની શક્યતા વધારે હોય છે. જેને કારણે પગને થતી નાની-મોટી ઈજાની દર્દીને જાળ થતી નથી અને છેવટે પગનું નુકસાન ખૂબ વધી જાય છે.

જો મગજમાંથી નીકળીને સનાયુઓને વિવિધ કામગીરીના આદેશ આપનારી ચેતાઓને નુકસાન થાય તો શરીરના અમુક ભાગનું હલન ચલન બંધ થઈ જાય અથવા ખૂબ નબળું પડી જાય છે. આંખના ડેળાને આજુબાજુ ફેરવવાનો આદેશ આપનાર ચેતાતંતુને નુકસાન થવું એ ખૂબ સામાન્ય છે અને આ કારણે અમુક બાજુ જોવાથી દર્દીને એકને બદલે બે વસ્તુ દેખાય એવું બને છે. હાથપગના સનાયુઓ પાતળા પડી જાય અને નીચે બેસેલ દર્દીને ઉભા થવામાં કમજોરી લાગે એવું પણ આ જ કારણોસર બને છે.


આ ઉપરાંત શરીરના અવયવો જઈ, આંતરડાં, હૃદય વગેરેને આદેશો આપનાર અને સંવેદનો લઈ જનાર ચેતાતંતુઓને નુકસાન થાય તો દર્દીને પેટમાં ભરાવો થવો, ઉલ્ટી થવી, કબજિયાત રહેવી, સુતા કે બેઠા હોય એમાંથી ઉભા થતાં ચુક્કર આવવા, નંસુસકતા વગેરે લક્ષણો જોવા મળે છે.

ચેતાતંતુઓને એક વાર નુકસાન થઈ જાય પછી એને સાજ કરવાનું લગભગ અશક્ય હોય છે. અને પછી આપવામાં આવતી દવા માત્ર એના લક્ષણોને દ્વારાવી દેવાનું કામ જ કરતી હોય છે. ચેતાતંતુઓને નુકસાન જ ન થાય એ માટે ડાયાબિટીસના દર્દીએ ડાયાબિટીસને સંપૂર્ણ નિયંત્રણ હેઠળ (કસરત-ખોરાક-દવા-ઈન્સ્યુલિન વગેરેની મદદથી) રાખવો જરૂરી છે. ભવિષ્યમાં

આલોલ રીડક્ટેસ ઉત્સેચકને કામ કરતો અટકાવી શકે એવી દવાઓ શોધાય તો એ ઉપયોગમાં આવી શકશે.

## ડાયાબિટીસને કારણે હૃદય અને રક્તવાહીનીઓને થતું નુકસાન:

ડાયાબિટીસના દર્દીઓમાંથી જે દર્દીને આ દર્દ ગ્રીસ-ચાળીસ વર્ષની ઉમર પછી લાગુ પડ્યું હોય એ દર્દીઓમાં મૃત્યુનું મુજ્ય કારણ હાર્ટ એટેક હોય છે. વળી, ઘણા ડાયાબિટીસના દર્દીઓને છાતીમાં ખાસ દુઃખાવો થયા વગર જ હાર્ટએટેક આવે છે. ‘સાઈલેન્ટ એટેક’ તરીકે ઓળખાતો આ હાર્ટ એટેક દર્દીને પોતાની બીમારીની ગંભીરતાની જાણ જ નથી થવા દેતો અને ક્યારેક અચાનક મૃત્યુ નોતરે છે. આ સિવાય પણ, ડાયાબિટીસને કારણે આખા શરીરની રક્તવાહીનીઓ બરડ અને સાંકડી થઈ જવાની પ્રક્રિયા ઝડપી બને છે. આને કારણે બદ્ધપ્રેશર, પેરાલિસીસ વગેરે બીમારીઓ વધી જાય છે. ક્યારેક હાથ કે પગના અમુક ભાગમાં લોહીનું ફરવાનું ઓછું થઈ જાય તો થોડું ચાલવાથી કે કામ કરવાથી હાથ-પગમાં સખત દુઃખાવો થઈ શકે છે. લોહી ઓછું પહોંચવાને કારણે, ખાસ કરીને પગમાં, વાગેલા ઘા રૂઝવાનું અને ચેપથી બચવાનું અધરું થઈ જાય છે.



**ડાયાબિટીસના દર્દીમાં લાગતા ચેપ :** ડાયાબિટીસના દર્દીમાં અન્ય લોકોની સરખામણીએ ચેપ લાગવાનું પ્રમાણ વધારે હોય છે. પેશાબનો ચેપ અને ચામડીનો ચેપ આ બે સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતા ચેપના પ્રકારો છે. ચામડી પર ફૂગ અથવા બેક્ટેરિયાનો ચેપ લાગી શકે છે. બેજવાળા વાતાવરણમાં ચામડી પર ફૂગના ચેપનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. બેક્ટેરિયાના ચેપને કારણે ચામડી પર ગૂમડાં થાય છે અને કંઈક વાગ્યું હોય તો ત્યાં પણ બેક્ટેરિયાનો ચેપ થઈ જાય છે. ગરદન ઉપર મોઢું ગૂમ્યું (કાર્બન્કલ) થવાનું અને એને કારણે ક્યારેક આખા શરીરમાં ચેપ ફેલાઈ જવાનું ડાયાબિટીસના ઘણા દર્દીઓમાં બનતું હોય છે. કાનની અંદર ભારે પાક થવાનું અને ચામડીના સૌથી ઉપરના, મોટા વિસ્તારમાં બેક્ટેરિયાનો ચેપ થઈ ચામડી ઉખડી જવા સુધીની તકલીફો પણ ડાયાબિટીસના દર્દીને ઘણી વાર થાય છે.

ડાયાબિટીસના દર્દીને વારંવાર શા માટે બેક્ટેરિયાનો ચેપ લાગે છે એ એક વિવાદનો મુદ્દો છે. જુદા જુદા વैજ્ઞાનિકો આ માટે જુદી જુદી થીયરીઓ રજૂ કરે છે.

શરૂઆતમાં એવું મનાતું હતું કે લોહીમાં સાકરનું પ્રમાણ વધારે હોવાથી બેક્ટેરિયાનો ઉછેર આ સાકરમાં સારી રીતે થઈ શકે છે. પરંતુ હવેની થીયરીઓ પ્રમાણે લોહીમાં સાકર વધવાથી લોહીમાં રહેલ શ્વેતકષ્ણોની બેક્ટેરિયાને ખતમ કરી નાખવાની શક્તિ ઓછી થઈ જાય છે. જેને કારણે બેક્ટેરિયાઓ બેરોક્ટોક ચેપ લગાવી દે છે. આ ઉપરાંત ડાયાબિટીસની રક્તવાહિનીઓ પર થતી અસરને કારણે અમુક ભાગોમાં લોહી ફરવાનું ઓછું થઈ જાય છે અને આવા ભાગ (દા.ત. પગ) માં ચેપ સહેલાઈથી લાગી શકે છે.

**અન્યા:** ડાયાબિટીસના દર્દીમાં ચેપ ન લાગ્યો હોય તો પણ ચામડીના કેટલાક રોગો થઈ શકે છે. ઘણા દર્દીમાં ચામડી સૂકી થઈ જાય છે અને નાનાં ચકામાં પગના નળાના ભાગ પર પડી જાય છે. અમુક દર્દીની ચામડી નીચેની ચરબી અચાનક ઓછી થવા લાગે છે અથવા નાશ પામે છે. જેને કારણે ચામડી ખરબચરી અને વિચિત્ર દેખાય છે. ઘણીવાર જે જગ્યાએ ઇન્સ્યુલિન ઇન્જેક્શન લેવામાં આવતું હોય એ જ જગ્યાએ આવું થાય છે.

અમુક દર્દીને પગમાં અથવા જયાં દબાણ આવતું હોય એવા ભાગો પર ગોળ ચાંદુ પડી જાય છે. આ ઉપરાંત પણ ચામડી ઉપર કાળી નાની નાની અળાઈઓ જેવો ભાગ ઉપસી આવે, પીળા રંગની ગાંઠો આંખની પાંપણ પર દેખાય, ફોડલીઓ થઈ જાય વગેરે અનેક પ્રકારની ચામડીની તકલીફો લાંબા સમયના ડાયાબિટીસથી થઈ શકે છે. મોટા ભાગની આ બધી ચામડીની તકલીફોની કોઈ ખાસ દવા નથી હોતી. ડાયાબિટીસને કાબૂમાં રાખવો એ જ ઉત્તમ ઈલાજ ડાયાબિટીસના દરેક લાંબા ગાળાના કોમ્પ્લિકેશન માટે છે.

### ડાયાબિટીસની બીમારી શરૂઆતના

તબક્કામાં કોઇ વિશેષ તકલીફ નથી આપતી.

પરંતુ જે શરૂઆતથી જ ડાયાબિટીસને નિયંત્રણ હેઠળ ન લાવવામાં આવે તો  
લાંબે ગાળો આંખ, હૃદય, કીડની, ચેતાત્તુસો, રક્તવાહિનીઓ  
અને ચામડીને ભારે નુકસાન થાય છે.

# ગુલુકોઝની મોટી વધઘટને કારણે ઉદ્ભવતી બેલાનાવસ્થા

## (ડાયાબીટીક કોમા)

ડાયાબીટીસના દર્દીમાં જ્યારે લોહીમાં રહેલ ગુલુકોઝ (શુગર) ની મોટી વધઘટ થાય ત્યારે દર્દી બેહોશ થઈ જાય એવું બનતું હોય છે. લોહીમાંથી શુગર ઘટી જવાની સ્થિતિ “હાઇપોગ્લાયસેમીયા” તરીકે ઓળખાય છે. જ્યારે લોહીમાં ગુલુકોઝ વધી જવાની સ્થિતિ “હાઇપરગ્લાયસેમીયા” તરીકે ઓળખાય છે. સામાન્ય વપરાશમાં “હાઇપોગ્લાયસેમીયા” માટે “શુગર લો (ઓછી) થઈ ગઈ છે” એવું કહેવાય છે. બાળપણના (ઇન્સ્યુલિન-આધારિત) ડાયાબીટીસમાં શુગર વધી જવાથી “ડાયાબીટીક ક્રીટોઅેસિડોસીસ” નામની ગંભીર તકલીફ થઈ શકે છે. પુખ્તવયના (ઇન્સ્યુલિન-બિનાધારિત) ડાયાબીટીસમાં શુગર વધી જવાથી “હાઇપરઓસ્મોલર ક્રોમા” તરીકે ઓળખાતી ગંભીર સ્થિતિ ઉદ્ભબે છે. ગુલુકોઝની મોટી વધઘટને કારણે ઉદ્ભવતી આ ગંભીર બીમારીઓને વિગતે સમજ લેવી દરેક ડાયાબીટીસના દર્દી માટે આવશ્યક છે.

### હાઇપોગ્લાયસેમીયા (લોહીમાં શુગર / ગુલુકોઝનું ઘટી જતું):-

ડાયાબીટીસના દર્દીઓમાં નીચે જણાવેલ કારણોસર શુગર ઘટી જઈ શકે છે:- (૧) બહારથી આપેલ ઇન્સ્યુલિન/દવાનો ડેઝ વધી જવાથી; (૨) દવા લીધા પછી સમયસર ખોરાક ન લેવાથી; (૩) વધુ પડતી કસરત/શ્રમ કરવાથી. ગુલુકોઝનું પ્રમાણ ઘટી જવાથી શરીરના કોષોને પોષણ મળવાનું પણ ઘટી જાય છે. માનવ મગજના કોષો પોષણ માટે માત્ર ગુલુકોઝ અથવા ક્રીટોન બોડીજ વાપરી શકે છે. જ્યારે લોહીમાંનું ગુલુકોઝ અચાનક ઘટી જાય ત્યારે સીધી અસર મગજના કોષોના કાર્ય પર થાય છે. જો તાત્કાલિક અસરથી લિવરમાં નવેસરથી ગુલુકોઝનું ઉત્પાદન શરૂ ન થાય તો મગજના કોષો કાર્ય કરતા બંધ થઈ જાય છે જેને લીધે બેલાનાવસ્થા (કોમા) ની સ્થિતિ આવે છે.

મગજને ગુલુકોઝ ઓછો પહોંચે તો શરૂઆતના તબક્કામાં ચક્કર આવે, માથું દુઃખે, માથું ખાલી ખાલી લાગે, આંખે જાંખપ વળે, અંધારાં આવે, વિચારશક્તિ ક્ષીણ થવા માંડે, જીણવટભર્યુ કામ કરવાની ક્ષમતા જતી રહે, મગજમાં ગુંચવાડા ઉદ્ભબે, અસામાન્ય-વિચિત્ર વર્તણૂક થાય, ખેંચ આવે અને છેવટે બેલાનાવસ્થા આવી જાય. આ લક્ષણોની સાથોસાથ જ (લોહીમાં ગુલુકોઝ વધારવાના આંતરિક પ્રયત્નને લીધે) પરસેવો થઈ જાય, હાથ પગ પાણી પાણી થઈ જાય, પ્રુજારી આવે, હંદયના ધબડારા વધી જાય, ચિંતા-વ્યાકુળતા જણાય અને ભૂખ લાગવાનો અહેસાસ થાય.

ઇન્સ્યુલિન લેનારાઓ અને લાંબા સમય સુધી અસર કરે એવી ગ્લુકોઝ ઘટાડવાની દવા લેનારાઓમાં આ રીતે અચાનક ગ્લુકોઝ ઘટી જવાની શક્યતા સૌથી વધારે રહે છે. આવી તકલીફ થાય અને દર્દી બેભાન થઈ જાય તો તાત્કાલિક એને સારવાર મળી રહે એ હેતુથી દરેક દર્દીએ પોતાનું નામ- સરનામુ, ફોન નંબર; ડૉક્ટરનું નામ-સરનામુ, ફોન નંબર; તથા “મને ડાયાબિટીસની બીમારી છે. જો હું વિચિત્ર વર્તણું કરતો હોઉ કે બેભાન હોઉ તો તરત જ મને ડૉક્ટર પાસે લઈ જવા વિનંતી” એવું લખાણ ધરાવતું કાર્ડ કાયમ પોતાની પાસે રાખી મૂકવું જોઈએ.

જો શુગર ઘટી જવાની તકલીફને શરૂઆતના તબક્કામાં જ પારખી લેવામાં આવે તો દર્દી પોતે જ એનો ઈલાજ કરી શકે છે. ચક્કર કે પરસેવાની શરૂઆત થાય કે તરત જ ખાંડ નાખેલ દૂધ કે અન્ય પ્રવાહી પી લેવું જરૂરી છે. જેવી ખાંડ શરીરમાં જશે કે તરત જ આ તકલીફો ઓછી થઈ જશે. સાથે સાથે કંઈક નક્કર ખોરાક / નાસ્તો પણ લઈ લેવો જોઈએ જેથી થોડા સમય પછી પછી પાછી તકલીફ ન થાય. જો દર્દી બેહોશ થઈ ગયો હોય તો એવા દર્દીને મોં વાટે કંઈ આપવાનો પ્રયત્ન કરવાને બદલે તાત્કાલિક હોસ્પિટલ ભેગો કરવો જોઈએ જ્યાં નસમાં ગ્લુકોઝના ઇન્જેક્શન / બાટલા આપીને દર્દીની જિંદગી બચાવી શકાય.

**ડાયાબીટીક કીટોએસિડોસીસઃ-** સામાન્ય રીતે બાળપણથી જ શરૂ થઈ જતા ઇન્સ્યુલિન આધારિત ડાયાબિટીસમાં આ પ્રકારનું કોમિલકેશન થાય છે. જ્યારે શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટી જાય અને ગ્લુકોગોન નામના અન્ય અંતઃસ્વાપનું પ્રમાણ વધી જાય ત્યારે આવી તકલીફ ઉદ્ભવે છે. સામાન્ય રીતે કોઈ ચેપ લાગવાથી, ઓપરેશન કરવવાથી કે માનસિક તાણને કારણે અચાનક જ કીટોએસિડોસીસની શરૂઆત થાય છે. ઘણા દર્દીઓ પોતાની ઈચ્છા પ્રમાણે અચાનક જ ઇન્સ્યુલિનનાં ઇન્જેક્શન લેવાનું બંધ કરી દે ત્યારે પણ ડાયાબીટીક કીટોએસિડોસીસની તકલીફ થાય છે.

કીટોએસિડોસીસમાં દર્દીના શરીરમાં ગ્લુકોઝ અને કીટોન બોડીજનું પ્રમાણ ખૂબ વધી જાય છે, જેને કારણે ઉલ્ટી-ઉભકા, બેચેની, ખૂબ મરી જવી, વારંવાર વધુ પ્રમાણમાં પેશાબ જવું, ખૂબ તરસ લાગવી, મોં-ગળુ સૂક્કાવાં, શાસોશ્વાસ ઝડપી ચાલવા વગેરે અનેક તકલીફો થાય છે અને છેવટે દર્દી બેભાન થઈ જાય છે. દર્દીના લોહી-પેશાબની તપાસમાં ગ્લુકોઝ વધી ગયેલ જણાય અને ‘એસિટોન’ ની હાજરી જણાય.

આ તકલીફમાં, દર્દીને દાખલ કરીને તાત્કાલિક સલાઈનના બાટલાઓ તથા ઇન્સ્યુલિનના ઇન્જેક્શનો આપવામાં આવે છે. ડાયાબીટીક કીટોએસિડોસીસને લીધે બેહોશી ઉપરાંત પેટની તકલીફ પણ ઉદ્ભવે છે. ઉલ્ટી થવી, પેટ હુલવું, કબજીયાત થવી, ઉલ્ટીમાં લોહી નીકળવું વગેરે તકલીફો કેટલાક દર્દીમાં જોવા મળે છે. હુદયની

ગતિમાં અનિયમિતતા, હદ્યના પરમીગમાં ઘટાડો, હાર્ટ ફેર્લબ્યર કે હાર્ટ એટેકની શક્યતા પણ ક્રીટોએસિડોસીસ દરમ્યાન વધી જાય છે. નિયમિત ઈન્સ્યુલિનનાં ઈન્જેક્શન લેવાની કાળજી તથા શારીરિક-માનસિક તાણની સ્થિતિમાં તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવાથી આ કોમ્પ્લિકેશનને થતું જ અટકાવી શકાય છે.

**હાઈપર-ઓસ્મોલર કોમા :-** પુખ્તવયના ડાયાબિટીસમાં લોહીની અંદર ગલુકોજનું પ્રમાણ ખૂબ જ વધી જાય ત્યારે “હાઈપર-ઓસ્મોલર કોમા” ની તકલીફ ઉદ્ભવે છે. લોહીમાં ગલુકોજનું પ્રમાણ ૫૦૦-૭૦૦ મિ.ગ્રા.ડિ.લી. કરતાં પણ વધી જાય ત્યારે પેશાબ વાટે ખૂબ મોટા પ્રમાણમાં ગલુકોજ અને પાણી નીકળી જાય છે. પરિણામે, શરીરની અંદર પાણીનું પ્રમાણ ઘટી જાય છે; દર્દીના હોટ-મૌં-ગળું સુકાવા લાગે છે; શરીર ઢું થવા લાગે; બી.પી. ઘટવા માંડે; નસોની અંદર લોહીનું પરિભ્રમણ ધીમું થઈ જાય અને કયારેક નસની અંદર જ લોહી ગંઠાવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે.

મગજમાંથી પ્રવાહી ઘટી જવાથી વિચારશક્તિ મંદ પડવા લાગે છે, ગુંચવાડા ઉદ્ભવે છે અને કયારેક ખેંચ પણ આવે છે. જો તાત્કાલિક યોગ્ય સારવાર ન મળે તો દર્દી બેહોશ થઈ જાય છે. એક વાર દર્દી બેહોશ થઈ જાય પછી બચવાની શક્યતા પચાસ ટકાથી ઓછી રહે છે. આવા દર્દીને હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરી સલાઈનના બાટલા ઝડપભરે ચઢાવવા પડે છે. શરીરમાં કોઈપણ જાતનો બેકેટેરિયાનો ચેપ હોય તો યોગ્ય એન્ટિબાયોટિકની મદદથી એની સારવાર કરવી પડે છે.

આમ, ડાયાબિટીસના દર્દીઓમાં ગલુકોજની મોટી વધઘટ ઘણા દર્દીઓને બેભાનાવસ્થામાં ધોકલી દે છે. આવું ન થાય એ માટે નિયમિત દાક્તરી તપાસ કરાવવી જરૂરી છે. એ ઉપરાંત સૌથી વધુ કાળજી દવા / ઈન્જેક્શનો નિયમિતપણે લેવાની રાખવી જોઈએ. દવા કે ઈન્જેક્શન લીધા પછી સમયસર ખોરાક લેવાનું યાદ રાખવું જોઈએ. ગલુકોજ ઘટાડવાની દવા / ઈન્જેક્શન લીધા પછી ખોરાક લેવાનું ભૂલી જનાર કે ઉપવાસ કરનારાઓ જાણી જોઈને ઉપાય હોરી લે છે.

શરીરમાં શુગાર ઘટી જાય તો ચકકર આપે, માથું ખાલી લાગે, પરસેવો થઈ જાય, હાથ પગ પાણી પાણી થઈ જાય, ધૂજારી આપે, હૃદયના ધનકરા વધી જાય, આંખે અંધારા આપે, મગજમાં ગુંચવાડા ઉદ્ભવે, ખેંચ અને છેવટે બેભાનાવસ્થા આપે.

## ડાયાબિટીસની સારવાર

ડાયાબિટીસની બીમારીની સારવારમાં સૌથી પહેલાં ખોરાકની પરેજી આવે છે. કસરત કરવી અને વજન ઘટાડવું એ ડાયાબિટીસની બીમારી માટે બીજી અગત્યની બાબત છે. જો આ સાદા અને દવા વગરના ઈલાજોથી ડાયાબિટીસ કાબૂમાં ન રહે તો જ દવાઓ અને ઈન્જેક્શનો લેવાં પડે છે. અહીં ડાયાબિટીસના દર્દીઓ માટે ખોરાકની પરેજી, કસરત, દવાઓ અને ઈન્સ્યુલિન ઈન્જેક્શનો અંગે વિગતે વારાફરતી ચર્ચા કરી છે.

### ડાયાબિટીસના દર્દીએ ખોરાકમાં શું પરેજુ રાખવી?



પુષ્ટવયના ડાયાબિટીસમાં ખોરાકની પરેજી અંગે વૈજ્ઞાનિકોમાં પણ ધજાં વર્ષોથી ચર્ચા વિચારણા થયા કરે છે અને જેમ જેમ નવી નવી શોધ થતી રહે છે તેમ તેમ ખોરાકી પરેજી અંગેનાં સલાહ સુચનો બદલાતાં રહે છે. ઈન્સ્યુલિનની શોધ થઈ એ પહેલાના (સદીઓ જુના) જમાનામાં ડાયાબિટીસના દર્દીના પેશાબમાં શુગર જતી હોવાથી એનું પ્રમાણ શરીરમાં જાળવી રાખવાના ઉદેશથી એવા દર્દીને વધુ સાકર ખવડાવવામાં આવતી! આ પછી જમાનો બદલાતો ગયો. એક પછી એક શોધે આપણા ડાયાબિટીસ તથા ખોરાક અંગેના ખ્યાલો બદલ્યા. ડાયાબિટીસના દર્દીને ખોરાક અંગે જે સલાહ આપવામાં આવે છે તે આજથી વીસ વર્ષ પહેલાં કંઈક જુદી જ હતી એટલે પણ્ણીસ ત્રીસ વર્ષ પહેલાં જે દર્દીને ડાયાબિટીસ થયો હોય એ દર્દીને ધજી જુદી જુદી બદલાતી રહેતી ખોરાકી સલાહ સાંભળવા મળી હોય એવું બને. હજુ આજની તારીખે પણ સર્વસ્વીકૃત ખોરાકી પરેજી શોધાઈ નથી. અહીં લખેલ પરેજી પણ થોડાં વર્ષોમાં બદલાઈ જાય એવી પૂરી શક્યતાઓ સાથે પરેજની ચર્ચા કરી છે. સૌથી પહેલાં ખોરાકી પરેજની જરૂરિયાત અંગે જ ચર્ચા કરી લઈએ. ડાયાબિટીસની બીમારીમાં લોહીની અંદર જલુકોઝનું પ્રમાણ વધી જાય છે, એ સૌ કોઈ જાણો છે. ખોરાકનું પાચન થાય ત્યારે એમાં રહેલ જલુકોઝ ધજા મોટા પ્રમાણમાં

આંતરડામાંથી લોહીમાં જાય છે. સામાન્ય તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં ગ્લુકોજનું પ્રમાણ વધે કે તરત જ એ ગ્લુકોજને લોહીમાંથી જુદા જુદા કોષોની અંદર પહોંચારી દેવા માટે ઈન્સ્યુલિન નામનો અંતઃઆપ જરે છે. જેટલા પ્રમાણમાં ગ્લુકોજ વધે એટલા પ્રમાણમાં તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં ઈન્સ્યુલિન જરે છે અને ગ્લુકોજનું પ્રમાણ નિયંત્રિત રહે છે. પરંતુ ડાયાબિટીસના દર્દીમાં કં તો જરૂર જેટલું ઈન્સ્યુલિન બનતું નથી અથવા તો બનેલું ઈન્સ્યુલિન જરૂરી અસરો કરી શકતું નથી. આને લીધે જ્યારે પણ ડાયાબિટીસનો દર્દી કંઈ ખોરાક લે ત્યારે એના શરીરમાં ગ્લુકોજનું પ્રમાણ ઘણું વધી જવાની શક્યતા રહે છે. લોહીમાં ગ્લુકોજનું પ્રમાણ અમુક હદ્થી (ભયજનક સપાટીથી) વધે પછી આ ગ્લુકોજથી લાભ થવાને બદલે નુકસાન થવા લાગે છે. અને જેટલો લાંબો સમય ગ્લુકોજનું પ્રમાણ ભયજનક સપાટીની ઉપર રહે એટલા પ્રમાણમાં નુકસાન વધારે થાય છે.

મોટા ભાગના ખાદ્યપદાર્થો ત્રાણ મુખ્ય ઘટકમાંથી બનતા હોય છે:- (૧) કાર્બોહાઇડ્રેટ (૨) ચરબી (૩) પ્રોટીન. આ દરેક ઘટકનું ચોક્કસ પ્રમાણ જાળવીને ખોરાકની પરેજી નક્કી કરવી પડે છે. અમેરિકન ડાયાબિટીસ એસોસિએશનના મત પ્રમાણે ડાયાબિટીસના દર્દીઓ એના ખોરાકની આશરે ૬૦ ટકા કેલરી કાર્બોહાઇડ્રેટમાંથી, ૩૦ ટકાથી ઓછી કેલરી ચરબીમાંથી અને ૧૦ ટકા કેલરી પ્રોટીનમાંથી મેળવવી જોઈએ. આ ખોરાકમાં ૪૦ ગ્રામ જેટલા ફાઈબર (રેસા) હોવા જોઈએ અને ૩૦૦ મિ.ગ્રા. કરતાં ઓછું કોલેસ્ટેરોલ હોવું જોઈએ. ચરબીના ૩૦ ટકા પૈકી ૬ થી ૮ ટકા પોલી-અનસેચ્યુરેટેડ, ૧૦ ટકાથી ઓછી સેચ્યુરેટેડ અને બાકીની મોનો-અનસેચ્યુરેટેડ ચરબી હોવી જોઈએ. આપણા ભારતીય ખોરાક કરતાં અમેરિકન ખોરાક ઘણ્ણો જુદો હોવાથી, ભારતીય ડાયાબિટીસના દર્દીમાં ચરબીમાંથી મળતી કેલરી, કુલ કેલરીના માત્ર ૧૫-૨૦ ટકા જેટલી જ મળે અને બાકીની બધી કેલરી કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનમાંથી મળે એવું ગોઠવવું જોઈએ.

**ચરબી:** ડાયાબિટીસના દર્દીઓમાં ખોરાકની સૌથી અગત્યની પરેજી એ ખોરાકમાં ચરબીનું પ્રમાણ ઘટાડવાની છે. ચરબીનું પ્રમાણ ખોરાકમાં જેટલું ઓછું હોય એટલો ફાયદો થાય છે. ચરબીના રોજિંડા વપરાશમાં માત્ર ૪૦ ગ્રામનો વધારો ડાયાબિટીસ થવાની શક્યતા ૬૦૦ ટકા વધારી દે છે. લોહીમાં ફરતી અને પેટની આસપાસ જમા થયેલી ચરબી ઈન્સ્યુલિનની અસરકારકતા ઘટાડી નાંખે છે. બધી ચરબીમાં, સામાન્ય રીતે સેચ્યુરેટેડ (સંતૃપ્ત) ચરબી નુકસાનકારક ગણણા છે જે હાઈ તથા બી.પી.ની બીમારી નોતરે છે. સંતૃપ્ત ચરબી ઓછી કરવાની સાથોસાથ જો મોનો-અનસેચ્યુરેટેડ ચરબીનું પ્રમાણ વધારી દેવામાં આવે તો ડાયાબિટીસના દર્દીઓમાં વિશેષ ફાયદો થાય છે. ખોરાકમાં સેચ્યુરેટેડ (સંતૃપ્ત) ચરબી ઓછી કરવા અને મોનો-અનસેચ્યુરેટેડ ચરબી વધારવા માટે સરસિયું કે તલનું તેલ વાપરવું

જોઈએ. માંસાહાર અને ધી, તગેલું, માખણ, મલાઈ વગેરે બંધ કરવાં જોઈએ. બદામ, અખરોટ વગેરેમાં મોનો-અનસેચુરેટેડ ચરબી ઘણી વધારે હોય છે. એનો ઉપયોગ થોડા પ્રમાણમાં કરી શકાય. અલબત્ત, કુલ ચરબીનું પ્રમાણ કુલ કેલરીના ૧૫-૨૦ ટકાથી ઓછી કેલરી આપે એટલું જ રાખવું જોઈએ. ટૂંકમાં, આખા દિવસ દરમ્યાન એક માણસે ૧૫ થી ૨૦ ગ્રામ (ત્રણ થી ચાર ચમચી) જેટલું જ ધી / તેલ / માખણ / મલાઈ ખાવું જોઈએ.

**કાર્બોહાઇડ્રેટ:** જે ઘટકના પાચનથી જ્લુકોઝ અથવા એને મળતી આવતી અન્ય શર્કરા છૂટી પડે એ ઘટકને આપણાં હેતુ માટે આપણે કાર્બોહાઇડ્રેટ કહીએ.

આપણા ખોરાકની લગભગ બધી ચીજો ટોટલી, દાળ, ભાત, શાક, ફળ, કઠોળ વગેરે પરે ત્યારે એમાંથી જ્લુકોગ છૂટો પડે છે. આ બધી વસ્તુઓમાં કાર્બોહાઇડ્રેટ આવેલ હોય છે. આ કાર્બોહાઇડ્રેટ બે પ્રકારના હોય છે. સાદા કાર્બોહાઇડ્રેટ અને સંકુલ કાર્બોહાઇડ્રેટ. સાદા અથવા રીફાઈન કાર્બોહાઇડ્રેટમાં જ્લુકોઝ, ખાંડ (સુકોઝ), મધુ, ગોળ, પીપર, જામ, જેલી વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે સંકુલ કાર્બોહાઇડ્રેટમાં સ્ટાર્ચ (અનાજ / કઠોળ વગેરેમાં રહેલ), સેલ્યુલોજ / પેક્ટીન (રેસા) વગેરેનો સમાવેશ થાય છે.

ડાયાબિટીસના દર્દીઓએ એવા પ્રકારનો કાર્બોહાઇડ્રેટ ખોરાક લેવો કે જેનાથી લોહીમાં જ્લુકોઝનું પ્રમાણ અચાનક વધી ન જાય. આ માટે એકલી ખાંડ અથવા જ્લુકોઝને (સાદા કાર્બોહાઇડ્રેટ) વધુ પ્રમાણમાં ન લેવા જોઈએ. જો ખાંડ કે જ્લુકોઝ થોડા પ્રમાણમાં (કુલ કાર્બોહાઇડ્રેટના પાંચ ટકા) અન્ય ખોરાકની સાથે લેવામાં આવે તો ખાસ તકલીફ નથી થતી. ટૂંકમાં મીઠાઈ, શરબત, ખાંડવાળી ચાવગેરે એકલા ન પીવાં, પરંતુ બહુ મન થયું હોય ત્યારે જમવા સાથે કયારેક લેવાં. આ રીતે મીઠાશ લેવાથી ડાયાબિટીસના કાબૂમાં ખાસ કોઈ ફરક પડતો નથી. રેસાયુક્ત ખોરાકની સાથે કાર્બોહાઇડ્રેટ લેવાથી પણ લોહીમાં જ્લુકોઝનું પ્રમાણ અચાનક એકસાથે વધતું અટકે છે.

તાજેતરમાં થયેલ અભ્યાસોથી બીજી એક રસપ્રદ હકીકત એ જાળવા મળી કે બધા કાર્બોહાઇડ્રેટ ખાધા પછી જુદા જુદા પ્રમાણમાં લોહીના જ્લુકોઝને અસર કરે છે. દરેક ખોરાક કટલા પ્રમાણમાં લોહીમાં જ્લુકોગનો વદારો કરે છે એ પ્રમાણને માપવા માટે ગલાઈસેમીક ઇન્ડેક્શન નામના માપનો વપરાશ શરૂ થયો છે. જે ખોરાકની ગલાઈસેમીક ઇન્ડેક્શન વદારે હોય એ ખોરાક ડાયાબિટીસના દર્દી માટે વધુ નુકસાનકારક ગણી શકાય. મકાઈના પૌંચા, બટાટા, મધુ વગેરેનો ગલાઈસેમીક ઇન્ડેક્શન ૮૦ થી ૮૦ ટકા છે, જ્યારે સોયાબીન, ફુકટોઝ વગેરેનો ગલાઈસેમીક ઇન્ડેક્શન ૨૦ ટકા આસપાસ છે. સાથેના કોષ્ટકમાં જુદી જુદી ચીજોના ગલાઈસેમીક ઇન્ડેક્શન આપેલ છે. આ કોષ્ટક માત્ર એક સમજણ ઊભી કરવા માટેના ઉદાહરણ તરીકે મુક્યું છે જે દર્શાવે છે કે એક

સરખા પ્રમાણમાં ડાર્ભોલાઈફ્ટ ધરાવતા ખોરાકમાંથી જુદા જુદા પ્રમાણમાં લોહીનો ગલુકોજ વધે છે. દર્દી અને સંજોગો પ્રમાણે આ ગલાઈસેમીક ઈન્ડેક્શ બદલાયા કરે છે અને દર્દી જાતે ઘર-બેઠા ગલુકોમીટરની મદદથી જો ખોરાક લીધા પછી લોહીનો ગલુકોજ માપતા રહેતો હોતાના ખોરાકની ગલાઈસેમીક ઈન્ડેક્શ અંગે જાણી શકે છે.

સાથેના કોષ્ટકમાં જુદા જુદા ખાદ્યપદાર્થોનો ગલાઈસેમીક ઈન્ડેક્શ દર્શાવેલ છે. યાદ રાખો: (૧) જેનો ગલાઈસેમીક ઈન્ડેક્શ ઓછો એ પદાર્થ ડાયાબિટીસના દર્દી માટે વધુ હિતાવહ. (૨) ઘણી વખત દર્દીના બંધારણ પ્રમાણે અને અન્ય ખાદ્ય પદાર્થની હાજરીના આધારે ગલાઈસેમીક ઈન્ડેક્શ બદલાયા કરે છે. (૩) આ ઈન્ડેક્શ માત્ર સામાન્ય જાણકારી પૂરતા જ છે અને હજ સંશોધનો બાકી છે. જેથી નિશ્ચિતપણે કયો ખોરાક ખાવો અને કયો ન ખાવો એ કહી શકાય નહીં. (૪) પોતાને કયો ખોરાક વધુ માફક આવે છે એનો અભ્યાસ દર્દી જાતે ગલુકોમીટરની મદદથી કરી શકે છે.

### જુદા જુદા ખાદ્ય પદાર્થોનો ગલાઈસેમીક ઈન્ડેક્શ

ખાદ્ય પદાર્થ	ગલાઈસેમીક ઈન્ડેક્શ	ખાદ્ય પદાર્થ	ગલાઈસેમીક ઈન્ડેક્શ
મકાઈ પૌઆ	૮૦ - ૯૦ %	બટેટાં	૮૦ - ૯૦ %
મધુ	૮૦ - ૯૦ %	બ્રેન	૭૦ - ૮૦ %
ભાત	૭૦ - ૮૦ %	હાથછડના ભાત	૬૦ - ૭૦ %
બીટ	૬૦ - ૭૦ %	કેળાં	૬૦ - ૭૦ %
સૂકી દ્રાક્ષ	૬૦ - ૭૦ %	ઘઉની સેવ	૫૦ - ૬૦ %
સ્વીટકોર્ન	૫૦ - ૬૦ %	બિસ્કીટ	૫૦ - ૬૦ %
ખાંડ	૫૦ - ૬૦ %	બટેટાંની કાતરી	૫૦ - ૬૦ %
વટાણા	૪૦ - ૫૦ %	મોસંબી	૪૦ - ૫૦ %
સફરજન	૩૦ - ૪૦ %	દૂધ	૩૦ - ૪૦ %
ટમેટાં	૩૦ - ૪૦ %	વાલ	૨૦ - ૩૦ %

**પ્રોટીન :** ભારતીય શાકાહારી ખોરાકમાં પ્રોટીન મુખ્યત્વે દૂધ, અનાજ અને કાળમાંથી મળે છે. સામાન્ય રીતે દરેક તંદુરસ્ત પુરુષે રોજનું પંપ ગ્રામ અને સ્ત્રીએ રૂપ ગ્રામ (આશરે દર ડિલોગ્રામ વજનદીઠ એક ગ્રામ પ્રમાણે) પ્રોટીન ખોરાકમાં લેવું જોઈએ. ડાયાબિટીસના દર્દી અને તંદુરસ્ત વ્યક્તિ બંનેમાં આટલું જ પ્રોટીન રોજેરોજ ખોરાકમાં હોવું જોઈએ. જો ડાયાબિટીસને કારણે દર્દીની ડિડનીમાં ખરાબી થઈ ગઈ હોય તો પ્રોટીનનું પ્રમાણ આનાથી પણ ઓછું કરી દેવું જોઈએ.

દર કિલોગ્રામ વજનદીઠ આશરે ૦.૮૫ ગ્રામ પ્રોટીન કિડનીના દર્દીઓએ લેવું જોઈએ.

**રેસા:** શક્તિ આપનાર પદાર્થ-કાર્બોહાઇડ્રેટ, ચરબી અને પ્રોટીન જેટલી જ આવશ્યકતા શક્તિ ન આપનાર ખોરાકના રેસાની છે. તાજેતરમાં થયેલા અભ્યાસો દર્શાવે છે કે ખોરાકમાં રેસાનું પ્રમાણ પૂરતું હોય તો ડાયાબિટીસના દર્દીના શરીરમાં ગલુકોજનું પ્રમાણ ધીમે ધીમે અને ઓછી માત્રામાં વધે છે. દ્રાવ્ય રેસા - જેવા કે પેક્ટીન, ગમ (ગુંદર) અને કેટલાક હેમીસેલ્વ્યુલોઝ આ માટે ખૂબ ઉપયોગી છે, જ્યારે સેલ્વ્યુલોઝ, લીઝ્નીન વગેરે અદ્રાવ્ય રેસાઓ ડાયાબિટીસ ઘટાડવામાં મદદરૂપ થતાં નથી. અલબત્તા, અદ્રાવ્ય રેસા કબજીયાત અને કેન્સર જેવી બીમારી અટકાવવામાં મદદરૂપ થઈ શકે છે. આ રેસાને ખોરાકના ભાગ તરીકે (દા.ત. આખા અનાજ, કઠોળ, ફળો, શાક વગેરે તરીકે) લેવાથી વધુ ફાયદો થાય છે. બજારમાં તૈયાર મળતા રેસાના પેકેટ દવા તરીકે વાપરવાની કોઈ જરૂર હોતી નથી.

**જુદા જુદા ખોરાકમાં રહેલ રેસા** (સો ગ્રામ ખોરાકમાં રહેલ રેસાનું ગ્રામમાં વજન)

અનાજ/કઠોળ	રેસા	શાક/ફળો	રેસા	મસાલા	રેસા
સામો - કોદરી	૮	જામફળ / દાડમ	૫.૦	ધાળા	૩૨.૦
મગ, મઠ, વટાણા	૪	સરગવો, પાપડી	૪.૫	જરૂં	૧૨
જવ, ચણા	૩.૮	અંબણાં, ગુવાર	૩.૩	કળા તલ	૧૦
જુવાર	૧.૬	સીતાફળ	૩.૧	લવિંગ	૮.૫
બાજરી	૧.૨	કંકોડાં / પરવળ	૩.૦	મેથી, દાણા	૭.૦
ઘઉ નો લોટ	૧.૮	અળવીનાં પાન	૨.૬	કોપરુ	૪-૬
મેંદો	૦.૬	ચીકુ / દ્રાક્ષ	૨.૬	હિંગ	૪.૧
ચોખા, હાથછડ	૦.૬	ફલાવર	૨.૦	ખજૂર	૩.૭
ચોખા, મીલ	૦.૨	સફરજન, પૈંયા	૧.૦	તલ	૨.૮

**ડાયાબિટીસના દર્દીઓએ ખોરાક બાબત ખાસ દ્યાનમાં રાખવાની પરેજુઓ**  
ડાયાબિટીસના દર્દીઓ ઘણી વખત ખોટે ખોરી પરેજ કરીને, પોતે સ્વાસ્થ્યની ખૂબ કાળજી રાખે છે એવા ભ્રમમાં રાચતા હોય છે. જે વસ્તું ખોરાકમાંથી બંધ ન કરવાની હોય એ વસ્તુ અજ્ઞાનતાથી બંધ થઈ જાય અને જે વસ્તુ બંધ કરવી ખૂબ જરૂરી હોય એ ખાવાનું બેરોક્ટોક ચાલુ હોય એવું ઘણાં કિરસામાં જોવા મળે છે.

મોટી ઉમરે (પુખ્તવયે) જેમને ડાયાબિટીસ થાય છે એમાંથી ઘણાં બધા લોકોનું કાં તો વજન વધારે હોય છે અથવા એમના પેટની આસપાસ ચરબીના થર

જામેલાં હોય છે. વધુ પડતી ચરબી ડાયાબિટીસ કરવામાં અગત્યનો ફાળો આપે છે એટલે ડાયાબિટીસને કાબુમાં રાખવા માટે સૌથી અગત્યની પરેજી ખોરાકમાં કુલ કેલરી ઘટાડવાની છે. ભૂખ્યા રહીને નહીં, પરંતુ ઓછી ચરબી અને ઓછી કેલરીવાળા ખોરાકને જ પસંદ કરવાની ડાયમી ટેવ રાખવાથી ડાયાબિટીસના દર્દી કોઈ જાતની કોમ્પિલકેટ પરેજી કર્યા સિવાય સહેલાઈથી કાબુમાં રાખી શકે છે.

જો તંદુરસ્ત વ્યક્તિ પહેલેથી જ પોતાના સ્વસ્થ અને આહાર બાબત જાગૃત રહે તો એને ડાયાબિટીસ થવાની શક્યતા ખૂબ ઓછી રહે છે. અહીં જણાવેલ પરેજીના મુદ્દાઓ હકીકતમાં પરેજીના બદલે ખોરાકની સ્વસ્થ ટેવોના મુદ્દાઓ જ છે. એનો અમલ દરેક તંદુરસ્ત વ્યક્તિએ કરવો જોઈએ. આ સ્વસ્થ ખોરાકની ટેવોનો જ ચુસ્ત અમલ ડાયાબિટીસના દર્દીએ કરવો જરૂરી થઈ જાય છે. ડાયાબિટીસની પરેજી અંગેના મુખ્ય મુદ્દાઓની અહીં ચર્ચા કરી છે.

(૧) વિવિધતા સભર ખોરાક ખાવ:- રોજ રોજ એક જ જાતનો ખોરાક ખાવાને બદલે વિવિધતા પૂર્ણ ખોરાક ખાઓ. એક જ જાતના અનાજ-કઠોળ-શાક કે ફળને બદલે રોજ રોજ અલગ અલગ પ્રકારના અનાજ-કઠોળ-શાક કે ફળ પસંદ કરો જેથી વિવિધ સ્વાદ માણી શકાય અને એક પ્રકારના ખાદ્યપદ્ધતિમાં રહેલી ઉપણ બીજા ખાદ્યપદ્ધતિ દ્વારા સરભર થઈ જાય. કોઈ ફળમાં પોટેશિયમ વધુ મળે તો બીજામાંથી વિટામિન્સ વધુ મળે એવું બને.

(૨) જેટલું વાપરો એટલું ખાવ :- દિવસ દરમ્યાન વિવિધ પ્રવૃત્તિઓ અને કસરત કરવા માટે જેટલી શક્તિ (કેલરી) વાપરી શકો એટલી જ શક્તિ (કેલરી) ધરાવતો ખોરાક લો. તમે વાપરી શકો એનાં કરતાં વધુ શક્તિ ધરાવતા ખોરાક રોજ ખાવાથી તમારું વજન ઘટશે જે તમારા સ્વાસ્થ માટે ખતરારૂપ સાબિત થાય છે. વધુ વજન ધરાવતાં ડાયાબિટીસના દર્દીઓએ તો દૈનિક પ્રવૃત્તિઓ અને કસરત દ્વારા જેટલી શક્તિ વપરાય એનાં કરતાં આશરે ૫૦૦ કિલો કેલરી શક્તિ ઓછી મળે એ રીતે ખોરાકનું આખોજન કરવું જોઈએ જેથી ધીમે ધીમે વજન ઘટે. દર મહિને અડધો કે એક કિલો વજન ઓછું થાય અને વર્ષે પાંચ કિલો વજન ઘટે તથા ઘટેલું વજન જળવાઈ રહે તો ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવું સહેલું પડે છે. ખોરાક દ્વારા મળતી શક્તિ (કેલરી) ઘટાડવા માટે ભૂખ્યા રહેવાની જરૂર નથી. પરંતુ ઓછી કેલરી ધરાવતો ખોરાક પસંદ કરવાની જરૂર છે. ધી-તેલ-માખણ-માંસાહાર વગેરે વધુ ચરબી અને વધુ કેલરી ધરાવતાં પદોર્થ છે. જ્યારે કચ્ચાબર, ભાજી, ફળો વગેરે પ્રમાણમાં ઓછી કેલરી અને નહીંવત ચરબી ધરાવતાં ખાદ્યપદ્ધતિ છે. ખોરાકમાં ભાજી, કચ્ચાબર, ફળો વધારો અને તળોલું, ફરસાણા, ધીની મીઠાઈઓ, બીરકીટ, માંસાહાર વગેરે ખાવાનું બંધ કરી દો.

(૩) વધુ રેસાયુક્ત ખોરાક પંસદ કરો :- ખોરાકના રેસા દરેક તહુરસ્ત વ્યક્તિના ખોરાકમાં પૂરતા પ્રમાણમાં હોવી જરૂરી છે. ડાયાબિટીસના દર્દીઓ તો ખોરાકમાં પૂરતાં પ્રમાણમાં રેસા છે એની પૂરી ખાત્રી કરી લેવી જોઈએ રેસા છે. રેસાઓ લોહીમાં સુગરને અચાનક વધતું અટકાવે છે. તેમજ કોલેસ્ટોલ પણ વધતું અટકાવે છે. આખા અનાજ અને કઠોળમાં રેસા વધુ હોય છે. નાના દાણાવાળા અનાજ (દા.ત. જવ, કોદરી, સામો, નાગલી) વગેરેમાં વધુ રેસા હોય છે. એટલે મોટા દાણાવાળા અનાજ ઘંઉ-ચોખા વગેરે ને બદલે નાના દાણાવાળા અનાજને પેહલી પસંદગી આપો. એ જ રીતે મિલના પોલિશ ચોખાને બદલે હાથછડાનાં ચોખા અને મેંદાને બદલે ઘંઉનો લોટ વાપરવાનું પસંદ કરો. દાળને બદલે કઠોળ અને છોલેલા ફળ ને બદલે શક્ય હોય તો બધા ફળો છોલ્યા વગર ખાવાની ટેવ રાખો. કદમ્બૂળમાં રેસા પ્રમાણમાં ઓછા હોય છે. તેને બદલે ભાજી વધુ પંસદ કરો.

(૪) ઓછુ કોલેસ્ટોરોલ અને ઓછી સંતૃપ્ત ચરબી ખાવ :- ડાયાબિટીસના દર્દીમાં થતાં મોટા ભાગના લાંબાગાળાના કોમ્પ્લિકેશન માટે કોલેસ્ટોરોલ અને ચરબી ઓછાવતા અંશે જવાબદાર હોય છે. દૂધ અને માંસાહારી ખોરાકમાં કોલેસ્ટોરોલ આવે છે જ્યારે વનસ્પતિજ્ઞ તેલોમાં સંતૃપ્ત ચરબી હોય છે જેમાંથી કોલેસ્ટોરોલ બને છે. લોહીમાં ફરતી ચરબી ડાયાબિટીસના દર્દીઓની રક્તવાહિનીઓ પર નુકશાન પહોંચાડી એ રક્તવાહિનીને સાંકડી અને કદણ કરી મૂકે છે, જે છેવટે હૃદયરોગ કે પગના ગેન્જાનરી માટે કારણભૂત બને છે. માંસાહાર અને ઘી-મલાઈ-માખણનો વપરાશ બંધ કરી દેવો ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક છે. આ ઉપરાંત, તેલનો વપરાશ માત્ર શાક-દાળના વધાર પૂરતો જ કરવો અને તળેલી વસ્તુઓ તથા મોણવાળી વસ્તુઓ (ભાખરી-થેલપાં, પૂરી, પરાઠા વગેરે) નો વપરાશ બંધ કરવો. બધા બીસ્કીટોમાં ધમનીઓ માટે ભારે ખતરનાક હાઇડ્રોજનેટેડ વેજટેબલ ધી હોય છે જેનો વપરાશ સંપૂર્ણપણે બંધ કરી દેવો ઈચ્છનીય છે.

(૫) ખાંડ-ગોળનું પ્રમાણ ખૂબ વધારે ન હોય એવો ખોરાક ખાવ:- ખાંડ-ગોળ જેવાં ગયા પદાર્થ ડાયાબિટીસના દર્દીએ સાવ બંધ કરી દેવા જોઈએ એવું નથી પરંતુ એનું પ્રમાણ હિવસમાં ચાર નાની ચમચી (વીસ ગ્રામ) થી વધે નહીં એની કાળજી ડાયાબિટીસના દર્દીઓએ તેમજ દરેક તહુરસ્ત વ્યક્તિએ પણ રાખવી જરૂરી છે. વધુ પડતું ગળપણ વિટામિન અને રેસા વગરની માત્ર શક્તિ (કલરી) આપે છે. જે લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે જોખમી છે. જો ખોરાકમાં ખાંડ-ગોળ “ઉમેરવા” હોય તો અન્ય કાર્બોહાઇડ્રેટ (સ્ટાર્ચ વગેરે) નું પ્રમાણ એટલું ઓછુ કરવું જોઈએ જેથી કુલ કેલરી વધે નહીં.

(૬) મીઠુ-સોડા-પાપડ નો વપરાશ ઘટાડો :- ડાયાબિટીસ અને હાઇબ્લડપ્રેશરની બીમારી એકબીજાની જોડીદાર છે. એક થાય એટલે બીજી બીમારી

થવાની શક્યતા ખૂબ વધી જાય. ડાયાબિટીસના દર્દીને હાઈબ્લડપ્રેશર લાગુ પડે તો કીડની અને હૃદયને નુકશાન થવાની શક્યતા ખૂબ વધી જાય છે. આવું ન થાય એ માટે ડાયાબિટીસના દરેક દર્દીએ મીહુ-સોડા-પાપડ વગેરે સોડિયમ ધરાવતી વસ્તુઓનો વપરાશ ઘટાડી નાંખવો જરૂરી છે. ટૈનિક ખોરાકમાં કુલ છ ગ્રામ મીહુ પૂરતું છે એનાથી વધુ મીહુ ભારે નુકશાન કરે છે. એક ચપટી (બે આંગળી અને અંગુઠાની બનેલી) માં આશરે બે ગ્રામ મીહુ આવે એટલે દરેક વ્યક્તિદીઠ કુલ ત્રણ ચપટીથી વધુ મીહુ ન વપરાય એ ઈચ્છનીય છે. સોડા ધરાવતી વાનગીઓ અને ફરસાણ (દા.ત. ગાંઠીયા, ફાફડા, પાપડી વગેરે) નો વપરાશ પણ મર્યાદિત કરવો જરૂરી છે.

**(૭) વ્યસનોથી દૂર રહો :-** તમાકુ-દારનું વ્યસન તંદુરસ્ત વ્યક્તિને તેમજ ડાયાબિટીસના દર્દીઓને નુકશાન કરે છે. આવા વ્યસનથી સંપૂર્ણપણે દૂર રહવું ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જરૂરી છે.

ટૂંકમાં, ડાયાબિટીસના દર્દીએ સ્વસ્થ રહેવા માટે સ્વાસ્થ્યપ્રદ ખોરાક ચુસ્તપણે ખાવાનું રાખવું જોઈએ. ડાયાબિટીસના દર્દી માટે અને અન્ય તંદુરસ્ત વ્યક્તિ માટેનો સ્વસ્થ ખોરાક લગભગ એક સરખો ૪ હોય છે, ફરક માત્ર એટલો ૪ હોય છેકે ડાયાબિટીસના દર્દીએ વધુ ચુસ્તપણે સ્વાસ્થ્યપ્રદ ખોરાકનો અમલ કરવાનો હોય છે અને વજન વધારે હોય તો વજન ઘટાડવા માટે ચરબી અને કેલશીના કુલ વપરાશમાં ઘટાડો કરવાનો હોય છે.

## દર્દીઓને મુંજવતા કેટલાક પરેજ અંગેના સવાલો

**ડાયાબિટીસના દર્દીઓ કેટલું ખાવું?** જેમને પુખ્તવથે ડાયાબિટીસની બીમારી લાગુ પડી હોય એમાંથી અડવાથી વધુ લોકોનું વજન જરૂર કરતાં ઘણું વધારે હોય છે. મેદસ્વીતાને પરિણામે ઈન્સ્યુલિનની ધારી અસર થતી નથી (અસર ઓછી થઈ જાય છે) અને એને લીધે લોહીના ગ્લુકોઝનું નિયંત્રણ રહેતું નથી. માત્ર વજન ઘટાડવાથી ઈન્સ્યુલિનની અસરકારકતા વધી શકે છે અને ડાયાબિટીસ કાબૂમાં આવી બાય છે. વધુ વજન ધરાવતા ડાયાબિટીસના દર્દીઓને સામાન્ય રીતે રોજના ખોરાકમાંથી મળતી કેલરીમા પાંચમા ભાગનો ઘટાડો કરવાનું કહેવામાં આવે છે. વધુ ચોક્સાઈથી કહેવું હોય તો એમ કહી શકાય કે રોજિંદી જરૂરિયાત હોય એના કરતાં આશરે ૫૦૦ કેલરી ઓછી ખાવી જોઈએ. આમ કરવાથી દર મહિને આશરે એકથી દોઢ કિલો જેટલું વજન ઘટે છે. ખોરાકમાંથી કેલરી ઘટાડવાનો સૌથી સારો રસ્તો ખોરાકમાંથી ચરબી સાવ ઘટાડી નાંખવાનો છે. એક ગ્રામ ચરબીમાંથી નવ કેલરી મળે છે. એટલે ખોરાકમાં વધારાની ૫૦ ગ્રામ ચરબી ઓછી થઈ જાય તો ૪૫૦ કેલરી એમ જ ઓછી થઈ શકે છે. ટૂંકમાં, વજન ઘટાડવા માટે ઓછું ખાવાની કે ભૂખા રહેવાની જરૂર નથી, પેટ ભરીને ખાવ - માત્ર ચરબી (ધી-તેલ) ઓછા કરો અને લીલા કાચા શાકભાજુ (સલાડ) ખાવાનું વધારી દો.

**ડાયાબિટીસના દર્દીએ કયારે અને કેટલી વખત ખાવું?** ડાયાબિટીસના દર્દીએ ખોરાકની પરેજની સાથોસાથ ખોરાકની નિયમિતતા જળવવી પણ જરૂરી છે. આખા દિવસમાં માત્ર એક કે બે વખત જ ખાવાની ભૂલ કરવી નહીં. ઓછામાં ઓછું દિવસમાં ચાર-પાંચ વખત ખાવું. એકસાથે વધારે ખાવાને બદલે વારંવાર થોડું થોડું ખાવાથી ડાયાબિટીસ પરનું નિયંત્રણ વધુ સારુ થાય છે. ખોરાકના સમયને ઈન્સ્યુલિનના ઈન્જેક્શન કે દવાના સમય સાથે મેળવવો જરૂરી છે. દવા કે ઈન્જેક્શન લીધા પછી અદદ્યો કલાકમાં ખાવું ખૂબ જરૂરી છે કારણ કે નહીંતર દવા-ઈન્જેક્શનની અસરથી લોહીમાં ગ્લુકોઝ ઘટવા લાગશે અને ખોરાકમાંથી ગ્લુકોઝ પહોંચશે નહીં. આવું થાય ત્યારે ઘણીવાર દર્દીને ચક્કર આવે, શરીરે પરસેવો થઈ જાય, હદદ્ય જડપથી ધબકવા લાગે અને કયારેક દર્દી બેહોશ પણ થઈ જાય. આમ, ખોરાક અને દવાના સમયમાં તાલમેલ રાખવો જરૂરી છે.

**ડાયાબિટીસના દર્દીએ ભાત ન ખાવા?** ડાયાબિટીસની પરેજ બાબત આ એક ખોટી માન્યતા ખૂબ વ્યાપક છે. હકીતકમાં ભાત કે ઘંઉમાંથી લગભગ એક સરખા પ્રમાણમાં શર્કરા મળે છે. એટલે રોટલી ખાવાથી ડાયાબિટીસ કાબૂમાં રહે અને ભાત ખાવાથી ન રહે એ માન્યતા બીલકુલ ખોટી છે. ઉદ્દુ, ધી ચોપડેલી રોટલી ખાવા કરતાં ધી નાંખ્યા વગરના રોટલીના લોટ જેટલાં જ (કાચા)- વજનના ભાત

ખાવા વધુ ઈચ્છનીય છે. જો મિલના પોલિશ ચોખાને બદલે હાથછડના ચોખામાં, મિલના ચોખા કરતાં અનેક ગણા વધારે રેસા હોય છે જે દર્દી માટે ફાયદાકારક બને છે. અન્ય રેસાયુક્ત ખોરાક (જેમકે આખા ધાન્ય, કઠોળ, ફળો અને ભાજી) પૂરતાં પ્રમાણમાં લેવાની કાળજી ડાયાબિટીસના દર્દી માટે અગત્યની છે. કોદરી, નાગલી, કાંગ, રાગી, જંબ જેવાં ધાન્ય ઘંઉ-ચોખા કરતાં વધુ રેસા ધરાવે છે અને એનો ઉપયોગ વધારવો જોઈએ. મેથી અને ઈસબગુલના રેસા પણ ડાયાબિટીસને કાબૂમાં રાખવા માટે મહત્વના છે.

**ડાયાબિટીસના દર્દીએ જરા પણ ગણપણ ન ખાવું?** ડાયાબિટીસના દર્દીઓને સૌથી વધુ અણગમતી પરેજ ગળપણ બંધ કરવાની હોય છે. કોઈ પણ વ્યક્તિને ડાયાબિટીસ થાય એટલે સગા-સંબંધિ-મિત્રો-વડીલો-ડોક્ટરો બધા એક સલાહ તો આપે છે કે “તમારા ખાવામાંથી ખાંડ-ગોળ-મીઠાઈ વગેરે સંપૂર્ણપણે બંધ કરી દો! ચા ખાંડ વગરની પીવાની અને ગળી વસ્તુ નહીં ખાવાની”. આનાથી આગળ વધીને ઘણાં બધા લોકો એવી માન્યતા ધરાવે છે કે ડાયાબિટીસ થવાનું કારણ જ ગળી વસ્તુ હોય છે! ઘણાં દર્દીઓ એવું પૂછતાં આવે છે કે “સાહેબ હુ તો કદી ગળપણ ખાતો નથી તો મને ડાયાબિટીસ કેવી રીતે થયો?” ટૂંકમાં અત્યાર સુધી સામાન્ય લોકો એવું માનતા આવ્યા છે કે ગળપણ ખાવાથી ડાયાબિટીસ થાય તથા ડાયાબિટીસ થયો હોય તો ગળપણ ખાવાનું બંધ કરવું જોઈએ. મોટા ભાગના ડોક્ટરો પણ એવી જ સલાહ આપતાં હોય છે કે ડાયાબિટીસના દર્દી એ ખાંડ-ગોળ-મીઠાઈ ખાવી નહીં.

પરંતુ, તમને જાણીને આશ્રય થશે કે છેલ્લાં થોડા વર્ષોમાં થયેલાં અનેક અત્યાસોથી એવું જણાયું છે કે ખોરાકમાં થોડા પ્રમાણમાં (રોજના દશ-પંદર ગ્રામ) ખાંડ-ગોળ લેવાથી ડાયાબિટીસના નિયંત્રણમાં કોઈ નુકશાન થતું નથી! એક ચમચી ખાંડ અને એક ચમચી સ્ટાર્ચ (અનાજમાંથી મળતી શર્કરા) લગભગ એક સરખાં પ્રમાણમાં લોહીની સુગર વધારે છે. એટલે જો ખોરાકમાં ખાંડ-ગોળ લેવા હોય તો એટલાં પ્રમાણમાં અન્ય શર્કરા (સ્ટાર્ચ વગેરે) ઓછી લેવી જોઈએ. મોટા ભાગના લોકો ભૂલ એ કરે છે કે પોતાના રોજિંદા ખોરાકમાં વધારાના ખાંડ-ગોળ ઉમેરે છે. એ રીતે વધારાની કેલરી અને શર્કરા લોહીમાં જાય છે જો ખાંડ-ગોળ ઉમેર્યા હોય તો એટલી જ કેલરી અપાતી અન્ય શર્કરા (કાર્બોહાઇડ્રેટ) ઓછા કરવાથી ડાયાબિટીસના નિયંત્રણમાં આંચ આવતી નથી. સાદા શબ્દોમાં કહીએ તો આખો કપ ખાંડ વગરની ચા પીનાર વ્યક્તિએ ડાયાબિટીસને નિયંત્રણમાં રાખીને ખાંડવાળી ચા પીવી હોય તો કુલ આખાને બદલે અડધો કપ ચા પીવી જોઈએ. એ જ રીતે ખોરાકમાં પાંચ-દશ ગ્રામ ગોળ લીધો હોય તો અડધી રોટલી ઓછી ખાવી જોઈએ. એ જ રીતે ઓછા

માવા-મલાઈ-ધીની મીઠાઈનો નાનો ટુકડો લીધો હોય તો એકાદ રોટલી ઓછી કરી નાંખવી જોઈએ. બીજુ બધુ રોજ કરતાં વધુ પ્રમાણમાં અથવા રોજ જેટલું જ ખાઈને પછી ઉપરથી મીઠાઈ ખાવા જાઓ તો કદી સુગર નિયંત્રણમાં રહેશે નહીં.

ટુકડમાં, તાજેતરના કાળજીપૂર્વક થયેલાં અનેક અભ્યાસો એવું જણાવે છે કે ડાયાબિટીસના દર્દીએ ખાંડ-ગોળને સંપૂર્ણપણે બંધ કરી દેવા જરૂરી નથી. થોડા પ્રમાણમાં, અન્ય ખોરાકને બદલે ખાંડ-ગોળ લેવાથી ડાયાબિટીસના નિયંત્રણમાં કોઈ ફેરફાર થતો નથી. અલબત્તા, અન્ય તંદુરસ્ત માણસોની જેમ ડાયાબિટીસના દર્દીઓએ પણ વધુ પડતાં ખાંડ-ગોળ લેવાનું ટાળવું જોઈએ. દિવસમાં પંદર-વીસ ગ્રામથી વધુ ખાંડ-ગોળ લેવાનું કોઈ પણ વ્યક્તિ માટે હિતાપદ નથી. એવું બની શકે કે અમુક વ્યક્તિ ખાંડ ખાય તો ખાસ કોઈ અસર લોહીની સુગર પર ન જણાય અને અન્ય વ્યક્તિ ખાંડ ખાય તો એનાથી એ વ્યક્તિની લોહીની સુગર વધી જાય. પરંતુ આવું માત્ર ખાડ જ નહીં બીજા બધા ખોરાકથી થઈ શકે.

ડાયાબિટીસને કાબૂમાં રાખવા માટે માત્ર ગળપણ કે ભાત-બટાક બંધ કરીને પોતે સંપૂર્ણ પરેજી રાખે છે એમ માનીને હરખાઈ જવાની જરૂર નથી. ડાયાબિટીસની પરેજીમાં સૌથી અગત્યની પરેજી ખોરાકમાંથી માંસાહાર - ધી - માખણ - મલાઈ બંધ કરીને ખોરાકમાંથી સંતૃપ્ત અને હાઈડ્રોજનેટેડ ચરબી ઘટાડી નાંખવાની છે. આની સાથોસાથ ખોરાકમાં પૂરતાં પ્રમાણમાં રેસા, વિટામિન અને એન્ટી ઓક્સિડન્ટ ધરાવતાં કુદરતી ખોરાક (ફળો, ભાજી, કઠોળ અને આખા ધાન્ય) લેવા ખૂબ જરૂરી છે.

**ડાયાબિટીસના દર્દીએ કયાં ફળ ખાવા?** ફળોમાં રેસા, વિટામીન્સ એન્ટિઓક્સિડન્ટ તત્વો ભરપૂર હોય છે એમાં ચરબીનું પ્રમાણ નહીંવત હોય છે અને એમાં રહેલી શર્કરા ફુકટોઝ સ્વરૂપે હોય છે જે અન્ય શર્કરાની સરખામણીએ લોહીની શુગર વધારવામાં ઓછો ફાળો આપે છે. અલબત્તા, દરેક વ્યક્તિદીઠ, ફળદીઠ અને ખોરાકના સમય તથા અન્ય ખોરાકની હાજરી પ્રમાણે ફળની અસર લોહીની શુગર પર કેવી પડશે તે નકદી થાય છે. સામાન્ય રીતે ફળોનો રસ (જ્યુસ) લેવાને બદલે આખા ફળ લેવા ઈચ્છનીય છે. જ્યાં શક્ય હોય ત્યાં, છાલ સાથે ફળો ખાવાનું પસંદ કરવું જોઈએ. અન્ય ખોરાકની સાથે નાસ્તામાં કે જમવામાં ફળ લઈ શકાય. કચુંબરમાં પણ ફળો બેળવીને ખાવાથી સ્વાદિષ્ટ કચુંબર બને છે. સૂક્ષ્મ ફળોને અનાજ સાથે થોડા પ્રમાણમાં રાંધીને ખાઈ શકાય. જ્યારે ઘરથી દૂર રહો અને ભૂખ લાગે ત્યારે બહારનો તળેલો નાસ્તો ખાવાના બદલે ફળો ખાવા વધુ યોગ્ય છે. શરબત-આઈસ્ક્રીમ વગેરે ખાવાને બદલે ફળોની સ્વાદિષ્ટ વાનગી ખાઈ શકાય. અલબત્તા, દરેક વ્યક્તિની લોહીની સુગર જુદા જુદા ફળ ખાવાથી જુદા જુદા પ્રમાણમાં વધે છે. ઘણાં લોકોમાં કેળા, કેરી, ચીકુ, દ્રાક્ષ વગેરે ફળો ખાવાથી સુગર

જલદી વધી શકે. કયાં ફળ તમારી લોહીની સુગર વધારી નથી દેતા એ જાતે જ જે તે ફળ ખાધા પછી જ લોહીની તપાસ કરાવી જોઈ લેવું જોઈએ અને ત્યાર બાદ ફળની પસંદગી કરવી.

**મેથીના દાણા ખાવાથી ડાયાબિટીસ કાબૂમાં આવી શકે?** તાજેતરમાં થયેલ અનેક અત્યાસોથી એવું જણાયું છે કે નિયમિત ખોરાક સાથે મેથીના દાણાં ખાવામાં આવેતો ડાયાબિટીસ સહેલાઈથી કાબૂમાં આવી જાય છે. જે લોકો બંને વખત જમવાની ૧૫ મિનિટ પહેલાં બે ચમચી (આશરે સાડા-બાર ગ્રામ) મેથીનાં દાણા ખાય અથવા ભૂડો કરીને પાણી કે છાશ સાથે પી જાય એમને ઘણો ફાયદો થાય છે. આગલી રાતથી પલાણી રાખેલ મેથી દાણા કે પછી મેથીનો ભૂડો રોટલી, ઠોસા, ઈડલી, ઉપમા, પૂલાવ, ઢોકળા, દાળ અને કઠીમાં પણ બેળવીને ખાઈ શકાય. મેથીની કડળાસ આ બધી વાનગીમાં હંકાઈ જાય છે. ડાયાબિટીસમાં શુગર કાબૂમાં લેવા માટે મેથીના દાણા ખાવાથી થતો ફાયદો મેથીની ભાજી ખાવાથી થતો નથી. આખા દિવસમાં ૨૫ થી ૫૦ ગ્રામ મેથી ખાવાથી મહત્તમ ફાયદો થાય છે. કયારેક મેથી ખાવાનું શરૂ કરનાર ને શરૂઆતમાં ગેસ, અપચો કે ઝડપ થઈ જાય એવું બને છે. આવું થાય તો ડોઝ ઘટાડી નાંખવો અને થોડા દિવસ પછી એ વધારવાનો પ્રયત્ન કરવો.

**શું ડાયાબિટીસના દર્દીએ વિટામિન, કોમિયમ કે ઝીકની ગોળી લેવી જ પડે?** ડાયાબિટીસના દર્દીમાં વિટામિન કે ઝીકની જરૂરિયાત અન્ય કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ જેટલી જ હોય છે અને એટલે જ્યાં સુધી સંતુલિત ખોરાક (રોટલી, દાળ, ભાત, શાક, દૂધ વગેરે) યોગ્ય પ્રમાણમાં લેવાતો હોય ત્યાં સુધી દર્દીએ કોઈ પણ પ્રકારના વિટામિન, કોમિયમ કે ઝીકની ગોળીની જરૂર હોતી નથી. જેમનો ખોરાક ખૂબ જ મર્યાદિત ખાદ્યપદાર્થવાળો કે ખૂબ ઓછો હોય એમને કયારેક આવી ગોળી-કેપ્સ્યુલ લેવાની જરૂર પડે.

ખોરાક અંગેનાં આ બધાં સૂચનોને ધ્યાનમાં રાખીને દર્દીએ પોતાને માટે એક ખોરાકનું આયોજન કરવું પડે છે અને કાયમ માટે ચુસ્તપણે એને વળગી રહેલું પડે છે. ખોરાકનું આયોજન કરવા માટે ક્યા ખોરાકમાં કેટલી કેલરી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ચરબી તથા ફાઈબર (રિસા) છે તે ધ્યાનમાં લેવું પડે છે આ અંગેનાં તૈયાર કીષ્ટક જીવનશૈલી સંપૂર્ણની ‘સ્વસ્થ આહાર’ નામની પુસ્તિકામાં આપેલ છે.

## ડાયાબિટીસના દર્દીએ શું ખાતું? શું ન ખાતું?

**નીચે મુજબના ખાદ્યપદાર્થ છુટથી ખાવા:-** બધાં અનાજ (શક્ય હોય તો



આખાં/હાથે છઠેલાં / થુલા સાથે); આખા કઠોળ (ફણગાવેલ હોય તો વધુ સારુ); લીલા પાનવાળાં શાક અને ભાજ (કાચા / બાંદેલાં / ઓછા તેલમાં વધારેલાં).

## નીચે મુજબના ખાદ્યપદાર્થ રોજ

**થોડાં પ્રમાણમાં ખાવા:-** જમફળ, આંબળા, પપૈયા, સફરજન, તરબુચ, ટેટી જેવાં ફળો; બે વખત મલાઈ કાઢેલાં દૂધ, દહી, છાશ અને દૂધની અન્ય બનાવટો.




## નીચે મુજબના ખાદ્યપદાર્થ



**શક્ય એટલાં ઓછા ખાવા:-** સુકોમેવો (અખરોટ, બદામ, કાજુ વગેરે); બટાટા, શક્કરિયા જેવા કંદ; કેળાં, કેરી, ચીકુ, દ્રાક્ષ જેવાં ફળો; ખાંડ - ગોળથી ભરપૂર વસ્તુઓ; સરસિયુ, સોયાબીન, મકાઈ અથવા તલનું તેલ (દિવસમાં કુલ રૂ ૪ રૂ ૮ મચ્ચી).

**નીચે મુજબના ખાદ્યપદાર્થ ન ખાવા:-** માંસાહાર; તળેલી અને મોણવાળી વસ્તુઓ; ધી, માખાણ, મલાઈ, ચીજવાળી વસ્તુઓ; માવાની મિઠાઈઓ; આઈસક્રીમ, ઠંડાં પીણાઓ; મેંદાની બનેલ વસ્તુઓ (બિસ્કિટ, પાઉ); દારુ અને અન્ય વ્યસનો.



## ખાંડની અપેજુમાં વાપરવા માટે સેકરીન જેવા પદાર્થો

ખાંડની અપેજુમાં વાપરવા માટે અનેક સેકરીન જેવા પદાર્થોનું ચલણ આજકાલ ઘણું વધ્યું છે. જેમાંથી કેલેરી ન મળે તેવા કૃત્રિમ ગય્યા પદાર્થો (દા.ત. સેકરીન, એસ્પારેટમ, એસીસલેફેમ પોટેશ્યમ વગેરે) ડાયાબિટીસના દર્દીઓ માટે હિતાવહ ગણાય. આવા કેટલાક જાણીતા ગય્યાં પદાર્થોના ફાયદા - ગેરફાયદા નીચે વર્ણવ્યા છે.

(૧) સેકરીન (સ્વિટેક્ષ): ખાંડ કરતા ૩૦૦ થી ૪૦૦ ગણું ગય્યું સેકરીન વર્ષોથી ડાયાબિટીસના દર્દીઓ વાપરતા આવ્યા છે. આ પદાર્થ માત્ર ગય્યો સ્વાદ આપે છે. આ સિવાય એમાંથી કોઈ કેલેરી (શક્તિ) મળતી નથી અને એ માણસના શરીરમાંથી કચરા તરીકે બહાર ફેંકાઈ જાય છે. પ્રાણીઓ ઉપર થયેલ અભ્યાસમાં સેકરીનને કારણે પેશાબની કોથળી પર કેન્સર થાય છે એવું તારણ નીકળ્યું હતું. આ અભ્યાસને આધારે માણસને પણ આવું કેન્સર થવાની શક્યતા નકારી ન શકાય. એટલે આ પદાર્થનો ઉપયોગ શક્ય એટલો ઓછો કરવો જોઈએ.

(૨) એસ્પાર્ટેમ (એસ્પાસ્ટીટ્સ, શુગર-ફી, વન-અપ, ઈકવલ): ખાંડ કરતાં ૨૦૦ ગણો ગય્યો પદાર્થ એસ્પાર્ટેમ, સેકરીનને બદલે વપરાય છે અને સેકરીન કરતાં વધુ સલામત ગણાય છે. અલબતા, લાંબો સમય ગરમ કરવાથી એમાંથી કેટલાક જેરી પદાર્થો છૂટા પડે એવી શક્યતાઓ રહેલી છે. વળી કેટલીક માનસિક અસરો અને બ્રેઇન ટ્યુમર થવાની શક્યતાઓ કેટલાક વૈજ્ઞાનિકોએ રજૂ કરી છે પરંતુ એનો ચોક્કસ ફેસલો હજી નથી આવ્યો.

(૩) એસીસલેફેમ પોટેશ્યમ: આ પદાર્થ પણ ખાંડ કરતાં ૨૦૦ ગણો મીઠો છે. ક્યારેક મોટા પ્રમાણમાં આ પદાર્થ જીબ પર મૂકવામાં આવે તો છેલ્લે સહેજ કડવો સ્વાદ લાગે છે. આ પદાર્થ ગરમ કરવાથી પણ કોઈ જેરી અસર કરતા નથી અને અત્યાર સુધીના બધા આવા પદાર્થોમાં એ સૌથી વધુ સલામત છે.

આમ, ખાંડને બદલે વાપરવાની મીઠી વસ્તુઓના ફાયદા અને ગેરફાયદા બંને છે. ઘણા દર્દીઓમાં અન્ય ખોરાક સાથે, થોડીક ખાંડ ખાવાથી ડાયાબિટીસના નિયંત્રજામાં કોઈ ફરક નથી પડતો. આવા દર્દીઓએ સેકરીન ખાવાની કોઈ જરૂર નથી. પરંતુ જેમનો ડાયાબિટીસ કાબૂમાં રહેતો જ નથી; ખાંડ ખાવાથી શુગર વધી જાય છે; અને ગળપણ ખાંધા વગર ચાલતું નથી એવા દર્દીઓ માટે સેકરીન કે અન્ય મીઠાં રસાયણો ઉપયોગી છે. હિવસની દશ-બાર ગોળી સુધી આડઅસર થવાની સંભાવના ઓછી રહે છે.

## ડાયાબિટીસમાં કસરતનું મહત્વ

ડાયાબિટીસને થતો જ અટકાવવા માટે અને એકવાર થઈ ગયા પછી કાબૂમાં રાખવા માટે કસરત ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને પુષ્ટવચે શરીર થબેલ (તાઈપ-૨) ડાયાબિટીસના દર્દીઓમાં કસરતને કારણે નોંધપાત્ર ફાયદો થતો જણાયો છે.

યોગ્ય માત્રામાં કસરત કરવાથી પેટની આસપાસની ચરબી ઘટે છે. પેટની આસપાસની ચરબી ઘટવાથી ઈન્સ્યુલિનની અસરકારકતા વધે છે. આ ઉપરાંત, કસરત કરવાને લીધે શરીરમાં સ્નાયુઓનો જથ્થો વધે છે, કસરતને લીધે સ્નાયુની અંદરના ૨૮ પ્રકારના તાંત્રણાનું ૨૯ પ્રકારના તાંત્રણમાં રૂપાતંર થાય છે, જેની ઉપર ઈન્સ્યુલિનની વધુ સારી અસર થઈ શકે છે. કસરતને કારણે સ્નાયુઓ પર ઈન્સ્યુલિનને પારખવા માટે જરૂરી રોસેપ્ટર્સમાં પણ વધારો થાય છે. આ ઉપરાંત સ્નાયુઓને મળતા રક્તપ્રવાહમાં અને સ્નાયુઓમાં રહેલ રક્તવાહિનીના કુલ જથ્થામાં કસરતથી લાંબે ગાળે વધારો થાય છે, જેને લીધે લોહીમાં જલુકોઝનું નિયંત્રણ વધુ સારી રીતે થઈ શકે છે.

આ બધા સીધા ફાયદાઓ ઉપરાંત, કસરતને કારણે ડાયાબિટીસના દર્દીઓને અન્ય અનેક લાભ થાય છે. કસરત કરવાથી વજન ઘટે છે અને વજન ઘટવાથી આપોઆપ જ ડાયાબિટીસ કાબૂમાં રહે છે તથા વધુ વજનને લીધે થતાં અન્ય નુકસાનો પણ ઘટે છે. આ જ રીતે કસરતને કારણે હૃદય અને ફેઝસાંની કાર્યક્ષમતા પણ સુધરે છે. હૃદય-ફેઝસાંની કાર્યક્ષમતા વધે એ ડાયાબિટીસના દર્દીમાં ખૂબ જરૂરી હોય છે. ડાયાબિટીસના ઘણા બધા દર્દીઓ ડાયાબિટીસને કારણે હૃદય પર થતા નુકસાનને લીધે મૃત્યુ પામતા હોય છે. જો નિયમિત કસરત કરીને હૃદયને સાબૂત રાખવામાં આવે તો એને નુકસાન થવાની શક્યતા ઘટી જાય છે.



આમ, ડાયાબિટીસથી બચવું છોય તો આજીવી જ કસરત શરીર કરી દો. રોજની ૩૦ થી ૪૫ મિનિટ સુધી ચાલવાની, તરવાની, સાઇકલ ચાલવાની કે અન્ય કોઈ એરોબિક્સ કસરત કરવી દરેક માણસ માટે ખૂબ જરૂરી છે. ડાયાબિટીસ થઈ ગયા પછી પણ એને કાબૂમાં રાખવા માટે નિયમિત કસરત આશીર્વાદપ સાબિત થાય છે. વેદળિફટીંગ જેવી ભારે કસરતને બદલે આવી એરોબીક કસરત વધુ ફાયદો કરે છે.

## ડાયાબિટીસના દર્દીઓ સાલામત રીતે કસરત કરવા માટે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ

(૧) નવેસરથી કસરત શરૂ કરતાં પહેલાં તમારું બ્લડ પ્રેશર, વજન અને બ્લડ શુગર મપાવી લો. પગ, ડિની, આંખ કે હૃદય પર ડાયાબિટીસના કોઈ કોમ્પ્લિકેશન છે કે નહીં તે પણ ડોક્ટરી તપાસ કરાવી જાણી લો.

(૨) તમને કોમ્પ્લિકેશન હોય તો એ મુજબ કઈ કસરત કરવી, એનો નિર્ણય ડોક્ટરની સલાહથી કરવો. જો પગની તકલીફ હોય તો ચાલવાને બદલે સાઈકલ ચલાવવાની કે હાથને કસરત મળે એવા સાધનોથી થતી કસરત પસંદ કરવી જોઈએ. જો આંખની તકલીફ હોય તો ઘરની બહાર કસરત કરવાને બદલે ઘરમાં જ કસરત કરવી જોઈયે.

(૩) કસરત કરતાં પહેલાં બ્લડ શુગરનું પ્રમાણ ૨૫૦ મિ.ગ્રા./ડિ.લી. કરતાં ઓછું અને ૧૦૦ મિ.ગ્રા./ડિ.લી. કરતાં વધુ હોવું જોઈએ, લોહીમાં કીટોન બોડીઝ ન હોવા જોઈએ અને વારંવાર બ્લડ શુગર ઘટી જવાની તકલીફ ન હોવી જોઈએ. આંખની પણ વધારે અથવા વધતી જતી તકલીફ હોય તો ખૂબ ભારે કસરત ન કરવી કારણ કે કસરતથી થતી બ્લડ પ્રેશરની વધ-ઘટ નેત્રપટલને વધુ નુકસાન કરી શકે છે.

(૪) કસરત શરૂ કરતાં પહેલાં ૫-૧૦ મિનીટની સ્નાયુઓ અને સાંધારોને હળવું ખેચાંણ આપતી વોર્મ અપ કસરતો અને બંધ કરતી વખતે ૫-૧૦ મિનિટ ધીમી ઝડપની કૂલ ડાઉન કસરત કરવી જરૂરી છે. વચ્ચેના ૨૦ થી ૩૦ મિનિટના સમયમાં ઝડપભેર હૃદયની મહત્તમ ક્ષમતાના આશરે ૭૦ ટકા ક્ષમતા સુધી પહોંચાય એટલી કસરત કરવી.

(૫) ઈન્સ્યુલિનનું ઈન્જેક્શન લીધા પછી તરત કસરત ન કરવી. જે હાથ-પગમાં ઈન્સ્યુલિન ઈન્જેક્શન લીધું હોય એ હાથ-પગનું હલન-ચલન થાય એવી કસરત કરવા થી ખૂબ ઝડપથી ઈન્સ્યુલિન લોહીમાં ભણી જશે અને બ્લડ શુગરનું પ્રમાણ ખૂબ ઘટી જશે - ચક્કર આવશે કે બેભાન થઈ જવાશે. માટે, જે હાથ-પગમાં ઈન્સ્યુલિન ઈન્જેક્શન લીધું હોય તેની તરત કસરત ન કરવી.

(૬) જો કસરત કરવાથી બ્લડ શુગર ખૂબ વધારે ઘટી જતું હોય તો, કસરત કરવાનાં એકાદ કલાક પહેલાં હળવો નાસ્તો કરી લેવો, અથવા મલાઈ વગરનું દૂધ પીવું. જો અડ્ધા કલાકથી વધુ સમય કસરત ચાલવાની હોય તો વચ્ચે કંઈક ખાતા રહેવું. સાથે ચણાં, મમરાં, ખાખરો કે પીપરમીટ જેવી કોઈ વસ્તુ રાખવી જેથી શુગર ઘટવાના લક્ષણ જણાય તો તરત લઈ શકાય.

## ડાયાબિટીસમાં વપરાતી દવા - ગોળીઓ

જ્યારે ઈન્સ્યુલિનનાં ઈન્જેક્શન લીધા વગર ડાયાબિટીસને કાબૂમાં રાખવાની ગોળીઓ શોધાઈ ત્યારે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો નોંધાયો!! આ વધારો નોંધાવાનું કારણ એટલું જ હતું કે ઘણા બધા લોકો ડાયાબિટીસ આવશે તો ઈન્સ્યુલિનનાં ઈન્જેક્શન લેવાં પડશે એવી બીકે ચેકઅપ જ નહોતા કરાવતા, એ બધા લોકોએ ચેકઅપ કરાવી લીધું અને જેમનામાં ડાયાબિટીસનું નિદાન પાંકું થયું એમણે ડાયાબિટીસને કાબૂમાં રાખવાની ગોળી અપનાવી લીધી! અહીં દવાઓની ચર્ચા સામાન્ય જાણકારી માટે જ કરી છે. ડેક્ટરને પૂછ્યા વગર કોઈ દવા જાતે લેવી નહીં.

ડાયાબિટીસના દર્દીમાં બ્લડશુગર ઘટાડવાનું કામ કરતી આ દવાઓનાં મુખ્ય બે જૂથ છે (૧) સલ્ફોનાઈલયુરિયા અને (૨) બાઈગ્વાનાઈડસ. આજકાલ સલ્ફોનાઈલયુરિયા જૂથની દવાઓનો વપરાશ વધુ થાય છે. સલ્ફોનાઈલયુરિયા જૂથની દવાઓ ઘણાં વર્ષોથી શોધાયેલ છે. અને નવી નવી દવાની શોધ થયા જ કરે છે. એટલે આ દવાઓને બીજા બે પેટા જૂથમાં વહેચ્યવામાં આવે છે - પહેલી પેઢી (First Generation) અને બીજી પેઢી (Second Generation). પહેલી પેઢીની સલ્ફોનાઈલયુરિયા દવાઓમાં ટોલબ્યુતામાઈડ, કલોપ્રોપેમાઈડ, ટોલાજેમાઈડ અને એસિટોહેક્સમાઈડનો સમાવેશ થાય છે. બીજી પેઢીની સલ્ફોનાઈલયુરિયા દવાઓમાં ગ્લીપીઝાઈડ (ગ્લુકોટ્રોલ, ગ્લાઈનેઝ), ગ્લીબેન્કલેમાઈડ (ડિઓનીલ, યુગ્લુકોન, ગ્લાઈબોરલ), ગ્લાઈક્લેજાઈડ (ગ્લાઈસીગોન, ડાયામાઈકોન) વગરે આવે છે. પહેલી પેઢીની દવાઓ કરતાં બીજી પેઢીની દવાઓ દરથી બરસો ગણી વધારે અસરકારક છે! વળી, બીજી પેઢીની દવાઓની આડઅસર પણ પ્રમાણમાં ઓછી છે. આ ફાયદાઓને લીધે ગ્લીબેન્કલેમાઈડ અને ગ્લીપીઝાઈડ જેવી બીજી પેઢીની સલ્ફોનાઈલયુરિયા દવાઓનો વપરાશ વધુ પ્રમાણમાં થાય છે. ગ્લાઈક્લેજાઈડ અને ગ્લીબેન્કલેમાઈડ બંને દવા દિવસમાં માત્ર એક વખત લેવામાં આવે તો પણ આખો દિવસ એની અસર રહે છે. જો કે વધુ ડેઝમાં (બે ગોળીથી વધુ) લેવાની જરૂર પડે ત્યારે દિવસમાં એકને બદલે બે વખત દવા લેવી વધુ હિતાવહ હોય છે.

**સલ્ફોનાઈલયુરિયા દવાઓ કઈ રીતે કામ કરે છે?** ડાયાબિટીસના ઘણા દર્દીઓ એવું જ સમજતા હોય છે કે ઈન્સ્યુલિનના ઈન્જેક્શનને બદલે ઈન્સ્યુલિનની ગોળી આપી છે! હકીકતમાં, હજુ સુધી ગોળી કે કેસ્ટ્યુલના સ્વરૂપે ઈન્સ્યુલિન મળતું નથી કારણ કે જો એ રીતે ઈન્સ્યુલિન લેવામાં આવે તો એ પેટમાં જ પચી જાય છે અને લોહીમાં એની કોઈ અસર દેખાતી નથી.

લોહીમાં ગ્લુકોઝ ઘટાડવા માટે અપાતી સલ્ફોનાઈલયુરિયા દવામાં ઈન્સ્યુલિન નથી

હોતું, પરંતુ આ દવા દર્દીના સ્વાદુપિંડ પર એવી અસર કરે છે કે જેથી દર્દીના સ્વાદુપિંડમાંથી વધારે ઈન્સ્યુલિન લોહીમાં જાય અને વધતા ગ્લુકોઝને નિયંત્રણમાં લે. આમ, આ દવાનું કામ હવાલદાર જેવું છે. જોતે કશું કોઈને આપવું નહીં પણ બે દંડા મારી બીજા (સ્વાદુપિંડ) પાસેથી માલ (ઇન્સ્યુલિન) કઢાવીને જેને આપવાનો હોય (શરીરના કોષો) તેને અપાવી દેવો. જો કોઈ દર્દીના સ્વાદુપિંડમાં ઈન્સ્યુલિન બનાવનાર બધા કોષો નાશ પામ્યા હોય તો, સ્વભાવિકપણે, આ હવાલદાર (સલ્ફેનાઈલયુરિયા દવાઓ) ગમે એટલા દંડા મારે ઈન્સ્યુલિન નીકળવાનું નથી. આ જ કારણસર બાળપણના ઈન્સ્યુલિન આધારિત ડાયાબિટીસના દર્દીઓમાં ડાયાબિટીસની ગોળીઓ કામ નથી આવતી અને ઈન્સ્યુલિનના ઈન્જેક્શન આપવા સિવાય કોઈ રસ્તો નથી રહેતો. અમુક પુખ્તવયના ઈન્સ્યુલિન બિનઆધારિત દર્દીઓમાં પણ લાંબે ગાળે ગોળીઓ ધીમે ધીમે અસર ગુમાવી દે છે અને દર્દીએ છેવટે ઈન્સ્યુલિનનાં ઈન્જેક્શનનો સહારો લેવો પડે છે.

સ્વાદુપિંડમાંથી ઈન્સ્યુલિન લોહીમાં મોકલવા ઉપરાંત, આ દવાઓ શરીરના અન્ય કોષો પર પણ વર્તે ઓછે અંશે અસર કરે છે. કેટલાક કોષો પર ઈન્સ્યુલિનનું સ્વાગત કરનાર રીસેપ્ટરની સંખ્યા વધારી આપે છે, તો કેટલાક પર ઈન્સ્યુલિનની અસરકારકતા!! આ અન્ય કોષો પરની અસરને કારણે જે લોહીમાં ઈન્સ્યુલિનની અસરકારકતા ઘટી ગઈ હોય તે લોહીમાં એ અસરકારકતા વધવા લાગે છે, અને એટલે ગ્લુકોઝનું નિયંત્રણ વધુ સારું બને છે. જો કે દવાની આ અસર ગૌણ છે અને મુખ્ય અસર તો સ્વાદુપિંડ પરની છે એવું મોટાં બાળના વૈજ્ઞાનિકો માને છે. **આ દવા ડાયાબિટીસ મટાડતી નથી - માત્ર ડાયાબિટીસના દર્દીમાં વધી ગયેલ ગ્લુકોઝને તત્પુરતી ઘટાડે છે.** એટલે જ દવા કાયમી લેવી પડે છે.

**સલ્ફેનાઈલયુરિયા જૂથની દવાની આડઅસર શું છે?** સદભાગ્યે, સલ્ફેનાઈલયુરિયા જૂથની દવાઓની આડઅસર બહુ ઓછી અને મામૂલી છે. પહેલી પેઢીની દવાઓ કરતાં બીજી પેઢીની દવાઓની આડઅસર ખૂબ ઓછી થાય છે. સૌથી ખતરનાક અને ઘણી વખત જોવા મળતી આડઅસર લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધુ પડતું ઘટી જવું (હાઈપોગ્લાયસેમીયા-લો શુગર) એ છે. આને જો કે આડઅસર કહેવાને બદલે દવાની વધુ પડતી અસર કહી શકાય કારણ કે દવાનું કામ જ લોહીમાં ગ્લુકોઝ ઘટાડવાનું છે. આ ગ્લુકોઝનું પ્રમાણ જ્યારે ખૂબ ઘટી જાય ત્યારે દર્દીમાં ચક્કર આવવા, આંખે અંધારાં આવવાં, આખા શરીરે પરસેવો થઈ જવો, યાદશક્તિ ઘટી જવી, મગજમાં ગુંચવાડા થવા, લવારા કરવા અને છેવટે બેભાન થઈ જવા સુધીનાં લક્ષણો જોવા મળે છે. ગ્લીબેન્કલેમાઈડ અને કલોરપ્રોપેમાઈડ જેવી દવાથી લોહીમાં ગ્લુકોઝ બયજનક સપાટી સુધી ઘટી જવાની

શક્યતા અન્ય દવાઓ (ગ્લીપિઝાઈડ, ટોલબ્યુટેમાઈડ) કરતાં વધુ હોય છે. અન્ય આઇએસરોમાં ઉલ્ટી અને ગભરામણા, ડમળો, પાંચુરોગ (રક્તકણ ન બનવાથી અને બનેલા રક્તકણ જડપલેર તુટવાથી), ચામડી અને અન્ય જગ્યાઓએ રિએક્શન, શ્વેતકણોનું ઉત્પાદન અટકી જવું વગેરેનો સમાવેશ થાય છે. જો કલોરપ્રોપેમાઈડ દવા લીધા પછી દાડુ પીવામાં આવે તો દાડુનું ભારે રીએક્શન આવી શકે છે. આ પહેલી પેઢીની દવાઓની સાથે એસ્પીરીન, ફીનાઈલબ્યુટાજોન કે સલ્ફા જેવી દવા લેવામાં આવે તો લોહીમાં જડપથી અને વધુ પ્રમાણમાં ગ્લુકોઝ ઘટી જાય છે.

**સલ્ફોનાઈલબ્યુરિયા જૂથની દવા કોને ઉપયોગી છે?** ખોરાકી પરિવર્તનો અને કસરત એ ડાયાબિટીસને કાબૂમાં લેવાના શ્રેષ્ઠ બિનઔષધીય રસ્તાઓ છે અને આ રીતે જેમનો ડાયાબિટીસ નિયંત્રણ માં આવી ગયો હોય તેમને બીજી કોઈ દવા લેવાની જરૂર નથી હોતી. જે દર્દીમાં ખોરાકી પરિવર્તન અને કસરત કરવા છતાં ડાયબિટીસ કાબૂમાં ન આવે એવા પુખ્તવયના ડાયાબિટીસના દર્દીઓમાં સલ્ફોનાઈલબ્યુરિયા જૂથની દવાઓ ઉપયોગી થાય છે. પણ દવાથી કંઈ ડાયાબિટીસ કાયમ માટે મટી નથી જવાનો. એટલે દવાની સાથોસાથ ખોરાકી પરિવર્તનો અને કસરત ચાલુ જ રાખવા પડે છે.

આપણે આગળ જોઈ ગયા કે દવાની અસર થવા માટે શરીરમાં ઈન્સ્યુલિનનો સ્નાવ કરતા સ્વાદુપિંડના કોષો પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ. જો સ્વાદુપિંડના ઈન્સ્યુલિન બનાવતા બધા કોષો નાશ પામ્યા હોય તો આ દવાની કોઈ અસર થતી નથી અને એટલે જ આ દવા બાળપણના (ઈન્સ્યુલિન આધારિત) ડાયાબિટીસમાં અને દશેક વર્ષથી વધુ જૂના પુખ્તવયના (ઈન્સ્યુલિન બિનઆધારિત) ડાયાબિટીસમાં ઉપયોગી થઈ શકતી નથી. આ દવા સગભવિત્યામાં કદી વાપરવી જોઈએ નહીં.

આ દવાનો મુખ્ય ફાયદો એટલો જ છે કે એ લેવાથી ઈન્સ્યુલિનનાં ઈન્જેક્શન લેવાનું મોક્કફ્ફ કે બંધ રાખી શકાય છે. વળી, બહારના ઈન્સ્યુલિનથી અલર્જ થવાની શક્યતાઓ હોય છે જે દવાને કારણે શરીરનું પોતાનું ઈન્સ્યુલિન વધવાથી રહેતી નથી.

**બાઈગવાનાઈડ્સ જૂથની દવાઓ :** બાઈગવાનાઈડ્સ જૂથની દવાઓનો વપરાશ પણ આપણે ત્યાં વર્ષોથી થાય છે. આ જૂથની દવામાં મેટફ્લોર્મીન (ગ્લારસીફેઝ, ડાયાફેઝ, ગ્લાયડોમેટ વગેરે), ફેનફ્રોર્મીન (ડી.બી.આઈ.) અને બ્યુટફ્લોર્મીનનો સમાવેશ થાય છે. આ દવાઓ જેટલું ઈન્સ્યુલિન લોહીમાં હોય એને વધુ અસરકારક બનાવે છે. શરીરના કોષો પર ગ્લુકોઝનું સ્વાગત કરવા માટે રહેલ રીસેપ્ટરની સંખ્યા આ દવાથી વધે છે અને ઈન્સ્યુલિનની અસર ડેઠળ વધુ પ્રમાણમાં

જલુકોઝ શરીરના કોષોમાં ધૂસી જઈ શકે છે. લિવરમાં નવા જલુકોઝનું ઉત્પાદન આ દવાથી અટકી જાય છે અને આંતરડામાંથી વધુ જલુકોઝ લોહીમાં ભળતો અટકે છે. વળી, આ દવાથી દર્દીની ભૂખ મરી જતી હોવાથી દર્દીનો ખોરાક ઘટે છે જેને લીધે દર્દીનું વજન અને ડાયાબિટીસ બંને કાબૂમાં આવે છે. મેટફ્લોર્મિનથી જલુકોઝ ઉપરાંત લોહીમાંની ચરબી પણ નિયંત્રણમાં આવે છે.

આ દવાના આટલા ફાયદા હોવાં છતાં કેટલાક ગેરફાયદા પણ છે. સૌથી મોટો ગેરફાયદો એની જીવલેણ આડઅસર છે. લેક્ટીક એસિડોસીસ તરીકે ઓળખાતી આ આડઅસર ફેનફ્લોર્મિન દવાથી ઘણા લોકોમાં અને મેટફ્લોર્મિનથી અમૃક જ લોકોમાં થતી જોવા મળી છે. ખાસ કરીને જે દર્દીની ડિડની ખરાબ થઈ ગઈ હોય તે લોકોમાં આ દવાની આવી ભયાનક આડઅસર જોવા મળે છે. આ સિવાય આ દવાથી ઉલ્ટી, ગભરામણ, ઝડા, અસુધિ વગેરે સામાન્ય આડઅસરો થાય છે. ક્યારેક વીટામીન બી-૧ રની ઉણપ પણ આ દવાથી ઉભી થાય છે.

મોટા ભાગે આ દવાઓ સલ્ફોનાઈલયુરિયા જુથની દવાની સાથોસાથ આપવામાં આવે છે. (ખાસ કરીને જે દર્દીમાં એકલી સલ્ફોનાઈલયુરિયા દવા અસર જ કરતી હોય એમાં). ઝડા દર્દીઓમાં ખૂબ શરૂઆતના તબક્કામાં એકલી મેટફ્લોર્મિન વપરાય છે. આ દવા બાળપણના ડાયાબિટીસ અને સગર્ભાવસ્થાના ડાયાબિટીસ દરમ્યાન ઉપયોગી નથી થતી અને જોખમી સાબિત થાય છે.

### (3) એકાર્બોઝ:

એકાર્બોઝ (જલુકોબે, ઈકાર્બ, ડાયાકાર્બ વગેરે) નામ ની દવા આંતરડામાં સ્ટાર્ચ, સુંદોજ અને માલ્ટોજ નું પાચન બંધ કરી દે છે, જેને કારણે એમાંથી જલુકોઝ છુટો પડવાનું અને પછી લોહીમાં જવાનું ધીમુ થઈ જાય છે. આ દવા લેવાથી આંતરડમાં પચ્ચા વગરના ખોરાકી ઘટકી જમા થવાને લીધે ગેસ - અપચો જેવી ફરિયાદ દર્દી કરે છે.

### (4) ગ્લીટેગોન:

રોસીઝલીટેગોન અને પાયોર્ગલીટેગોન નામની ગ્લીટેગોન જુથની દવાઓ બાઈવાનાઈડ દવાઓની જેમ કામ કરે છે અને એ ઉપરાંત શરીરમાં જલુકોઝ અને ચરબીનો ઉપયોગ વધારે છે. આ જુથની દવા લેવાથી વજન વધી જવાની શક્યતા રહે છે. આ જુથની પહેલી દવા (ટ્રોઝલીટેગોન) લેવાથી ઘણાં દર્દીઓના લિવરને ભારે નુકસાન થવાથી મૃત્યુ પણ થયા હતા જેને કારણે આ દવા (ટ્રોઝલીટેગોન) પર


પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ જુથની કોઈ પણ દવા ચાલુ હોય તો થોડા થોડા સમયે લિવરની લેબોરેટરી તપાસ કરાવતા રહેવું જરૂરી છે.

#### (૫) મેળીટીનાઇડ:

મેળીટીનાઇડ જુથની દવામાં રેપાળીનાઇડ (યુરેપા, રેપીલીન) અને નેટાળીનાઇડ નો સમાવેશ થાય છે. આ દવાઓ ખોરાક ખાધા પણી તરત લેવાથી લોહીમાં શુગર બહુ વધારે રહેતી નથી. કોઈ વાર શુગર ઘટી જવાની શક્યતા આ દવા લેવાથી થઈ શકે છે. લિવરની તકલીફ વાળા દર્દીઓમાં આ દવા ન આપવી જોઈએ.

ડાયાનિટીસની દવાઓ ડાયાનિટીસ મટાડતી નથી.  
દવા લેવાથી માત્ર ડાયાનિટીસના દર્દીમાં વધી ગયેલ ગ્લુકોગ દવાની  
અસર હોય ત્યાં સુધી ઘટે છે.  
જે દિવસે દવા લીધી એ દિવસે જ એની અસર આય અને દવા બંધ  
કરી એ દિવસથી અસર બંધ!  
આ કારણસર જ ડાયાનિટીસની દવા કાયમી લેતી પડે છે.

## દર્દીઓ માટે આશીર્વાદરૂપ ઇન્સ્યુલિનનાં ઇન્જેક્શન



### શરીરમાં ગલુકોગના વપરાશ માટે જરૂરી કુદરતી ઇન્સ્યુલિન શું છે?

આખા દિવસમાં ખોરાકના પાચનમાંથી આશરે ૪૦૦ થી ૫૦૦ ગ્રામ જેટલો ગલુકોગ લોહીમાં પ્રવેશતો હોય છે. ગલુકોગનું લોહીમાં યોગ્ય પ્રમાણ જળવાઈ રહે એ માટે શરીરના ઘણા બધા અવયવો અને અંતઃઝાવો અવિરત કામ કરતા રહે છે. આંતરડા, લિવર (યકૃત), સ્વાદુપિંડ, સનાયુઓ વગેરે અવયવો ગલુકોગના નિયમનમાં કયાંક ને કયાંક ફાળો આપે છે. એ જ રીતે ઇન્સ્યુલિન, ગલુકાગોન, એશ્રીનાલીન અને ગ્રોથ હોર્મોન જેવા અંતઃઝાવો પણ ગલુકોગના નિયમનમાં અગત્યનો ભાગ ભજવે છે.

જ્યારે ખોરાક વાટે એક સાથે ઘણો બધો ગલુકોગનો જથ્થો લોહીમાં પહોંચે ત્યારે, તરત જ સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન નામનો અંતઃઝાવ નીકળવા માંડે છે. આ ઇન્સ્યુલિનની અસર શરીરના ઘણા અવયવો પર થાય છે. સૌથી અગત્યની અસર લિવર, સનાયુઓ અને ચરબી કોષો પર થાય છે.

સ્વાદુપિંડમાંથી નીકળેલ ઇન્સ્યુલિન લોહીમાં ભણે છે અને આ લોહી સૌથી પહેલાં લિવરમાં પહોંચે છે. એટલે ઇન્સ્યુલિનની અસર પણ સૌથી પહેલાં લિવર પર થાય છે. લિવર, શરીરમાં પહોંચ્યતા ખોરાકના ઘટકોની બેંક જેવું કામ કરે છે. જ્યારે શરીરમાં ગલુકોગ વધી જાય ત્યારે, વધારાના પૈસા જેમ બેંકમાં જમા થાય એમ, લિવર અને સનાયુઓમાં વધારાનો ગલુકોગ જમા થઈ જાય છે. ઇન્સ્યુલિનની અસર હેઠળ, લિવરમાં પહોંચેલ ગલુકોગ, એકબીજા સાથે જોડાઈને ગલાઈકોજન બનાવે છે. આ ગલાઈકોજનને બેંકમાં આવતી ચલણી નોટોના થપ્પા સાથે સરખાવી શકાય. જેમ જેમ નવા ને નવા ગલુકોગના ઘટકો લિવરમાં આવતા જાય તેમ તેમ ગલાઈકોજનનુંપી થપ્પામાં જોડાતા જાય. ઇન્સ્યુલિનની અસરને કારણે નવો

ગ્લાઇડકોજન બનવા ઉપરાંત હાજર ગ્લાઇડકોજનમાંથી ગ્લુકોઝ ફરી છૂટો ન પડવા લાગે એનું પણ ધ્યાન રહે છે.

શરીરના સ્નાયુકોષો અને ચરબીકોષો પર પણ ઈન્સ્યુલિન નોંધપાત્ર અસર કરે છે. આ કોષો (અને શરીરના મોટા ભાગના બધા કોષો) માં ગ્લુકોજના પ્રવેશ માટે ઈન્સ્યુલિન જરૂરી બને છે. લોહીમાં ઘણો બધો ગ્લુકોઝ ફરતો હોય તો પણ, ઈન્સ્યુલિન ન હોય ત્યારે આ ગ્લુકોઝ શરીરના કોષોમાં જઈ નથી શકતો. કોષો પર ઈન્સ્યુલિન અસર કરે ત્યારે કોષોના ગ્લુકોઝ માટેનાં પ્રવેશદ્વાર પૂરાં ખૂલી જાય છે અને નવાં પ્રવેશદ્વાર બનવા માંડે છે. પપરિણામે લોહીમાંથી જડપદ્ધતિ ગ્લુકોજનો જથ્થો કોષોમાં ઢલવાય છે. સ્નાયુકોષોમાં, લિવરની જેમ જ, ગ્લુકોજનો સંગ્રહ ગ્લાઇડકોજન સ્વરૂપે થાય છે. ચરબીકોષોમાં ગમેલ ગ્લુકોઝ, અન્ય ફેટી એસિડ સાથે જોડાઈને ટ્રાયગ્લિસરાઇઝ્સ બનાવે છે, અને એ જ સ્વરૂપે ચરબીકોષોમાં સંઘરાય છે.

આમ, ઈન્સ્યુલિનની અસર હેઠળ, શરીરમાં (ખોરાક લેવાથી) અચાનક વદી ગયેલ ગ્લુકોઝ અને ચરણીના ઘટકો તાત્કાલિક લિવર, સ્નાયુકોષો અને ચરબીકોષોમાં પ્રવેશ અને સંગ્રહ પામે છે. ઈન્સ્યુલિનનો સ્નાવ લોહીમાં ગ્લુકોજના પ્રમાણના સાથે વધે ઘટે છે. ખોરાકમાં વધુ ગ્લુકોઝ લેવામાં આવ્યો હોય તો ઈન્સ્યુલિન પણ વધુ પ્રમાણમાં જરે છે, જે આ ગ્લુકોજને ડેકાઝે પારીને જ જંપે છે. લોહીમાં ૧૮૦ મિ.ગ્રા./ડ.લી. કરતાં વધુ પ્રમાણમાં ગ્લુકોઝ જો રહી જાય તો એ ગ્લુકોઝ કિડની વાટે શરીરની બહાર ફેંકાઈ જાય છે પણ અથી ઓછા પ્રમાણમાં ગ્લુકોઝ હોય તો કિડની એક મિ.ગ્રા. ગ્લુકોઝ પણ પેશાવમાં જવા નથી દેતી. ઈન્સ્યુલિનનો સ્નાવ યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં થાય તો તંદુરસ્ત વ્યક્તિમાં કદી ગ્લુકોજનું પ્રમાણ ૧૮૦-૨૦૦ મિ.ગ્રા./ડ.લી કરતાં વધતું નથી. ગ્લુકોઝ ઉપરાંત પ્રોટીનના પાચનથી મળતા એમિનો એસિડ્સ પણ ઈન્સ્યુલિનનો સ્નાવ વધારે છે. જ્યારે આંતરડામાં ખોરાકનું પાચન થતું હોય ત્યારે આંતરડામાંથી જરતા અંતઃસ્નાવો સ્વાદુપિંડની સંવેદનશીલતા વધારવાનું કામ કરે છે જેથી થોડોક પણ ગ્લુકોઝ આંતરડામાંથી લોહીમાં આવે કે તરત ઘણા બધા ઈન્સ્યુલિનનો સ્નાવ શરૂ થઈ જાય.

આમ, લોહીમાં ગ્લુકોજનું એક ચોકકસ મર્યાદિત પ્રમાણ જાળવી રાખવા માટે શરીરના અનેક અવયવો અને અંતઃસ્નાવો અવિરતપણે કાચશીલ હોય છે. જો આ કામમાં અવરોધ પેદા થાય તો ડાયાબિટીસ (વધુ શુગર) થી માંડીને ‘લો બ્લડશુગર’ (ઓછી શુગર) જેવા રોગો ઉભા થાય છે.

**ઈન્સ્યુલિનનાં ઈન્જેક્શન:** સામાન્ય વપરાશ માટેનું ઈન્સ્યુલિન ગાય કે હુકકરના સ્વાદુપિંડમાંથી મેળવવામાં આવે છે. માનવ ઈન્સ્યુલિન અને પ્રાણીઓના ઈન્સ્યુલિનમાં ઘણું વધું સાખ્ય હોય છે. (માત્ર એક કે બે ફરક સિવાય). ડાયાબિટીસના દર્દીઓ જેટલા પ્રમાણમાં વધી રહ્યા છે એ જોતા, એટલા પ્રમાણમાં

પ્રાણીઓના સ્વાધૃપિંડ મેળવવાનું અશક્ય થઈ જશે એવું લાગતાં હવે ઈન્સ્યુલિન બનાવવાના નવા નુસ્ખાઓ શરૂ થયા છે. આમાં સફળ થયેલ નુસ્ખો જનીન-ઈજનેરી (જેનેટિક ઓંજિનીયરીં)ની મદદથી બનાવવામાં આવતું માનવ ઈન્સ્યુલિન! જે હા, માનવના ઈન્સ્યુલિનમાં એક પણ ફરક વગરનું ઈન્સ્યુલિન, જેનું ઉત્પાદન બેક્ટેરિયા કરે છે! બેક્ટેરિયાના કોષોમાં ઈન્સ્યુલિન બનાવતું જનીન (એનું ડી.એન.આ.) દાખલ કરવામાં આવે છે જેને આધારે બેક્ટેરિયાઓ માત્ર માનવ-ઈન્સ્યુલીનનું જ ઉત્પાદન કર્યા કરે છે. અત્યારે અન્ય ઈન્સ્યુલિન કરતાં મોંઘું મળતું આ માનવ-ઈન્સ્યુલિન સમય જતાં સસ્તું થઈ જશે, કારણ કે હવે બેક્ટેરિયામાં ઈન્સ્યુલિનની ખેતી મોટા પાયે શરૂ થઈ શકશે. આ રીતે મેળવેલ માનવ-ઈન્સ્યુલિનનો બીજો ફાયદો એ છે કે અન્ય ઈન્સ્યુલિનના પ્રમાણમાં આ પ્રકારના જનીન ઈજનેરીની મદદથી મેળવેલ ઈન્સ્યુલિનમાં અશુષ્ઠિનું પ્રમાણ ખૂબ જ ઓછું (નહિવત્ર) હોય છે. એટલે માનવ-ઈન્સ્યુલિન વધુ શુદ્ધ અને વધુ સબળ હોય છે.

**ઇન્સ્યુલિન ઇન્જેક્શનના પ્રકારો:** પ્રાણી કે માનવ ઈન્સ્યુલિન જ્યારે શુદ્ધ સ્વરૂપે વાપરવામાં આવે ત્યારે એની અસર અડ્યા કલાકમાં શરૂ થઈ જાય છે અને છ થી આઠ કલાક સુધી રહે છે. જો કે દરેક વ્યક્તિઠિં અને એક જ વ્યક્તિમાં જુદા જુદા સમય પ્રમાણે ઈન્સ્યુલિનની અસરનો સમય બદલાયા કરે છે. આ સાંદું (પ્લેટન/રેગ્યુલર) ઈન્સ્યુલિન ચામડી નીચે, નસ વાટે કે સ્નાયુવાટે શરીરમાં દાખલ કરી શકાય છે. એ દેખાવમાં પારદર્શક પ્રવાહી જેવું દેખાય છે. સાદા ઈન્સ્યુલિનની અસર માત્ર છ - આઠ કલાક સુધી રહેતી હોવાથી ડાયાબિટીસને કાબૂમાં લેવા માટે દરરોજ આ ઈન્સ્યુલિનમાં ગ્રાન્થી ચાર ઇન્જેક્શન લેવા પડે છે. ઈન્સ્યુલિનનાં ઇન્જેક્શન ઓછાં લેવાં પડે એ માટે સાદાં ઈન્સ્યુલિનના અમુક રસાયણો (પ્રોટીન, ઝીક) વગેરે લેળવવામાં આવે છે. તેથી એક વખત ચામડી નીચે આપેલ ઈન્સ્યુલિન ઇન્જેક્શનમાંથી ઈન્સ્યુલિન ધીમે ધીમે લોહીમાં ભેણે અને તેથી લાંબા સમય સુધી અસરકારક રહે. આપણે ત્યાં લેન્ટે ઈન્સ્યુલિન તરીકે ઓળખાતું દુધિયા રંગનું ઈન્સ્યુલિન આ હેતુ માટે જ વપરાય છે. લેન્ટે ઈન્સ્યુલિનની અસર આશરે એક થી ગ્રાન્થી કલાકમાં શરૂ થાય છે. છ થી બાર કલાકમાં એની મહત્તમ અસર જણાય છે અને અધાર થી ચોવીસ કલાકે એની અસર પૂરી થાય છે. એન.પી.એચ. ઈન્સ્યુલિન તરીકે ઓળખાતું અન્ય એક ઈન્સ્યુલિન પણ લેન્ટે ઈન્સ્યુલિન જેવી અસર કરે છે. આ સિવાય અલ્ફાલેન્ટે અને પી.એડ.આઈ. તરીકે ઓળખાતાં ઈન્સ્યુલિન પણ મળે છે જેની અસર ખૂબ લાંબો સમય ચાલે છે. આ પ્રકારના ઈન્સ્યુલિનની અસર આશરે ચાર થી છ કલાક પછી શરૂ થાય છે અને આશરે અક્ષાવીસ થી છત્રીસ કલાક સુધી એની અસર ચાલુ રહે છે.


આમ, ઈન્સ્યુલિન ઈન્જેક્શનના ગ્રાણ મુખ્ય પ્રકાર છે. (૧) અલ્ફડાલીન અસરવાળું - સાંદું ઈન્સ્યુલિન (એક્ટરેપીડ, રેપીડીઝ, આઈલેટીન આર.) (૨) મધ્યકાલીન અસરવાળું - લેન્ટે (મોનોટાઈડ, લેન્ટાઈડ, જીન્સ્યુલીન, આઈલેટીન-એલ) અને એન.પી.એચ. (ઇન્સ્યુલીટાઈડ, આઈલેટીન એન) ઈન્સ્યુલિન (૩) દીર્ઘકાલીન અસરવાળું - અલ્ટ્રાલેન્ટ (હ્યુમીન્સ્યુલીન-ન્યુ.એલ.) અને પી.જે.ડ.આઈ. ઈન્સ્યુલિન. હવે બજારમાં અલ્ફડાલીન અને મધ્યકાલીન અસરવાળાં (સાંદું અને લેન્ટે) ઈન્સ્યુલિનનું ૩૦:૭૦ના પ્રમાણમાં તૈયાર કરેલ મિશ્રણ (મીક્સટાઈડ, રેપીમીક્સ) મળે છે, જેનાથી જમ્બા પછી તરતનો ગલુડોજ સાદા ઈન્સ્યુલિનથી અને આખા દિવસનો ગલુડોજ લેન્ટે ઈન્સ્યુલિનથી ડાબુમાં આવી જાય છે.

**ઇન્સ્યુલિન સિરીજ:** દરેક પ્રકારના ઈન્સ્યુલિનનો ઉપયોગ જુદા જુદા હેતુઓ માટે જુદી જુદી પરિસ્થિતિમાં થાય છે. બધા પ્રકારનાં ઈન્સ્યુલિન માટે એક સરખી સિરીજ વપરાય છે. જે ઈન્સ્યુલિન સિરીજ તરીકે ઓળખાય છે. આ સિરીજમાં એક મિ.લી. જેટલું ઈન્સ્યુલિન સમાઈ શકે છે અને સિરીજ પર સામાન્ય રીતે ચાણીસ કાપા હોય છે. ઈન્સ્યુલીનનાં સામાન્ય વપરાશનાં ઈન્જેક્શનોમાં એક મિ.લિ. પ્રવાહીમાં ૪૦ યુનિટ હોય છે. એટલે દરેક ઈન્સ્યુલીન યુનિટ માટે એક કાપો. જેટલા યુનિટ ઈન્સ્યુલિન આપવું પડતું હોય એટલાં કાપામાંથી તે આપવું પડે છે. ઈન્સ્યુલીનના કેટલાંક ઈન્જેક્શનોમાં એક મિ.લિ.માં ૪૦ ને બદલે ૮૦ કે ૧૦૦ યુનિટ હોય એવું પણ આવે છે. આવાં વધુ પાવરનાં ઈન્સ્યુલીન ઈન્જેક્શન વાપરતાં પહેલાં એના ડોઝ અંગે ડોક્ટર પાસેથી વિગતે સમજ લેવું જરૂરી છે. હવે એક વખત વાપરીને ફેરી દેવાય એવી પ્લાસ્ટીકની ડિસ્પોઝિબલ સિરીજ પણ મળે છે. પરંતુ એ મૌંધી પડતી હોવાથી મોટા ભાગના દર્દીઓ કાચની વારંવાર વાપરી શકાય એવી સિરીજ જ વાપરે છે.

**દવા કે ઈન્જેક્શનનથી કંઈ ડાયાબિટીસ કાયમ માટે મટી નથી જવાનો.  
એટલે દવાઓ, ખોરાકી પરિવહનો અને કસરત  
કાયમ બિંદગીભર ચાલુ જ રાખવા પડે છે.**


## ઇન્સ્યુલિન ઇન્જેક્શન આપવામાં શું કાળજી રાખવી? ઇન્સ્યુલિન

ઇન્જેક્શન આપવા માટે સામાન્ય રીતે ૨૫ કે ૨૬ નંબર (ગોજ) ની સોય વાપરવામાં આવે છે. આ સોય પણ વાપરીને ફેરી દેવાય એવી (ડિર્પોઝેબલ) અથવા વારંવાર વાપરી શક્ય એવી હોય છે. વારંવાર વાપરવાની સોય અથવા સિરીજને દરેક વપરાશ પહેલાં જંતુમુક્ત કરવી (ઉકળતા પાણીમાં પંદર ભિનિટ સુધી રાખીને ઉકળવી) જરૂરી છે. ઇન્જેક્શન આપવાની જગ્યાની ચામડીને પણ સ્પિરિટ લગાવી જંતુમુક્ત કરવી જરૂરી છે. ઇન્જેક્શન આપતી વખતે ચામડીને બે આંગળી વચ્ચે પકડીને ઉચ્ચી કરવી અને પછી સોય ચામડીમાં કાટખૂંણે દાખલ કરવી. ચામડીની નીચે જ ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન આપવાનું હોય છે, માટે સોય વધુ ઊડી સ્નાયુમાં ન જતી રહે એની કાળજી રાખવી. સોય વધુ ઊડી સ્નાયુમાં જતી રહે તો ઇન્સ્યુલિન ખૂબ ઝડપથી લોહીમાં ભળી જાય છે અને પરિણામે લોહીમાંથી ગલુકોજનું પ્રમાણ પણ વધુ પડતી ઝડપે ઘાટી જાય છે.



## ઇન્સ્યુલિનનાં ઇન્જેક્શન કયાં મુકી


**શક્યા?** : ઇન્સ્યુલિનનાં ઇન્જેક્શન ચામડી નીચે આપવાનું દર્દીએ જાતે જ શીખી લેવું જરૂરી હોય છે. બાવડા, જાંધ, પેટ કે કુલાની ચામડી નીચે આ ઇન્જેક્શન આપી શક્ય! જો એકની એક જગ્યાએ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન વારંવાર આપવામાં આવે તો ત્યાંની ચામડી નીચેની ચરબી નાશ પામે છે. અને ચામડી બેડોળ તથા કડક બની જાય છે. આવું ન થાય એ માટે ઇન્સ્યુલિનનાં ઇન્જેક્શન શરીરના બધા ભાગ ઉપર વારા ફરતી આપ્યા કરવા જોઈએ.



ડાયાનિટીસની આડાસરોની સામે દવા કે ઇન્જેક્શનની આડાસરો બહુ ગૌણ છે.  
ફે.

**ઇન્સ્યુલિન ઇજેક્શનનો સંગ્રહ:** ઇન્સ્યુલિનનાં ઇન્જેક્શન લેવામાં જેટલી તકેદારી રાખવી પડે એટલી જ તકેદારી એના સંગ્રહ માટે પણ રાખવી જરૂરી છે. ઇન્સ્યુલિનને લાંબા સમય સુધી સંઘરવા માટે હંમેશા ૪ થી ૮ અંશ સે. જેટલાં તાપમાને રાખવું જોઈએ. ફીજના ફીજર/ડિપફીજ સિવાયના બધા ભાગમાં આવું તાપમાન હોય છે. બૂલથી પણ ડિપફીજમાં ઇન્સ્યુલિન મૂડી દીવું હોય તો એમાં બરફના કણ થઈ જાય છે અને આવું ઇન્સ્યુલિન નકામું થઈ જાય છે. જે ઇન્સ્યુલિનની બોટલ રોજના વપરાશમાં હોય તેને (ખૂબ વધારે ઠંડી ગરમી બાદ કરતાં) રૂમના તાપમાને છ થી સાત અઠવાડિયાં સુધી રાખી શકાય. પરંતુ જો ખૂબ ઉચ્ચા તાપમાને (દા.ત. રણમાં) ઇન્સ્યુલિન રાખવામાં આવે તો એની અસરકારકતા ઘટી જાય છે અને કયારેક ઇન્સ્યુલિન ઇન્જેક્શન લેવા છતાં દર્દી ઇન્સ્યુલિનની અધિતથી થતાં કોમ્પિલિકેશન અનુભવવા લાગે છે.

### ઇન્સ્યુલિન ઇજેક્શન લેવા માટેનું પેન જેવું સાધન:



ઘણા દર્દીઓએ રોજ જાતે ઇન્જેક્શન લેવાનાં હોય છે. આ દર્દીઓને ઘણી વખત ઇન્સ્યુલિન બાટલીમાંથી યોગ્ય માત્રામાં સિરીજમાં બરવાનું અને પછી કિમતભેર પોતાના જ શરીરમાં સોય નાખવાનું ફસ્પતું નથી હોતું. આવા દર્દીઓ માટે છેલ્લા એક-બે વર્ષથી, ઇન્સ્યુલિન આપોઆપ ઇન્જેક્ટ કરતું પેન જેવું સાધન નીકળ્યું છે. આ સાધનમાં, કેટલા યુનીટનું ઇન્જેક્શન આપવાનું છે એ વિગત પેન પરના આંકડાઓ એડજસ્ટ કરીને મૂડી દેવાની હોય છે. પેનના પાછળના ભાગમાં ઇન્સ્યુલિનનું રીફિલ હોય છે અને આગળના ભાગમાં બટન દબાવતાની સાથે પેનમાંથી બહાર નીકળતી સોય હોય છે. એટલે દર્દી, ચામડી રિપરિટી ચોખ્ખી કરીને પછી પેન ચામડી પર ગોઈવી દે છે પછી માત્ર પેનનું બટન દબાવતાની સાથે જરૂરી માત્રામાં ઇન્સ્યુલિન શરીરમાં દાખલ થઈ જાય છે.

આમ, ઓછી પીડા અને ઓછી માથાકૂટે ડાયાબિટીસના દર્દીઓ જાતે જ ઇન્સ્યુલિનનાં ઇજેક્શન લઈ શકે એવું સરળ આ સાધન છે. અલબત્ત એ કિમતમાં ઘણું મૌંધું છે.

**ઇન્સ્યુલિનને શરીરમાં દાખલ કરવાના નવા તુસ્ખાગ્રાહો : ટેલાંડ**  
 દેશોમાં જેટ ઇન્જેક્ટર તરીકે ઓળખાતી પદ્ધતિ ઇન્સ્યુલિનને શરીરમાં દાખલ કરવા માટે વપરાય છે. આ એક “સોચ વગર અપાતું ઇન્જેક્શન” છે એવું કહી શકાય. જેટ ઇન્જેક્ટર દ્વારા ભારે દબાણ હેઠળ ઇન્સ્યુલિનને ચામરીની આરપાર ધડેલવામાં આવે છે. જેટ ઇન્જેક્ટર દ્વારા અપાયેલ ઇન્સ્યુલિનની અસરકારકતા વધુ હોય છે અને પરિણામે ઓછા ડોઝની જરૂર પડે છે. અલબત્ત, આ પદ્ધતિ પણ “સોચ વગર ઇન્જેક્શન” આપતી હોવા છતાં, દઈ તો આપે જ છે અને જેટ ઇન્જેક્ટરને જંતુમુક્ત (સ્ટરીલાઈઝ) કરવાનું મુશ્કેલ હોય છે.

**ઇન્સ્યુલિન ઇન્ફ્યુઝન પમ્પ તરીકે ઓળખાતી કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમ**  
 પણ આજકાલ પ્રચલિત બની છે. મોબાઇલ ફોનના કદની આ સિસ્ટમ (પમ્પ) નિયત સમયે ચોક્કસ ડોઝમાં ઇન્સ્યુલિન દાખલ કરી આપે છે. શરીરની સાથે બેલ્ટથી બંધાયેલા રહેતા પમ્પમાં લાંબાગાળાના પ્રશ્નો આવે છે. (દા.ત. ચેપ લાગવો, જામ થઈ જવું, ઇન્જેક્ટ ન થઈ શકવું વગેરે). સૌથી લેટેસ્ટ પમ્પ, ચામરીની નીચે મુકવાની ચીપ જેવો છે, જેમાં કોમ્પ્યુટર અને સેન્સરની મદદથી લોહીમાં રહેલું ગલુકોજનું પ્રમાણ અને એ મુજબ શરીરમાં દાખલ કરવાના ઇન્સ્યુલિનનો ડોઝ નકલી થાય અને એ ડોઝ પ્રમાણે ઇન્સ્યુલિન શરીરમાં દાખલ થાય છે. કૃત્રિમ સ્વાહૂપિંડની જેમ જ આ પમ્પ કામ કરે છે. પરંતુ હજુ આ પમ્પ સામાન્ય વપરાશ માટે આવ્યો નથી અને એકવાર શરીરમાં મુક્યા પછી દોઢ-બે વર્ષ આવો પમ્પ બદલવો પડે છે. ભવિષ્યમાં સસ્તા, સરળ અને સલામત ઇન્સ્યુલિન પમ્પ (કૃત્રિમ સ્વાહૂપિંડ) મળતા થઈ જશે તો ડાયાબિટીસના દર્દીઓની માથાકૂટ ઘટી જશે.

દર્દીએ પોતાનું અને ડોક્ટરનું નામ - સરનામુ - ફોન નં.; તથા  
 “મને ડાયાબિટીસની બીમારી છે. જો હું વિચિત્ર વર્તણું કરતો હોઉ  
 કે બેસાન હોઉ તો તરત જ મને ડોક્ટર પાસે લાલ જવા વિનંતી”  
 એવું લખાણ ધરાવતું કાર્ડ પોતાની પાસે રાખ્યું જરી છે.

## સગર્ભાવસ્થા દરમ્યાન ડાયાબિટીસ

કેટલીક સ્ત્રીઓમાં સગર્ભાવસ્થા દરમ્યાન જ ડાયાબિટીસની બીમારીનું નિદાન થાય છે. સગર્ભાવસ્થા દરમ્યાન શુગરનાં નિયંત્રણ માટે વધારે ઈન્સ્યુલિનની જરૂર શરીરને પડે છે. વળી, આ અવસ્થામાં વધુ પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટની પણ ખોરાકમાં જરૂર ઉભી થાય છે. આ બંને પરિબળોને લીધે જે સ્ત્રીઓને મોટી ઉમરે ડાયાબિટીસ થવાની શક્યતા હોય એ સ્ત્રીઓમાં સગર્ભાવસ્થાના ઉત્તરાધીમાં ડાયાબિટીસ દેખાવાની શક્યતા રહે છે.

### સગર્ભાવસ્થા

દરમ્યાન ડાયાબિટીસની બીમારી લાગુ પડે તો કોઈ પણ પ્રકારના બાધ્યલક્ષણો જણાતાં નથી. એટલે દરેક સ્ત્રીમાં છઢા અને સાતમા મહિના દરમ્યાન ગમે ત્યારે ૫૦ ગ્રામ જલુકોઝ પીવાવીને એક કલાક પછી લોહીમાં જલુકોઝનું પ્રમાણ માપવું જોઈએ. જોઆ પ્રમાણ ૧૪૦ મિ.ગ્રા./ડિ.લી. કરતાં વધુ આવે તો ભૂખ્યા પેટે ૧૦૦ગ્રામ જલુકોઝ પીને ત્રાણ કલાકનો જલુકોઝ ટોલરન્સ ટેસ્ટ કરાવવો જોઈએ - જેમાં દર કલાકે લોહીની શુગર માપવામાં આવે છે.

જો ડાયાબિટીસ હોવા છતાં સગર્ભાવસ્થા દરમ્યાન એનું નિદાન અને સારવાર ન થાય તો ગર્ભમાં બાળકનું કદ ખૂબ મોટું (દા.ત. ચાર કિલો ચજનવાળું) થવાની શક્યતા રહે શે અને કયાર(ક મૃતજન્મપણ થાય છે. આ ઉપરાંત જન્મ પછી તરત બાળકના શરીરમાં શુગર કે કેલિયમ ઘટી જવાની તકલીફ થાય છે. જો સગર્ભાવસ્થા શરૂ થાય એ પહેલાથી સ્ત્રીને ડાયાબિટીસ હોય તો કસુવાડ થવાની શક્યતા વધી જાય છે. આ ઉપરાંત, જો સગર્ભાસ્ત્રીને કિંનીને ડાયાબિટીસને કારણે નુકસાન થયું હોય તો ઓછાવજનવાળું બાળક જન્મે છે અને જન્મ પછી બાળકને શાસોશ્વાસની તકલીફ થઈ શકે છે. માતાને પણ સગર્ભાવસ્થા દરમ્યાન ડાયાબિટીસ થવાથી આંખનાં પડદા પર નુકસાન થઈ શકે છે; શુગર અચાનક ઘટી જઈને ચક્કર આવવાની તકલીફ થાય છે.

સગર્ભાવસ્થા દરમ્યાન નિદાન થયેલ ડાયાબિટીસના દર્દીની સારવાર શરૂઆતમાં માત્ર ખોરાકની પરેજથી થાય છે. જો ખોરાકમાં પરેજ રાખવા છતાં લોહીમાં શુગરનું પ્રમાણ ભૂખ્યા પેટે ૧૦૫ મિ.ગ્રા./ડિ.લી. કરતાં વધુ અથવા જમીને બે કલાકે ૧૨૦ મિ.ગ્રા./ડિ.લી. કરતાં વધુ રહે તો ઈન્સ્યુલિનનાં ઈન્જેક્શન શરૂ કરી દેવા જરૂરી છે. સગર્ભાવસ્થા દરમ્યાન ડાયાબિટીસની સારવાર માટે લોહીમાં શુગર ઘટાડી આપતી ગોળીઓની આડઅસર થતી હોવાથી એનો વપરાશ કરી શકાતો નથી. જેમને અગાઉથી ગોળીઓ ચાલુ હોય એમને પણ સગર્ભાવસ્થા દરમ્યાન ગોળી બંધ કરીને ઈન્સ્યુલિન ચાલુ કરવું પડે છે.

## ડાયાબિટીસ સાથેનું જીવન

### ડાયાબિટીસનો કાબૂમાં રાખવા માટે લોહીમાં કેટલી શુગર હોવી જોઈએ?

સાથે દર્શાવેલ ડોષકમાં ડાયાબિટીસના ચુસ્ત નિયંત્રણ માટે શુગરનું પ્રમાણ આપેલ છે જે મુજબ નિયંત્રણ રાખવું જરૂરી છે.


લોહીમાં શુગર (મિગ્રા/ડલી)	નોર્મલ	ડાયાબિટીસમાં હાવું જરૂરી	સારવારમાં ફેરફાર જરૂરી
જમ્યા પહેલાં	૧૧૦થી ઓછી	૮૦ થી ૧૨૦	૮૦ થી ઓછું અથવા ૧૪૦ થી વધુ
જમ્યા પછી બે કલાકે	૧૪૦થી ઓછી	૧૦૦ થી ૧૬૦	૮૦ થી ઓછું અથવા ૧૮૦ થી વધુ
સુતી વખતે	૧૨૦થી ઓછી	૧૦૦થી ૧૪૦	૧૦૦ થી ઓછું અથવા ૧૬૦ થી વધુ
HbA <sub>1c</sub> (%)	૬ થી ઓછું	૭ થી ઓછું	૮ થી વધુ

પાંચ હજારથી વધુ દર્દી પર વીસ વર્ષ સુવી થયેલ અભ્યાસ (યુકેપીડીએસ) માં જણાયું હતુ કે ડાયાબિટીસના દર્દીઓ જેટલું સારુ (નોર્મલ નજીકનું) નિયંત્રણ લોહીની શુગર પર રાખી શકે છે એટલી ડાયાબિટીસના કોમ્પ્લિકેશન થવાની શક્યતા ઘટતી જાય છે. ડાયાબિટીસને કારણે અંધાપો આવવાની કે ડિડની ખરાબ થઈ જવાની શક્યતા ડાયાબિટીસના ચુસ્ત નિયંત્રણથી રૂપ ટકા જેટલી ઘટી જાય છે. જો ડાયાબિટીસના દર્દીને સાથેસાથે હાઇડ્રોક્રેશનની તકલીફ પણ હોય અને એનું પણ ચુસ્ત નિયંત્રણ કરવામાં આવે તો પેરાલિસિસની શક્યતામાં ૪૪ ટકાનો અને હાઈડ્રેલ થવાની શક્યતામાં પછું ૨૮ ટકાનો ઘટાડો થાય છે. ગ્લાઇડોસિલેટ હીમોગ્લોબિન (HbA<sub>1c</sub>) માં દર એક ટકાનો ઘટાડો આંખ, ડિડની કે ચેતાતંત્ર ની તકલીફોમાં રૂપ ટકા અને કુલ ડાયાબિટીસ સંબંધિત મૃત્યુમાં રૂપ ટકાનો ઘટાડો કરે છે.

### ડાયાબિટીસના દર્દીએ લોહી-પેશાબની કષ તપાસ કરાવતા રહેતું જોઈએ?

#### પેશાબની તપાસ: ડાયાબિટીસના


દર્દીમાં સૌથી સહેલી અને સર્સ્તી તપાસ એ પેશાબમાં રહેલ શુગરની તપાસ છે. પાંચ મિ.લી. બેનેરીકટ સોલ્યુશનમાં અડયો મિ.લી. પેશાબ નાખીને પછી ગરમ કરવામાં આવે તો એનો રંગ પેશાબમાં રહેલ શુગરના પ્રમાણ મુજબ - લીલો, પીળો, કેસરી અને લાલ એમ વધતા જતા પ્રમાણમાં - બદલાય છે. હવે બજારમાં મળતી તૈયાર સ્ટ્રીપની મદદથી પણ



પેશાબમાં રહેલ શુગરનું પ્રમાણ જાણી શકાય છે. પેશાબની તપાસની સૌથી મોટી ખામી એ છે કે, લોહીમાં ૧૮૦ મિ.ગ્રા.ડિ.લી. કરતાં વધુ ગ્લુકોઝ થાય તો જ પેશાબમાં શુગર આવે છે. વળી, ઘણા દર્દીઓમાં ડિડનીની કામગીરીની અનિયમિતતાને કારણે પેશાબની શુગર પરથી લોહીની શુગરનો ચોકક્સ અંદાજ મળી શકતો નથી. એટલે ડાયાબિટીસનું ચુસ્ત નિયંત્રણ રાખવા માટે માત્ર પેશાબની તપાસ અપૂર્તી સાબિત થાય છે. અલબત્તા, લોહીની તપાસ નિયમિતપણે ન કરાવવા કરતાં આ સાદી અને સસ્તી તપાસ કરાવવી એ ઉપયોગી જ છે.

### **લોહીમાં રહેલ ગ્લુકોઝ ધેર બેઠાં માપી આપતું સાધન - ગ્લુકોમીટર**

: ધેર બેઠાં જાતે જ ગ્લુકોઝ માંપવા માટેના મશીન ગ્લુકોમીટર તરીકે ઓળખાય છે.



અનેક કંપનીઓનાં આવા મશીનો હવે છૂટથી મળે છે. આવા મશીનમાં એક સ્ટ્રીપ (પાતળી પણી) પર લોહીનું ટીપું મુકીને પણી નિયત સમયે એને મશીનમાં મૂકવાથી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જાણી શકાય છે. આ મશીનોમાં બે જાતની ટેકનોલોજી વપરાય છે. એક ટેકનોલોજીમાં નિયત સમયે લોહીના ટીપાને સ્ટ્રીપ પર મુકીને ચોકક્સ સમય બાદ લૂછવામાં આવે છે અને ત્યારબાદ સ્ટ્રીપને મશીનમાં મૂકવામાં આવે છે. અન્ય પ્રકારના મશીનોમાં આ રીતે ચોકક્સ સમયે સ્ટ્રીપ પરના લોહીને લૂછવાની જરૂર નથી હોતી અને આ

“નોન-વાઇપ” ટેકનોલોજીવાળાં મશીનો વધુ ચોકક્સ પરિણામ આપે છે (અલબત્તા, એની સ્ટ્રીપ મૌંધી આવે છે.)

ગ્લુકોઝનું સારુ નિયંત્રણ જાળવવું હોય તો ગ્લુકોમીટરની મદદથી લોહીમાં ગ્લુકોઝ માપતા રહેવું જોઈએ. મોટાભાગનાં મશીન સાથે ચામડીમાં કાણું પાડવા માટે સ્રીગયુક્ત સોયવાળું સાધન પણ આવે જ છે જેથી લોહી લેવામાં તકલીફ ન પડે. ગ્લુકોમીટરથી માપતાં, જમ્યા પહેલાં લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ૭૦ થી ૧૨૦ મિ.ગ્રા.ડિ.લી. ની વચ્ચે હોવું જોઈએ અને જમ્યા બાદ બે કલાક સુધીમાં ૧૮૦ મિ.ગ્રા.ડિ.લી. કરતાં ઓછું હોવું જોઈએ.

**ડાયાબિટીસ પર ચુસ્ત નિયંત્રણ રાખવા નિયમિત લોહીમાં શુગરની તપાસ કરવી.**


**ગ્લાઇડકોસિલેટેડ હીમોગ્લોબીન:** ડાયાબિટીસના દર્દીમાં છેલ્લા દોઢ-બે મહીના દરમ્યાન લોહીમાં શુગરનું પ્રમાણ કાબૂમાં રહ્યું હતું કે નહીં એ જાણવા માટે ગ્લાઇડકોસિલેટેડ હીમોગ્લોબીન ( $HbA_{1c}$ ) ની તપાસ કરવામાં આવે છે. જ્યારે જમ્યા પછી બે કલાકે લોહીમાં શુગરનું પ્રમાણ ચેક કરવામાં આવે ત્યારે માત્ર એ દિવસે કેટલી શુગર છે એટલી જ જાણકારી મળે છે. રોજ રોજ ખોરાક/કસરત પ્રમાણે આ પ્રમાણમાં મોટી વધઘટ થઈ શકે છે જ્યારે ગ્લાઇડકોસિલેટેડ હીમોગ્લોબીનમાં આવું થતું નથી. એમાં તો છેલ્લા દોઢ-બે મહીના દરમ્યાન સામાન્યત: શુગર કાબૂમાં હતી કે નહીં એનું ચિત્ર મળે છે.

$HbA_{1c}$  નું પ્રમાણ સાત ટકાથી ઓછું રહે તો એ સારું કહેવાય; 7 થી 8 ટકાની વચ્ચે રહે તો સારવારમાં વધુ કાળજીની જરૂર છે એવું કહી શકાય. કોઈક વખત દારૂરિયાઓમાં, કિડનીના દર્દીઓમાં કે થેલેસેમીયા જેવી હીમોગ્લોબીન/કંતકણની બીમારીમાં આ પ્રમાણ ખોટેખોટું વધારે આવે એવું બને છે. એ જ રીતે  $HbS$  અથવા  $HbC$  તરીકે ઓળખાતી હીમોગ્લોબીનની તકલીફમાં આ પ્રમાણ ખોટેખોટું ઓછું આવે છે. અલબાત, આ સિવાયના મોટાભાગના કિસ્સાઓમાં ગ્લાઇડકોસિલેટેડ હીમોગ્લોબીનની તપાસથી ચોકક્સ માહિતી મળે છે.

ડાયાબિટીસના દર્દીઓ દર ત્રણ મહીને માત્ર આ ટેસ્ટ કરાવતા રહે તો ડાયાબિટીસ કાબૂમાં છે કે નહીં એ ખ્યાલ આવી રહે છે. અને દર મહીને શુગર ટેસ્ટ કરવાની જરૂર નથી પડતી.

## ડાયાબિટીસના કાબૂની સાથોસાથ અન્ય શું કાળજી રાખવી?

**બ્લડ પ્રેશરની તપાસ અને નિયંત્રણ:** ડાયાબિટીસનાં ઘણાં બધા દર્દીઓમાં ડાયાબિટીસની સાથોસાથ બ્લડપ્રેશર પણ વધારે રહે છે. જેમને ડાયાબિટીસનું નિદાન થયું હોય એવા વ્યક્તિએ નિદાન થાય ત્યારે અને એ વખતે નોર્મલ હોય તો દર ત્રણ મહિને બ્લડપ્રેશરની તપાસ કરાવી લેવી ખૂબ જરૂરી છે. જો બ્લડપ્રેશર વધારે આવતું હોય તો તાત્કાલિક અનેની પણ સારવાર કરવી આવશ્યક છે. ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશર બેગા થાય ત્યારે આંખ, કિડની અને વ્યદ્ય પર નુકસાન થવાની શક્યતાં ખૂબ વધી જાય છે.



**આંખની સંલાલ :** ડાયાબિટીસને કારણે લાંબે ગાળે આંખના નેત્રપટલને નુકસાન થાય છે અને પરિણામે અંધાપો પણ આવી શકે છે. ડાયાબિટીસને કાયમ કાબૂમાં રાખવાની સાથોસાથ દર વર્ષે આધામાં ઓછી એક વખત આંખના પડદાની

તપાસ આંખના નિષ્ણાત ડોક્ટર પાસે કરાવી લેવી જરૂરી છે. જો તમને દસ્તિમાં જાંણ વળે કે કાળા ધબ્બા દેખાય, અંધારામાં ઓછું દેખાય, આંખમાં હૃદાવો થાય કે એકના ડબલ દેખાય તા તાત્કાલિક આંખના નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. સમયસરની લેસર સારવારથી દસ્તિને થતું નુકસાન અટકાવી શકાય છે.

**મૌની સંભાળ :** ડાયાબિટીસનાં દર્દીઓમાં દાંતના પેઢામાં ચેપ લાગવાનું બહું સામાન્ય પણ જોવા મળે છે. આ ઉપરાંત મૌ-ગળામાં ફુગનો ચેપ લાગવાની શક્યતા પણ ડાયાબિટીસનાં દર્દીમાં વધુ રહે છે. દરેક ટંકે ખાધા પછી નિયમિત બ્રાશથી દાંત સાફ કરવાની ટેવ અને બે દાંત વચ્ચેની જગ્યા દોરીથી રોજ સાફ કરવાની ટેવ દાંતની તકલીફને થતી અટકાવી શકે. દર છ મહિને એક વખત દાંતના ડોક્ટર પાસે દાંતની તપાસ કરાવવી ડાયાબિટીસનાં દર્દી માટે જરૂરી છે.

**ચામડીની સંભાળ :** ચામડી પર ફુગ કે અન્ય ચેપ લાગવાની શક્યતા ડાયાબિટીસમાં વધુ રહે છે. ચામડી પર ચેપ ન લાગે એ માટે ચામડીને નિયમિત સ્વચ્છ અને કોરી (સૂરી) રાખવી જરૂરી છે. ચામડીના જે તે ભાગ એક બીજાના સતત સંપર્કમાં રહેતાં હોય (દા.ત. બે આંગળી વચ્ચે કે જાંઘ પાસે) ત્યાં પરસેવાને કારણે ચામડી ભીની ન રહે એની ખાસ કાળજી રાખવી જરૂરી છે. જો ચામડી પર ક્યાંય ચીરો પડે તો તરત ચોખ્ખા પાણી કે અન્યી સેપ્ટીક સોલ્યુશનથી સાફ કરીને ઉપર ધૂળન લાગે એ માટે સ્વચ્છ જંતુમુક્ત પાટો બાંધી દેવો જોઈએ. જો ગુમ્ફું થાય કે ચેપ લાગે તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.

**પગની સંભાળ :** ડાયાબિટીસનાં દર્દીઓમાં પગની રક્તવાહિની તથા ચેતાઓને નુકસાન થવાથી પગમાં ઈજા થવાની અને ઈજા થયા પછી જલદી ઘા ન રૂઝાવાની તકલીફ થાય છે. ડાયાબિટીસની બીમારી જ્યારે આગળ વધે છે ત્યારે એના પરિણામે અનેક લાંબા ગાળાના કોમ્પ્લિકેશન ઉભા થાય છે. જેમાં પગની તકલીફ ઘણી સામાન્ય છે. ડૉક્ટરોની ભાષામાં ‘ડાયાબિટિક ફૂટ’ તરીકે ઓળખાતી આ તકલીફ, જે દર્દીનો ડાયાબિટીસ સંપૂર્ણ કાબૂમાં ન હોય એ દર્દીમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. કેટલાક દર્દીઓમાં પગ પર વધુ તકલીફ થવાના કારણે છેવટે પગ કાપવવાનો વારો આપે એવું પણ બને છે. એક અંદાજ પ્રમાણે વિકસિત દેશોમાં (જ્યાં ડાયાબિટીસ જેવી બીમારીનું પ્રમાણ વધારે છે ત્યાં) પગ કે એનો કોઈ ભાગ કાપવવાના (એમ્યુટેશનના) કુલ ઓપરેશનમાંથી સાંઠ ટકા ઓપરેશન ડાયાબિટીસના દર્દીઓ ઉપર થાય છે!




ડાયાબિટીસના દર્દીઓમાં થતી પગની તકલીફોથી બચવા માટે સૌથી પહેલું અને અગત્યનું કામ ડાયાબિટીસને સંપૂર્ણપણે નિયત્રણ હેઠળ રાખવાનું છે. ખોરાકની પરેજી, કસરત અને જરૂર પડયે દવાઓ કે ઈન્સ્યુલિનની મદદથી ડાયાબિટીસને કાબૂમાં રાખવાથી ડાયાબિટીસને કારણે ઉદ્ભવતા મોટા ભાગનાં કોમ્પ્લિકેશન કાબૂમાં આવી શકે છે.

જે દર્દીને ડાયાબિટીસ કાબૂમાં નથી રહેતો અથવા વારંવાર કાબૂ બહાર જતો રહે છે એ દર્દીના લોહીમાં ગ્લૂકોઝનું પ્રમાણ ખૂબ વધી જવાથી પગની સંવેદના લઈ જતી ચેતાઓ તથા પગને લોહી પુરું પાડતી ધમનીઓને નુકસાન પહોંચે છે. પગની ધમનીઓને નુકસાન થવાથી પગને પૂરું લોહી પહોંચતું નથી. પરિણામે કંઈ પણ ઈજા થાય કે ચેપ લાગે ત્યારે ઘા જલદી રૂઝાતો નથી. વળી, ચેતાતંતુને નુકસાન થવાથી પગની સંવેદનાઓ ઘટી જાય છે. પગમાં ખાલી ચડી ગઈ હોય કે ઝાણઝાણાટી થતી હોય એવો અનુભવ થાય છે. પોચી ગાદી પર ચાલતા હોય એવું ઘણા દર્દી અનુભવે છે. પગની સંવેદના ઘટી જવાને કારણે કંઈક વાગે ત્યારે દુઃખાવો થતો નથી અથવા ઓછો થાય છે. જેને કારણે વાગવા છાતાં ડાયાબિટીસના દર્દીને એની જાણ નથી થતી અને ઊડા ઘા પડે છે. નાનકડી ઈજા કયારે મોટું સ્વરૂપ ધારણ કરી લે એ ખબર નથી પડી શકતી. નાના ઘસરકામાંથી મોટું ગેન્ચ્રીન થાય અને પગ કપાવવાનો વખત આવે એવું ઘણા કિસ્સામાં બને છે. એક અભ્યાસ પ્રમાણે જે દર્દીને ડાયાબિટીસને કારણે એક પગ કપાવવાનો વખત આવે એ દર્દીને એક પગ કપાવ્યા પછી ત્રણથી પાંચ વર્ષની અંદર બીજો પગ પણ કપાવવો પડે એવી શક્યતા પંચોતેર ટકા કિસ્સામાં રહે છે.

આ ઉપરાંત, જો પગના સ્નાયુઓને હલનચલનનો આદેશ આપનાર ચેતાઓને પણ ઈજા થાય તો જે તે સ્નાયુઓ (વપરાશ ન થવાને કારણે) એકદમ પાતળા થઈ જાય છે. ઘણા ડાયાબિટીસના દર્દીઓના પગ આ રીતે એકદમ પાતળા અને નબળા થઈ જાય છે. મસ્ક્યુલર એટ્રોઝી તરીકે ઓળખાતી આ તકલીફ સામાન્ય રીતે સંવેદના ઓછી થઈ ગયા પછી દેખાતી હોય છે. એને કારણે પગના અંગૂઠાઓમાં વિકૃતિ આવી જાય છે જેમાં અંગૂઠાના મૂળ નીચેની ચામડી જારી થઈ જાય અને અંગૂઠાની ટોચ જમીનથી અધ્ધર રહે એવી તકલીફ થાય છે. ડાયાબિટીસમાં પગને નુકસાન ન થવા દેવું હોય તો નીચે લખ્યા મુજબની પગની વિશેષ કાળજી લેવી ખૂબ જરૂરી છે.



સ્વતપાસ: એક ડાયાબિટીસના દર્દીએ નિયમિતપણે રોજ દિવસમાં ત્રણ વખત પોતાના પગની સ્વતપાસ કરવી ખૂબ જરૂરી છે. જો તમારી દસ્તિ સારી



ન હોય તો કોઈ અન્ય પાસે પગની તપાસ કરાવી લેવી જરૂરી છે. પગમાં લાલાશ, સોજો, કાપા, ખોલ્લા, ચીરા કે ચેપ જેવું જાણાય તો તરત જ એ ભાગની યોગ્ય સારવાર કરવી જરૂરી બની જાય છે.

**સ્વચ્છતા:** પગને સાફ અને કોરો રાખવો ખૂબ જરૂરી છે અને ખાસ તો આવા કાપા, ચીરા, ખોલ્લા વગેરેને ચોખ્ખા, ઉકાળીને ઠંડા કરેલ પાણીથી સાફ રાખવા જોઈએ. જો ઘામાં રેતી કે કચરો જણાતો હોય તો એ દૂર કરવો અને માઈલ એન્ટીસેટીકના ટીપાં નાખેલ પાણી વાપરવું જેથી ચેપ થવાની શક્યતા ઘટી જાય. પાણીથી ઘાને સાફ કર્યા પછી ચેપ હોય તો એન્ટીસેટીક મલમ લગાડવો; નહીં તો માત્ર કોરા ચોખ્ખા કપડાંથી જે તે ભાગને ચોખ્ખો કરી ઘામાં ખૂલ વગેરે ન જાય એ હેતુથી ચોખ્ખું રૂધા ઉપર મુડીને પછી મારી દેવી. દરરોજ ઘાને ચોખ્ખો કરવા આ પ્રમાણે ડેસ્ટીગ કરવું જોઈએ. જો વધુ પડતો ચેપ હોય કે ગૂમું થયું હોય તો ડોક્ટરની સલાહ વહેલી તકે લઈ યોગ્ય સારવાર કરાવવી જોઈએ. પગના નખ કાપતી વખતે ખાસ ધ્યાન રાખવું કે એના ખૂણા છેક અંદર સુધી ન કપાઈ જાય અને નખની બાજુઓ પરની ચામડી જેંચાઈ ન જાય કારણ કે નહીં તો નખ જ ચામડીને ઈજા કરે એવું બની શકે. ખૂલ્લા પગે ચાલવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ.

**પગરખાં:** ચાલવા કે દોડવા માટેનાં બૂટ નિયમિત પહેરવાં જોઈએ. કામના કલાકો દરમ્યાન દર ચાર કલાકે બૂટ બદલી નાખવા જોઈએ. બૂટ બદલવાથી એકની એક જગ્યા પર દબાણ આવવાની શક્યતા ઘટે છે અને બૂટની પગને આરામ અને રક્ષણ આપવાની ક્ષમતા ઘણી વધે છે. ડાયાબિટીસના દર્દીને આ રીતે ચાર કલાકે બૂટ બદલવાથી પોતાના પગની જાત તપાસ કરવાનો મોકો પણ આપોઆપ મળી જાય છે. દરેક વખતે બૂટ પહેરતાં પહેલાં અંદર કંકરી કે કચરો નથી એની પાડી ખાતી કરી લેવી જરૂરી છે. કયારેક પગની સંવેદના ઘટી ગઈ હોવાથી કંકરા ખૂચે તો પણ ખબર ન પડે એવું બનતું હોય છે. જે દર્દીને પગમાં વારંવાર ઈજા થઈને તકલીફો થયા કરતી હોય તેમણે ઊડાં તળીયાંવાળા બૂટ ખાસ પ્રકારના ઓર્થોટીક સપોર્ટ સાથે પહેરવા જોઈએ જેથી પગનાં કોઈ એક જ ભાગ પર દબાણ વધુ ન આવે; પગને વધુ રક્ષણ અને આધાર મળી રહે અને પરિણામે પગને થતું નુકસાન અટકે.



**મોજાં:** બૂટની જેમ જ મોજાં અંગે પણ યોગ્ય કણજી રાખવી જરૂરી છે. પગની સંવેદના ઓછી થઈ ગઈ હોય એવા દર્દીઓએ તો દર ચાર કલાક શુઝની સાથે મોજાં પણ બદલી નાખવા જરૂરી છે. કોટનાં મોજાં ઉત્તમ ગણી શકાય. પગમાં દબાણ આવતા ભાગોએ વધારાની ગાઢી મુકેલ હોય એવાં મોજાં પણ મળતા હોય છે કે દર્દીની જરૂર મુજબ બનાવી શકાય જેથી પગના દબાણ આવતા ભાગ પર ચાંદાં ન પડે.



પગને લોહી પહોંચાડતી મોટી ધમનીઓ સાંકડી થઈ જવાને કારણે લોહી ન પહોંચતું હોય તો એવા દર્દીઓમાં પગની ધમનીને બાયપાસ કરવાનું ઓપરેશન આર્શીવાદરૂપ થઈ શકે, પરંતુ જો પગની ચેતાતંતુઓને નુકસાન થવાથી પગમાં ઈજા થયા કરતી હોય તો એવા દર્દીઓએ ઉપર વર્ષાવેલ પગ સંભાળવાની રીત પર ખાસ ધ્યાન આપવું જોઈએ. પગની યોગ્ય સંભાળ ડાયાબિટીસના દર્દીમાં એક અગત્યનું અને દુઃખદાયક કોમ્પ્લિકેશન ઘટાડવામાં ઉપયોગી થઈ શકે છે. પગ પરનું દબાણ ઘટાડવા અને ડાયાબિટીસને કાબૂમાં લેવા માટે પગની સંભાળની સાથોસાથ શરીરનું વજન ઘટાડવું પણ એટલું જ જરૂરી છે એ દરેક દર્દીએ યાદ રાખવું જોઈએ.

**મનની સંસાર :** ડાયાબિટીસની તકલીફ માનસિક તાણ વધવાથી બેકાબૂ થઈ જાય છે. તણાવમુક્તિની તાલિમ લેવાથી તણાવભરી પરિસ્થિતિમાં પણ મનને સ્વસ્થ રહેતાં શીખવી શકાય છે. યોગાસન - ધ્યાન - સવાશન - ઊડા શાસોશાસ વગેરે તણાવમુક્તિ માટે ઉપયોગી છે. હળવાશભરી પળોને માણસું અને સુખદ ઘટનાઓને યાદ રાખી દુઃખ ઘટના જલદી ભૂલવાની માનસિક તાલિમ લાંબા ગાળાના ફાયદા કરે છે. બિનજરૂરી ચિંતાઓ અને વિચારોથી મનને દૂર રાખવાથી અને સંતોષ - સહિત્યાત્મા વગેરે જેવા સદ્ગુણો કેળવવાથી મન અને શરીર સુખ-શાંતિ અનુભવે છે.

**વ્યસનમુક્તિ :** દારુ અને તમાકુનું કોઈપણ સ્વરૂપે વ્યસન ડાયાબિટીસની તકલીફો વધારી મૂકે છે. કાયમ માટે આ વ્યસનોને સંપૂર્ણપણે જાકારો આપવો ડાયાબિટીસના દર્દી માટે અનિવાર્ય છે. ડાયાબિટીસમાં તમાકુથી,

(૧) હાથ-પગની રકતવાહિનીઓમાંથી જતો રકત પ્રવાહ અવરોધાય છે. ડાયાબિટીસના દર્દીમાં હાથ-પગને લોહી પૂરુ ન મળવાથી થતી ગેન્ન્યીનની તકલીફ, ડાયાબિટીસ સાથે ધુમ્રપાન કરનારામાં ખૂબ વધારે જોવા મળે છે. હાથ-પગ કપાવવા પડે એવી



તકલીફ વાળા ડાયાબિટીસના કુલ દર્દીઓમાંથી ૮૫% દર્દીઓ સાથે તમાકુનું સેવન કરતાં હોય છે.

(૨) કિડની અને ચેતાતંત્રને નુકસાન થવાની શક્યતા ડાયાબિટીસ અને તમાકુનું સેવન ભેગાં થવાથી વધે છે.

(૩) ડાયાબિટીસ અને તમાકું બંને ભેગા થઈને હૃદયરોગ થવાની શક્યતા ત્રણ ગાળી વધારે કરે છે.

(૪) તમાકુના સેવનથી બ્લડ પ્રેશર અને બ્લડ શુગર બંને વધે છે અને પરિણામે ડાયાબિટીસ બેકાબૂ રહે છે જે લાંબે ગાળે ઘણા કોમ્પ્લિકેશન કરી શકે છે.

(૫) તમાકું અને ડાયાબિટીસ બંને ને ડારણે નપૂરંકતા આવી શકે છે.

આટલી બધી તકલીફ વધારી આપનાર તમાકુનું સેવન બંધ કરવાથી આ બધી તકલીફોમાંથી મુક્તિ મળી શકે છે. આ જ રીતે, ડાયાબિટીસના દર્દી દારુનું સેવન કરે તો ડાયાબિટીસ બેકાબૂ થઈ જાય છે અને બધા કોમ્પ્લિકેશન વધી જાય છે. દારુ-તમાકુના વ્યસનથી મુક્તિ ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જરૂરી છે.

**કિડનીની સંબાધ :** ડાયાબિટીસનાં દર્દીમાં લાંબે ગાળે કિડનીને નુકસાન થવાની શક્યતા હોય છે. શુગરનું ચુસ્ત નિયંત્રણ કિડનીને નુકસાનથી બચાવે છે. આ ઉપરાંત, પેશાબમાં માઈક્રોઆલ્બ્યુમીનની તપાસ કરવાથી કિડનીના નુકસાનને શરૂઆતના તબક્કામાં ઓળખી લઈને યોગ્ય દવાઓ શરૂ કરી શકાય છે. ઓછામાં ઓછુ દર છ મહિને લોહીમાં યુરિયા અને ક્રીએટીનીનની તપાસ કરતાં રહીને કિડનીની સ્થિતિ જાળી શકાય.

**હૃદયની સંબાધ :** ડાયાબિટીસનાં દર્દીમાં હાર્ટ એટેક આવવાની શક્યતા ખૂબ વધારે રહે છે. ઓછી ચરબીવાળો ખોરાક, નિયમિત કસરત, વ્યસનમુક્તિ અને માનસિક શાંતિ હૃદયરોગથી શરીરને બચાવવા માટે ખૂબ જરૂરી છે. દર છ - બાર મહિને ડાયાબિટીસનાં દર્દીએ હૃદયને માટે કાર્ડિયોગ્રામ કરાવતાં રહેવું જોઈએ. ડોક્ટરને જરૂર જણાય તો આ ઉપરાંત સ્ટ્રેસ ટેસ્ટ કે ઈક્સો-કાર્ડિયોગ્રાફીની તપાસ ડોક્ટરની સલાહથી કરાવવી જોઈએ.

## પુખ્ત વયે ડાયાબિટીસથી બચવું હોય તો સ્વરથ જીવન શૈલી અપનાવો

આપણાં દેશમાં પુખ્તવયે થતો (ટાઈપ-૨) ડાયાબિટીસ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. જેમ જેમ શહેરીકરણ વધતું જાય છે અને જેમ જેમ શારીરિક શ્રમ ઘટતો જાય છે, તેમ તેમ ડાયાબિટીસનું પ્રમાણ વધે છે. જો ડાયાબિટીસને અટકવવા માટે સામાજિક અને રાષ્ટ્રીય સ્તરે ગુંબેશ ઉપાડવામાં નહીં આવે તો આપણાં દેશના કરોડો નાગરિકો આવતાં દશ-પંદર વર્ષમાં ડાયાબિટીસના શિકાર બની ગયા હશે એ નિર્વિવાદ છે. બેઠાંદું જીવન, વધુ વજન તથા મોટી ફાંદ ડાયાબિટીસના નિમંત્રક છે. મોટે ભાગે હસવામાં જે મુદ્દાઓ લોકો ઉડાડી દે છે, તે વધુ વજન અને મોટી ફાંદ જ હસવામાંથી ખસવું કરી નાંબે છે અને વ્યક્તિને ડાયાબિટીસનો શિકાર બનાવી દે છે.

કેટલાંક લોડોના મનમાં એવી ખોટી માન્યતા ઘર કરી ગઈ હોય છે કે ડાયાબિટીસની બીમારી તો વધુ ગળપણ ખાનાર ને જ થાય! હકીકતમાં ડાયાબિટીસની બીમારી નોતરવામાં ગળપણ કરતાં વધુ ખતરનાક લુભિકા ચરબીની હોય છે. ચરબી એટલે કે ધી-તેલ-માખણ-મલાઈ-માંસાહાર-ચીજ વગેરેમાંથી બીજા કોઈ પણ ખોરાક કરતાં બમણાંથી પણ વધારે કેલરી મળે છે. જ્યારે શરીરની જરૂરિયાત કરતાં વધુ કેલરી શરીરમાં જાય ત્યારે વધારાની કેલરી શરીરની અંદર ચરબીના સ્વરૂપે શરીરમાં જમા થાય છે. જેમ જેમ પેટની આસપાસ ચરબી જમા થયા કરે તેમ તેમ પેટનો ઘેરાવો વધતો જાય છે. પેટના અવયવોની આસપાસ ભેગી થયેલી ચરબી ઈન્સ્યુલિન નામના, ગ્લુકોઝ (શુગર)નું શરીરમાં નિયંત્રણ કરતાં, અંતસ્ત્રાવની અસર ઘટાડી નાંબે છે. શરીરમાં પૂરતાં પ્રમાણમાં ઈન્સ્યુલિનનું ઉત્પાદન થતું હોવા છતાં પેટની આસપાસ જમાં થયેલી ચરબીએ ઈન્સ્યુલિનને સારી રીતે કામ કરવા નથી દેતી જેને પરિણામે પુખ્ત વયે ડાયાબિટીસની બીમારી ઉદ્ભાવે છે.

મોટા ભાગના શહેરના યુવાનો જ્યાં સુધી શાળા-કોલેજમાં હોય ત્યાં સુધી શારીરિક રીતે વધુ સક્રિય હોય છે. પરંતુ પચ્ચીસેક વર્ષની આસપાસથી એમની શારીરિક સક્રિયતા ઘટતી જાય છે અને પેટનો ઘેરાવો વધતો જાય છે. ત્રીસ-પાંત્રીસ વર્ષ શરીરની બેડોળતા સ્વરૂપે ફાંદ દેખાવા માંડે છે. શરીરનું વજન ભલે બહું વધુ ન હોય પણ ફાંદ દેખાવા લાગે એટલે કે પેટનો ઘેરાવો વધવા લાગે એટલે ડાયાબિટીસનું જોખમ પણ વધતું જાય છે. કસરતનો અભાવ અને ખોરાકમાં વધુને વધુ ચરબી ઘરાવતાં ફરસાણ, ફાસ્ટ ફૂડ કે અન્ય ફેશનેબલ ચરબીયુક્ત ખોરાક લેવાથી ચાલીસેક વર્ષની આસપાસ ડાયાબિટીસની બીમારી લાગુ પડી જાય છે. કેટલાંય શહેરી બાળકો પણ યોગ્ય માવજતને અભાવે એકદમ સ્થૂળ અને જાડા થઈ જાય છે. પૂરતી શારીરિક રમત કે કસરતનો અભાવ અને ખોરાકની બેકાળજ નાનપણમાં જ

બાળકના શરીરને રોગીક બનાવી દે છે. જો નાનપણથી સ્વાસ્થ્ય માટે યોગ્ય કાળજી લેવામાં આવે તો ડાયાબિટીસને ચોક્કસપણે અટકાવી શકાય છે. ડાયાબિટીસ અટકાવવા માટે નીચે જણાવેલ સાદા પરંતુ ખુબ જ અગત્યના પગલાં લેવા જોઈએ.

(૧) કુટુંબમાં ડાયાબિટીસનો ઈતિહાસ:- જે વ્યક્તિના મા-બાપ, દાદા-દાદી, કાકા-કૂર્ઝ, માસી કે મામાને ડાયાબિટીસની બીમારી હોય તેમને ડાયાબિટીસ થવાની શક્યતા અન્ય લોકો કરતાં વધુ હોય છે. એટલે દરેક વ્યક્તિએ પોતાના કુટુંબમાં કોને કોને ડાયાબિટીસ છે; એ દરેકને કંઈ ઉમરે લાગુ પડ્યો હતો અને એમાંથી કોણ વધુ વજન કે મોટુ પેટ ધરાવે છે તે જાણી લેવી જરૂરી છે. જો કુટુંબમાં ઘણાં લોકોને ડાયાબિટીસ હોય તો એ વ્યક્તિએ વિશેષ જાળજી રાખવી જોઈએ. યોગ્ય કાળજીથી કુટુંબમાં ડાયાબિટીસની બીમારી હોવા છતાં ૮૮% જેટલાં ડિરસાઓમાં ડાયાબિટીસને ચોક્કસપણે અટકાવી શકાય છે.

(૨) આદર્શ વજન જાળવી રાખો :- જરૂર કરતાં વધારે ચરબી શરીરમાં જમા થાય ત્યારે વ્યક્તિનું વજન વધે છે. આદર્શ વજન કરતાં જેમ જેમ વજન વધતું જાય તેમ તેમ ડાયાબિટીસ થવાની શક્યતા વધે છે. વ્યક્તિનું આદર્શ વજન કેટલું હોવું જોઈએ તે એની ઊચાઈના આધારે નકદી થાય છે. ભારતીય પુરુષોમાં વ્યક્તિનું આદર્શ વજન = (૨૧) ગુણ્યા (મીટરમાં માપેલ ઊચાઈનો વર્ગ). એટલે કે પાંચ ફૂટ (=૦.૧૫ મીટર) ઊચાઈ ધરાવતાં વ્યક્તિનું આદર્શ વજન = (૨૧) ગુણ્યા (૦.૧૫) ગુણ્યા (૦.૧૫) એટલેકે ૪૭.૨૫ કિલોગ્રામ! આ વિષયની વધુ માહિતિ જીવનશૈલી સંપૂર્ણી “મેદવૃદ્ધિ” નામની પુસ્તિકામાં મળી શકશે. જેમનું વજન વધારે હોય છે તેઓ જો માત્ર પોતાના કુલ વજનમાંથી પાંચથી દશ ટકા જેટલું વજન ઘટાડી શકે તો ડાયાબિટીસ થવાની શક્યતા પછી ટકા જેટલી ઘટી શકે છે. બીજા શબ્દોમાં સીતેર કિલો વજન ધરાવનાર જાડી વ્યક્તિ પોતાના વજનમાં ચારથી સાત કિલો જેટલો ઘટાડો છ મહિનાના ગાળામાં કરી શકે અને પછી એટલું વજન જાળવી રાખે તો ડાયાબિટીસ થવાની શક્યતા અડધી થઈ જશે.

(૩) શારીરિક સક્રિયતા:- શારીરિક સક્રિયતા વધારવાથી પણ ડાયાબિટીસને અટકાવવામાં મદદ મળે છે. રોજની ઓછામાં ઓછી ત્રીસ મિનિટ જડપથી ચાલવાની કે અન્ય કસરત કરવાથી ડાયાબિટીસને થતો જ અટકાવી શકાય છે. વજન ઘટાડવા માટે પણ વધુને વધુ શારીરિક સક્રિયતા ઉપયોગી થાય છે. ચાલવાની કસરત કરવા ઉપરાંત દિવસભર જ્યાં મોકો મળે ત્યાં શરીરને હલન ચલન આપતાં રહેવું ઉપયોગી થાય છે.

(૪) સપ્રમાણ પેટ:- તમારા શરીરમાં પેટના ભાગે જમા થયેલી ચરબી તમને અનેક બીમારી આપે છે. સાદી માપપદ્ધીની મદદથી તમે તમારા પેટનો ધેરાવો જાતે જ માપી શકો છો. ભારતીય લોકોમાં પેટનો ધેરાવો ૮૦ કે ૮૫ સે.મી.થી ઓછો

હોય તો ડાયાબિટીસ જેવી બીમારી થવાની શક્યતા ખુબ ઓછી રહે છે. આ અંગે વધુ સંશોધન ચાલુ છે અને ભારતીય પુરુષ અને સ્ત્રીના પેટના આદર્શ ઘેરાવાના ચોક્કસ માપ થોડા સમયમાં નકદી થઈ શકશે.

**(૫) નિયમિત તથીબી તપાસ :-** ત્યે થી ત્યે વર્ષની વયના લોકોએ ડાયાબિટીસ ને થતો જ અટકાવવા માટે નિયમિત દાકતરી તપાસ કરાવતા રહેવું જોઈએ. ડોક્ટરની સલાહ મુજબ ભૂખ્યા પેટે અને જમીને (અથવા ગ્લૂકોઝ પીને) બે કલાકે લોહી પેશાબમાં શુગરનું પ્રમાણ મપાવતા રહેવું જોઈએ. જેમનું વજન કે પેટનો ઘેરાવો વધારે હોય એમણે તો ખાસ આ પ્રમાણે તપાસ કરાવતા રહી જરાપણ વધારે શુગર આવે તો તરતજ ખોરાક ની પરેજ અને કસરતનો અમલ શરૂ કરી દઈ ડાયાબિટીસ થતા પહેલાં જ એને કાયમી જાકારો આપી દેવો જોઈએ

ડાયાબિટીસ નોંતરી શકે એવા પરિબળો ને પહેલેથી ઓળખી યોગ્ય જીવનપદ્ધતિ અપનાવી ડાયાબિટીસ ને થતો જ અટકવી શકાય છે, માત્ર આ માટે જરૂર છે - જાગૃતિ અને દફન નિશ્ચયની.

\*\*\*\*\*

### ડાયાબિટીસથી બચવું હોય તો આજે જ જાગો....

- (૧) વજન નોર્મલથી વધે નહીં એનું ધ્યાન રાખો. આદર્શ વજન બરાબર તમારી મીટરમાં માપેલ ઊચાઈનો વર્ગ ગુણ્યા એકવીસ.
- (૨) પેટનો ઘેરાવો થાપાના ઘેરાવા કરતાં ૮૦ ટકાથી ઓછો હોવો જોઈએ.
- (૩) નિયમિત ૩૦ મિનિટ ચાલવાની કે અન્ય કસરત કરો.
- (૪) ખોરાકમાં શક્ય એટલા વધુ રેસાયુક્ત ખાદ્યપદાર્થો (કઠોળ, શાકભાજ, ફળો અને આખાં ધાન્યો) વાપરો.
- (૫) મેંદાવાળી, ખાંડવાળી અને ધી-તેલથી ભરપૂર વસ્તુઓ ખાવાનું શક્ય એટલું ઓછું કરો.
- (૬) માનસિક તાજા ન થાય એ પ્રમાણે કામનું આયોજન કરો. નિયમિત યોગ - ધ્યાન અને મનોશાંતિના પ્રયત્નો કરો.
- (૭) બાળપણના ડાયાબિટીસને અટકાવવા માટે રસીની શોધ ચાલી રહી છે, જે સફળ થાય તો બાળપણના ડાયાબિટીસથી બાળકોને બચાવી શકશે.